

તા.૦૮/૧૧/૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મળેલ સામાન્ય સભાની કાર્યનોંધ
સભામાં હાજર રહેલા સભ્યશ્રીઓ.

અ.નં.	સભ્યશ્રીઓના નામ	હોદ્દો
૧	પટેલ કિન્નરીબેન અમિષભાઈ	પ્રમુખ
૨	ભંડારી કિરણભાઈ પરભૂભાઈ	ઉપપ્રમુખ
૩	ટોલ નિમિષાબેન ગીરીશભાઈ	સભ્ય
૪	પાનવાલા વર્ષાબેન અમિતકુમાર	સભ્ય
૫	રાઠોડ રાજેશભાઈ દશરથભાઈ	સભ્ય
૬	પટેલ ઉજ્જેશકુમાર ઈશ્વરભાઈ	સભ્ય
૭	પટેલ છાયાબેન ઉમેશભાઈ	સભ્ય
૮	પટેલ ઉર્વશીબેન રાજેશભાઈ	સભ્ય
૯	પટેલ રાજેશભાઈ મંગુભાઈ	સભ્ય
૧૦	રાણા હિતેશભાઈ સુરેશભાઈ	સભ્ય
૧૧	પટેલ દિવ્યાબેન કલ્પેશભાઈ	સભ્ય
૧૨	રાણા મહેમુદા ઈસ્માઈલભાઈ	સભ્ય
૧૩	વાડીવાલા મહેન્દ્રભાઈ ભગુભાઈ	સભ્ય
૧૪	દેસાઈ ગીરીશભાઈ ભગવાનજી	સભ્ય
૧૫	ઠાકોર કમળાબેન અવધેશકુમારસિંગ	સભ્ય
૧૬	રાજાણે ચેતનાબેન રાકેશભાઈ	સભ્ય
૧૭	પટેલ વિજય સહદેવભાઈ	સભ્ય
૧૮	ચૌહાણ સંજય દશરથરાવ	સભ્ય
૧૯	પટેલ મનીષા વિજય	સભ્ય
૨૦	ભાનુશાલી કલ્પના રાજેશભાઈ	સભ્ય
૨૧	ભાનુશાલી પ્રવિણભાઈ પરસોત્તમભાઈ	સભ્ય
૨૨	પટેલ ભારતીબેન મનોજભાઈ	સભ્ય
૨૩	સોલંકી સોનલબેન તેજશભાઈ	સભ્ય
૨૪	માળી યશોષ જયસુખભાઈ	સભ્ય
૨૫	શેખ સબીનાબેન સાજિદભાઈ	સભ્ય
૨૬	પટેલ રમેશભાઈ મંગળદાસ	સભ્ય
૨૭	કાઝી ઈમ્તિયાઝૂદીન મીયા મોહમદ	સભ્ય
૨૮	દેસાઈ ઉર્મિ આશિષકુમાર	સભ્ય
૨૯	પટેલ જેસ્ટીકાબેન દર્શનભાઈ	સભ્ય
૩૦	પટેલ ધર્મેશભાઈ અરવિંદભાઈ	સભ્ય
૩૧	આહિર પંકજભાઈ ઠાકોરભાઈ	સભ્ય
૩૨	આહિર રૂષિકાકુમારી પ્રિયાંકકુમાર	સભ્ય
૩૩	ઓઝા ડૉ. પુષ્પાબેન રામજોર	સભ્ય

૩૪	પટેલ ભરતભાઈ છોટુભાઈ	સભ્ય
૩૫	વશી નિતેશભાઈ મહાદેવભાઈ	સભ્ય
૩૬	પટેલ ધર્મેશભાઈ અરૂણભાઈ	સભ્ય
૩૭	પટેલ પ્રવિણભાઈ સોમાભાઈ	સભ્ય
૩૮	પટેલ હેતલકુમારી જયેશભાઈ	સભ્ય
૩૯	પટેલ પ્રવિણાબેન સુનિલભાઈ	સભ્ય
૪૦	પઠાણ મહેબુબ ગુલશેરખાન	સભ્ય

સભાની શરૂઆત વંદેમાતરમ થી કરવામાં આવી...

પ્રમુખશ્રીએ જણાવ્યું કે આજની આ સભામાં ઉપસ્થિત સૌ મારા સાથી સભ્યશ્રીઓ તેમજ ચીફ ઓફિસરશ્રી વસાવા સાહેબ, અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, પત્રકાર મિત્રો, ઈલેક્ટ્રોનિક મીડીયાના મિત્રો, નગરજનોસૌને આવકારું છું.

વલસાડ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં

- (૧) પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી
- (૨) પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશવભાઈ પટેલ
- (૩) પૂર્વ મંત્રી અને ધારા સભ્યશ્રી દોલતભાઈ દેસાઈ
- (૪) માજી ચીફ ઓફિસરશ્રી બુધાભાઈ પટેલ
- (૫) માજી સભ્યશ્રી કૈલાશનાથ પાંડેય
- (૬) માજી સભ્યશ્રી રમણભાઈ પટેલ
- (૭) માજી સભ્યશ્રી રાજુભાઈ કુંકણા
- (૮) માજી કર્મચારીશ્રી સુભાષભાઈ મોદી

તેમજ કોવીડ-૧૯ માં નામી અનામી સ્વગેસ્થ તમામની આ તબક્કે નોંધ લઈ તેઓશ્રીની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલી આપી અને સૌએ ૨ મીનીટનું મૌન પાડ્યું.

પ્રમુખશ્રીએ જણાવ્યું કે સૌને મારા નમસ્કાર

પ્રમુખશ્રી બન્યા બાદ આજની પ્રથમ સભામાં આવકારતા આનંદની લાગણી અનુભવું છું. નગરમાં ચાલી રહેલ કામો માટે તમામ સભ્યશ્રીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું.

સભામાં નગરપાલિકાના અપક્ષ ચુંટાયેલા સભ્યોશ્રી નિતેશ વશી , શ્રી મહેબુબખાન જી.

પઠાણ(ઝાકીર) ,શ્રી યશોષ માલી તથા શ્રી રમેશભાઈ પટેલ (ડેની) નું ભાજપમાં વિધિવત દાખલ થતાં

પ્રમુખશ્રી તથા ભાજપના શાસકપક્ષના નેતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

સભ્યશ્રી નિતેશભાઈ વશી દ્વારા જણાવવાનું કે , નગરપાલિકાના હાર્ટસમા સ્ટેશન રોડ કલ્યાણબાગ સામેના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ફા.પ્લોટ નં-૧૨૭ વાળી જમીનોમાં કુલ-૫૯ જેટલી નવરંગ લસ્સી સહિતની કાચી-પાકી કેબીનો આવેલ હતી. સદરહુ જગ્યા પાર્કિંગ પ્લોટ માટે રીઝર્વ હતો. આ પ્લોટના આજુ-બાજુ એસ.ટી.ડેપો, રેલ્વે સ્ટેશન આવેલ હોય, જેથી ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હતું. ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને જાહેરહિતમાં આ પાર્કિંગ પ્લોટ ખુલ્લો કરવો ખુબજ જરૂર હતો. જેથી વહીવટી તંત્ર તથા પોલીસ ખાતાના સહકાર મેળવી ૫૯ દુકાનો/કેબીનોનું જે મેગા ડીમોલીશન કરેલ છે. જે કરેલ કામગીરી ખરેખર પ્રશંનીય અને ધન્યવાદને પાત્ર હોય , તેમની આ કામગીરી વલસાડ શહેરની જનતાને ખુબજ લાભદાયી છે. અને સદરહુ કરેલ કામગીરી અન્વયે ટ્રાફિકનો જે પ્રશ્ન છે તેને હલ કરવાથી જનહિતમાં બહાદુર ભરી પ્રશંનીય કરેલ કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરું છું. ભવિષ્યમાં જનહિતમાં વધુ આવી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવી.

પ્રમુખશ્રીઓ સભાનું કામકાજ આગળ વધારવા એજન્ડાના કામો રજુ કરવા જણાવ્યું ,
સભ્યશ્રી રાજેશભાઈ પટેલે જણાવ્યું કે ડૉ.રોહનભાઈ પટેલ કોવીડ-૧૯ માં મ્યુનિસિપલ
હોસ્પિટલમાં કરેલ કામગીરી બિરદાવવા લાયક છે. કોરોના વોરીયસે સારી કામગીરી કરેલ છે. તેમજ
કૈલાશનાથ પાડેના પિતાશ્રીના નામે ભાઈલાલ પટેલ રોડનું નામકરણ કરી તકતી મુકવા છીપવાડ
હનુમાનજી મંદિરથી રેલ્વે ગરનાળા સુધીના રસ્તા તેમજ આઝાદ ચોક થી મોરારજી દેસાઈ રોડનું
નામકરણ કરવા સુચન કર્યું.

પ્રમુખશ્રીએ સંમતિ દર્શાવી સ્ટેચ્યું મુકવા જણાવ્યું.

સ.મ.મંજુર.

કામ નં-૧

વિષય : તા.૨૮-૦૧-૨૦૨૦ ના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યનોંધ વંચાયેલી ગણી કન્ફર્મ કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ. ઉર્મિબેન દેસાઈ

ઠરાવ :- પ્રમુખશ્રી કાર્યનોંધ દરેક સભ્યશ્રીઓને આપવામાં આવેલ છે. જેમને વાંધો હોય તેઓ વાંધો નોંધાવે.

સભ્યશ્રી ઉજ્જેશભાઈ પટેલ સંસ્થા હિતની કામગીરી રજુ કરીએ છીએ. ગત સામાન્ય સભા તા.૨૮-૦૧-૨૦૨૦ ના રોજ મળેલ સમગ્ર સભાની કાર્યનોંધ દરેક સભ્યશ્રીઓને પાઠવવામાં આવેલ છે. જે વંચાયેલ ગણી ઉપરોક્ત રજુ કરેલ સભ્યશ્રીઓની આવેલ રજુઆતોની નોંધ લઈ મંજુર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર.

કામ નં. ૨

વિષય : નામદાર સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી ફાળવવામાં આવેલ છોટા હાથી ટેમ્પાનું રજી.નં. GJ-15-G-345, રીપેરીંગ કામ કરાવવા અંગેનું આવેલ બીલ રૂ. ૬૯,૭૪૯/- મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ. પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. ૪૬/ તા.૧૮-૦૭-૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી નગરપાલિકાને ટાટા કંપનીના છોટા હાથી ટેમ્પા નંગ-૬ (છ) ફાળવવામાં આવેલ હતા. તે પૈકી ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર : GJ-15-G-346, હાલે બંધ હાલતમાં હોઈ તેનું રીપેરીંગ કામ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. ટાટા કંપની તરફથી તેના વાહનોનું રીપેરીંગ કામ / સર્વિસ વિગેરે કરવા માટે કંપનીના ઓથોરાઈઝડ ડીલરો પાસેજ કરાવવામાં આવે છે તે મુજબ વલસાડ કે તેની આજુબાજુના વિસ્તાર માટે શ્રી લક્ષ્મીકૃપા ઓટો સર્વિસ (LLP) શંકર તળાવ, ડુંગરી, ને.હા.નં.: ૦૮,તા.જી.વલસાડ કે જેઓ ટાટા કંપનીના ઓથોરાઈઝડ ડીલર છે તેમની પાસે આ ટેમ્પાનું રીપેરીંગ કામ કરાવેલ તેનું આવેલ બીલ રૂ. ૬૯,૭૪૯/- પુરાનું બીલ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર..

કામ.નં. - ૩

વિષય.: ના.સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી ફાળવવામાં આવેલ છોટા હાથી ટેમ્પાનું રજી. નં.GJ-15-G-346,રીપેરીંગ કામ કરાવવા અંગેનું આવેલ બીલ રૂ.૬૯ ,૨૪૪/-મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ. પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૪૬/ તા.૧૮-૦૭-૨૦૨૦ ના.સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી નગરપાલિકાને ટાટા કંપનીના છોટા હાથી ટેમ્પા નંગ-૬ (છ) ફાળવવામાં આવેલ હતા. તે પૈકી ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર : GJ-15-G-346 હાલે બંધ હાલતમાં હોઈ તેનું રીપેરીંગ કામ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. ટાટા કંપની તરફથી તેના વાહનોનું રીપેરીંગ કામ / સર્વિસ વિગેરે કરવા માટે કંપનીના ઓથોરાઈઝડ ડીલરો પાસેજ કરાવવામાં આવે છે તે મુજબ વલસાડ કે તેની આજુબાજુના વિસ્તાર માટે શ્રી લક્ષ્મીકૃપા ઓટો સર્વિસ (LLP) શંકર તળાવ, ડુંગરી, ને.હા.નં.: ૦૮,તા.જી.વલસાડ કે જેઓ ટાટા કંપનીના ઓથોરાઈઝડ ડીલર છે તેમની પાસે આ ટેમ્પાનું રીપેરીંગ કામ કરાવેલ તેનું આવેલ બીલ રૂ.૬૯,૨૪૪/- પુરાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર..

કા.નં. - ૪

વિષય.: ના.સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી ફાળવવામાં આવેલ છોટા હાથી ટેમ્પાનું રજી. નં.GJ-15-G-347,રીપેરીંગ કામ કરાવવા અંગેનું આવેલ બીલ રૂ.૬૮,૮૨૨ /-મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ. પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૪૭/ તા.૧૮-૦૭-૨૦૨૦ ના.સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી નગરપાલિકાને ટાટા કંપનીના છોટા હાથી ટેમ્પા નંગ-૬ (છ) ફાળવવામાં આવેલ હતા. તે પૈકી ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર : GJ-15-G-347, હાલે બંધ હાલતમાં હોઈ તેનું રીપેરીંગ કામ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. ટાટા કંપની તરફથી તેના વાહનોનું રીપેરીંગ કામ / સર્વિસ વિગેરે કરવા માટે કંપનીના ઓથોરાઈઝડ ડીલરો પાસેજ કરાવવામાં આવે છે તે મુજબ વલસાડ કે તેની આજુબાજુના વિસ્તાર માટે શ્રી લક્ષ્મીકૃપા ઓટો સર્વિસ (LLP) શંકર તળાવ, ડુંગરી, ને.હા.નં.: ૦૮,તા.જી.વલસાડ કે જેઓ ટાટા કંપનીના ઓથોરાઈઝડ ડીલર છે તેમની પાસે આ ટેમ્પાનું રીપેરીંગ કામ કરાવેલ તેનું આવેલ બીલ રૂ.૬૮,૮૨૨/- પુરાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર..

કા.નં. - ૫

વિષય.: ના.સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી ફાળવવામાં આવેલ છોટા હાથી ટેમ્પાનું રજી. નં.GJ-15-G-289 રીપેરીંગ કામ કરાવવા અંગેનું આવેલ બીલ રૂ.૧,૧૧,૮૬૩/- મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૪૮/ તા.૧૮-૦૭-૨૦૨૦ ના.સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન તરફથી નગરપાલિકાને ટાટા કંપનીના છોટા હાથી ટેમ્પા નંગ-૬ (છ) ફાળવવામાં આવેલ હતા. તે પૈકી ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર : GJ-15-G-289, હાલે બંધ હાલતમાં હોઈ તેનું રીપેરીંગ કામ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. ટાટા કંપની તરફથી તેના વાહનોનું રીપેરીંગ કામ / સર્વિસ વિગેરે કરવા માટે કંપનીના ઓથોરાઈઝડ ડીલરો પાસેજ કરાવવામાં આવે છે તે મુજબ વલસાડ કે તેની આજુબાજુના વિસ્તાર માટે શ્રી લક્ષ્મીકૃપા ઓટો સર્વિસ (LLP) શંકર તળાવ, ડુંગરી, ને.હા.નં.: ૦૮,તા.જી.વલસાડ કે જેઓ ટાટા કંપનીના ઓથોરાઈઝડ ડીલર છે તેમની પાસે આ ટેમ્પાનું રીપેરીંગ કામ કરાવેલ તેનું આવેલ બીલ રૂ. ૧,૧૧,૮૬૩/- પુરાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર..

કા.નં. - ૬

વિષય.: તા.:૧૬-૧૦-૨૦૧૯ થીતા.:૧૯-૧૦-૨૦૧૯ સુધી મોઘાભાઈ હોલથી કેરીમાર્કેટ કલ્યાણબાગથી પેટ્રોલ પંપ સુધીનો ,વિગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર કામગીરી માટે સફાઈ કામદારો રાખેલ. જે અંગેનું ગોરી કોન્ટ્રાક્ટસ,વાપીનું રૂ.૩૩,૦૦૦/-પુરાનું બીલ મંજુર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૪૯/ તા.૧૯-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ નગરપાલિકા દ્વારા તા.:૧૬-૧૦-૨૦૧૯ થીતા.:૧૯-૧૦-૨૦૧૯ સુધી મોઘાભાઈ હોલથી કેરીમાર્કેટ કલ્યાણબાગથી પેટ્રોલ પંપ સુધીનો વિસ્તાર પેટ્રોલ પમ્પથી હનુમાન મંદિર થઈ ધરમપુર રોડ ડીએસપી ઓફિસથી તીથલ રોડ ચાર રસ્તા થી તીથલ રોડ જકાતનાકા સુધીનો વિસ્તારમાં ડોર ટુ ડોર કામગીરી, IAS ઓફીસરશ્રી, હસરત જાસ્મીનશ્રીના, ચીફ ઓફીસર તરીકે વલસાડ નગરપાલિકાનો ચાર્જ સાંભળેલ. તે સમયગાળા દરમિયાન તેઓ દ્વારા શહેરની વિઝીટ કરતાં તેઓએ કરેલ સૂચન મુજબ તાત્કાલિક અસરથી સદરહું જણાવેલ વિસ્તારમાં ઉપરોક્ત કામગીરી કરાવેલ. જે કરાવેલ કામગીરીને બહાલ રાખી,જેનું આવેલ ગોરી કોન્ટ્રાક્ટસ, વાપીનું બીલ રૂ. ૩૩,૦૦૦/- અંકે તેત્રીસ હજાર પુરાનું મંજુર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર.

કા.નં. - ૭

વિષય.: આરોગ્ય શાખાના મહેકમ પત્રકે ખાલી પડેલ સફાઈ કામદારોની જગ્યા ઉપર નિમાણુક કરવા મંજૂરી માંગતી દરખાસ્ત કરવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૫૦/તા.૧૮-૦૭-૨૦૨૦ ની ભલામણ મુજબ નગરપાલિકાના આરોગ્ય શાખાના મહેકમ પત્રકે સફાઈ કામદારોની ૧૫૨ જગ્યા તથા મુકાદમોની ૦૬ જગ્યા મળી કુલ ૧૫૮ જેટલી જગ્યા મંજૂર થયેલ છે. તે પૈકી હાલે સફાઈ કામદારોની ૨૮ જગ્યા તથા મુકાદમની ૦૧ જગ્યા મળી કુલ-૩૦ જગ્યા ખાલી છે.

અ.ન.	મંજૂર થયેલ જગ્યાની વિગત	સંખ્યા	હાલે ભરાયેલ જગ્યા	હાલે ખાલી જગ્યા
૧	મુકાદમ	૦૬	૦૫	૦૧
૨	ઝાડુવાળા સફાઈ કામદાર	૮૧	૫૮	૨૩
૩	વાલ્મીકી સફાઈ કામદાર (પુરુષ + સ્ત્રી)	૭૧	૬૫	૦૬
	કુલ..	૧૫૮	૧૨૮	૩૦

સફાઈ કામદારો ,વિગેરેની કુલ-૩૦ જેટલી જગ્યા ખાલી હોવાના કારણે સફાઈની કામગીરીમાં પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. નગરપાલિકા હદમાં રહેતા નાગરીકો પાસે સફાઈવેરો , ઘન-કચરા નિકાલ યુઝર ચાર્જિસ જેવા વેરાઓ વસુલાત કરતાં આવેલ છે. એવા સંજોગોમાં નાગરીકોને સાફ-સફાઈ તેમજ ઘન-કચરાનો નિકાલ કરવો ખુબજ આવશ્યક છે. નાગરીકો વેરો ભરતા હોય, તેમને સફાઈ સેવા નિયમિત મળે તે માટે ખાલી પડેલ ૩૦ જગ્યા ઉપર નિમાણુક થવા ખુબજ જરૂરી છે. જેથી સદરહુ બાબતે ચર્ચા-વિચારણાને અંતે આરોગ્ય શાખાના મહેકમ પત્રકે ખાલી પડેલ સફાઈ કામદારોની કુલ-૩૦(ત્રીસ) જગ્યા ઉપર ભરતી કરવા માટેની મંજૂરત માંગતી નિયમ મુજબની દરખાસ્ત મે.પ્રાદેશિક કમિશ્નરશ્રી,સુરતની ભલામણ સહ મે.કમિશ્નરશ્રી,ગાંધીનગરની કચેરીને સાદર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર.

કા.નં. - ૮

વિષય.: નામદાર સરકારશ્રીની અમૃત યોજના સને: ૨૦૧૭-૨૦ ના વર્ષ દરમ્યાન અર્બન
ટ્રાન્સપોર્ટેશન સેક્ટર માં મલ્ટીલેવલ પાર્કિંગ ફોર પબ્લિક (ગ્રાઉન્ડ ફ્લોર + એક માળ)
બનાવવાના કામ બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ઉજ્જેશભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૫૩/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ નામદાર સરકારશ્રીની
અમૃત યોજના સને: ૨૦૧૭-૨૦ ના વર્ષ દરમ્યાન અર્બન ટ્રાન્સપોર્ટેશન સેક્ટર માં મલ્ટીલેવલ પાર્કિંગ
ફોર પબ્લિક (ગ્રાઉન્ડ ફ્લોર + એક માળ) બનાવવાના કામે ઠેકેદારશ્રી મે.એસ.એમ.સેલડીયા,
સુરતનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. અને મંજૂર કરેલ ટેન્ડર મુજબ ઠેકેદારશ્રી દ્વારા કામગીરી શરૂ
કરવામાં આવેલ છે. અને હાલે સદરહું કામગીરી અન્વયે ઠેકેદારશ્રી દ્વારા સ્થળ ઉપર પ્લીનથ લેવલ
સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. સદરહું કામગીરી અન્વયે જણાવવાનું કે, સદરહું સ્થળ
તળાવની જગ્યા હોવાથી ઠેકેદારશ્રી તરફથી સોઈલ બેરીંગ કેપેસિટી (SBC) ચેક કરાવતા સોઈલ
બેરીંગ કેપેસિટી (SBC) ઓછી આવેલ છે. જેથી સદરહું બાબતને ધ્યાને લેતાં સ્થળ ઉપર ટેન્ડર
એસ્ટીમેઈટમાં જણાવ્યા મુજબની સ્ટ્રક્ચર ડીઝાઈન, વિગેરે જેવી વધારાની કામગીરી કરવામાં આવેલ
છે. જેથી મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાના કામે સદરહું પ્રોજેક્ટના નિમાણુંક પામેલ કન્સલ્ટન્ટ શ્રી
ધવલ એન્જીનીયર, ગાંધીનગરની વિગતો મુજબ સદરહું કામમાં થયેલ વધારાની કામગીરીનો
એસ્ટીમેઈટ રૂ. ૬૨,૨૮,૮૧૦/- માં વધારો થવા જાય એમ છે. જેથી સદરહું બાબતને ધ્યાને લઈ
સદરહું થનાર વધારાનો ખર્ચ રૂ. ૬૨,૨૮,૮૧૦/- પુરાનો ખર્ચનું ચૂકવણુ નામદાર સરકારશ્રી અમૃત
યોજના માથી કરવા માટે આગળની કાર્યવાહી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૯

વિષય.: વલસાડ પારડી ખાતે રેલ્વે અંડરબ્રીજ પાસે ચીખલી અને કૈલાશ રોડને જોડતો રેલ્વે ઓવરબ્રિજ બનાવવા સરકારશ્રીને જરૂરી ભલામણ કરવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ઉજેશભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૫૪/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ ડાલે વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ઔરંગા નદી પાસે વલસાડ પારડી રેલ્વે અંડરબ્રીજ આવેલ છે. ડાલે રેલ્વે ડીપાર્ટમેન્ટ તરફથી ટ્રેક એક્સટેન્શનનો પ્રોજેક્ટ ચાલી રહેલ છે. સદર વિસ્તાર ચોમાસાની ઋતુ દરમિયાન સદર અંડરબ્રીજમાં પાણી ભરાતા ઉપયોગમાં લેવાતો નથી જેથી રેલ્વે ટ્રેકના પશ્ચિમ ભાગની વસ્તીને પૂર્વમાં જવા માટે ઘણું લાંબુ અંતર કાપી જવાનું થાય છે. કૈલાશ રોડ સીધો ગુંદલાવ ચોકડી પાસે નેશનલ હાઈવે - ૪૮ ને જોડે છે. તેમજ સદર માર્ગ પર મુક્તિધામ પણ આવે છે. સદર માર્ગ મોટી જન સંખ્યા માટે ખુબજ ઉપયોગી છે.

સદર બાબતે હવે “ રેલ્વે ફાટક મુક્ત ગુજરાત “ અભિયાન અન્વયે રેલ્વે ઓવરબ્રીજ / અંડરબ્રીજની કામગીરી “ ગુજરાત શહેરી વિકાસ કંપની (GUDC) “ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જેમાં PMC તરીકે “ DELF Consulting Engineers (India) Pvt Ltd,Ahemdabad” ને નિમણુંક આપવામાં આવે છે. સદર પ્રોજેક્ટ નગરપાલિકા,આર એન્ડ બી, રેલ્વે ડીપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર મળીને કરવાનું થાય છે. જે બાબતે વલસાડ ખાતે આપશ્રીના અધિકારી ,PMC, R&B, રેલ્વે, વિગેર જોડે જોઈન્ટ વિઝીટ કરેલ છે. અને જરૂરી અંદાજીત ખર્ચ અને રીપોર્ટ PMC તરીકે “ DELF Consulting Engineers (India) Pvt Ltd,Ahemdabad” તરફથી રજુ થયેલ છે. જે આ સાથે સામેલ છે. રેલ્વે ચેનેજ નં.-CH-331,Proposed ROB Location at RLW KM : 199/612.77m, above bridge no : 331 (RCC BOX) પાસે નજીકમાં LC-99 લીલાપોર ફાટક, ATVU 113850.02 છે. જેથી ATVU એક લાખ થી વધુ હોવાથી સદર પ્રોજેક્ટ કોસ્ટ ૫૦% રાજ્ય સરકાર અને ૫૦% રેલ્વે ઉદાવશે. અને PMC તરફથી અંદાજીત ખર્ચ રૂ.૫૭૬૨ લાખ બતાવવામાં આવેલ છે.

સદર પ્રોજેક્ટ બાબતે જરૂરી જોઈન્ટ સાઈટ વિઝીટ નગરપાલિકા,GUDC, PMC,R&B,RAILWAY Dept દ્વારા કરવામાં આવેલ છે. અને સદર પ્રોજેક્ટની ફીઝીબીલીટી અને ચકાસણી કરેલ છે.જેમાં ચીખલી રોડને રેલ્વે બ્રીજ નં - ૩૩૧ થી ઓવર બ્રીજ બનાવી પ્રાથમિક શાળા,કૈલાશ રોડ પર જોડવામાં આવશે. સદર બાબતે PMC તરફથી અંદાજીત ખર્ચ રૂ.૫૭૬૨ લાખ બતાવવામાં આવેલ છે.સદર પ્રોજેક્ટ નગરપાલિકા હદ વિસ્તારમાં હોઈ જેથી Consent (સંમતિ) આપવાની થાય છે. આ કામે સરકારશ્રીમાં ભલામણ કરતી દરખાસ્ત કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર.

કા.નં. - ૧૦

વિષય.: નામદાર સરકારશ્રીની અમૃત યોજના વર્ષ : ૨૦૧૫-૧૬ માં વારીગૃહ ખાતે ૧૫ MLD ક્ષમતા ધરાવતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામ બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.રાઠોડ રાજેશભાઈ દશરથભાઈ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૫૫/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ નામદાર સરકારશ્રીની અમૃત યોજના વર્ષ : ૨૦૧૫-૧૬ માં વારીગૃહ હેડ વર્ક્સ ખાતે ૧૫ MLD ની ક્ષમતા ધરાવતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામે હિન્દુસ્તાન પ્રોજેક્ટ્સ, મુ. પલ, માવડી મેઈન રોડ , રાજકોટનું ટેન્ડર ગાંધીનગર ખાતે થયેલ મીટીંગના અજેન્ડા નં -૬ માં મંજૂર કરવામાં આવેલ. સદરહું કામગીરી કરવા માટે અત્રેની કચેરીથી વહીવટી જવક નં - ૩૧૪ / તા.૦૧-૦૬ -૨૦૧૮ થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ, અને એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ. સદરહું કામગીરીના મંજૂર થયેલ એજન્સીની તા.૦૮-૧૧-૨૦૧૮ ની આવેલ અરજીમાં જણાવ્યા મુજબ મંજૂર થયેલ સ્થળ પર જોતાં રોડ લેવલ થી ૫ મીટર જેટલી જગ્યા નીચાણવાળી હોય અને સદરહું રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર વધુ રહે છે. જેથી સદરહું જગ્યાને જરૂરીયાત મુજબ માટી પુરાણ કરી ડામર રોડ બનાવવાની જરૂરિયાત હોય, અને સદરહું કામગીરી કરવા માટે અંદાજે ૩૦ મીટર જેટલી પાઈપ લાઈનની વધુ જરૂરિયાત જણાય આવેલ છે.તો ઉપરોક્ત બંને બાબતોને ધ્યાને લઈ સદરહું કામગીરી કરવા માટે સદરહું યોજનાના કન્સલ્ટન્ટને સ્થળ તપાસ કરી જરૂરી અભિપ્રાય મેળવવા માટે આ કામે ગ્રાન્ટ મેળવવા GUDM પાસે જરૂરી મંજૂરી માંગતી દરખાસ્ત કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

જા.બો.ઠ.નં.૮૦૪/ તા.૦૯-૧૧-૨૦૨૦

કા.નં. - ૧૧

વિષય.: સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે, નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેના (૧૨ X ૧૮) ની સાઈઝમાં સ્ટીકરો તેમજ હોર્ડીંગ્સ (૨૦ X ૧૦) ની સાઈઝમાં સપ્લાય કરવા અંગેના આવેલ હેપ્પી ઝેરોક્ષ, વલસાડના જુદા જુદા બીલો કુલ રકમના રૂ.૧,૩૧,૦૦૦/-મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૫૭/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે, નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક બેગ અને ઝભલાં થેલી વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે, પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેના (૧૨ X ૧૮)ની સાઈઝમાં સ્ટીકરો તેમજ હોર્ડીંગ્સ (૨૦ X ૧૦) ની સાઈઝમાં સપ્લાય કરવા અંગેના આવેલ હેપ્પી ઝેરોક્ષ, વલસાડના નીચે જણાવેલ જુદા જુદા રકમના બીલો યુક્તવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	બીલ નં.	તારીખ.	બીલની રકમ રૂ.
૧	૨૮૮	૧૨-૧૨-૨૦૧૮	૩૪,૦૦૦/-
૨	૨૯૬	૧૨-૧૨-૨૦૧૮	૪૬,૦૦૦/-
૩	૬૪૦	૧૯-૦૨-૨૦૨૦	૩૦,૦૦૦/-
૪	૬૪૧	૧૯-૦૨-૨૦૨૦	૨૧,૦૦૦/-

સ.મ.મંજૂર..

કા.નં. - ૧૨

વિષય.: વલસાડ નગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય, વલસાડ માટે સને :૨૦૧૯-૨૦૨૦ ના વર્ષ માટે મળેલ રૂ.૪,૩૩,૮૪૫/- ની મળેલ અને જમા ગ્રાન્ટમાંથી રૂ.૧ લાખના નવા લેટેસ્ટ પુસ્તકોની ખરીદી કરવા અંગે નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૫૮/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય, વલસાડ માટે સને :૨૦૧૯-૨૦૨૦ ના વર્ષ માટે ગ્રંથાલય નિયામકશ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર તરફથી મળેલ રૂ.૪,૩૩,૮૪૫/- અનુદાનની રકમમાંથી રૂ.૧,૦૦,૦૦૦/- ના નવા યાદી મુજબના લેટેસ્ટ પુસ્તકોની ખરીદી કરવા માટેની જરૂરિયાત છે. ના.સરકારશ્રીના આગામી વાંચન મિશન વાંચન -૨૦૨૨ અંતર્ગત લાયબ્રેરી માટે નવા પુસ્તકો વસાવવાની ખુબ જરૂરિયાત છે. અને પુસ્તકાલય માટે સભ્યપદ ધરાવતા વાચકો તરફથી નવા પુસ્તકો મંગાવવા માટે સજ્જેશનો પણ કરવામાં આવેલ છે, જે માટે તાજેતરમાં પ્રકાશિત થયેલા નવા પુસ્તકોની યાદીમાં જણાવ્યા મુજબના પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા “ ટેન્ડર પ્રથા થી મુક્તિ મેળવનારી સંસ્થા “ગુજરાત પુસ્તકાલય, સહાયક સહકારી સ.મંડળ, વડોદરા પાસેથી, જમા ગ્રાન્ટમાંથી રૂ.૧ (એક) લાખના પુસ્તકો, ગ્રંથપાલની યાદીમાં જણાવ્યા મુજબના નવા લેટેસ્ટ પુસ્તકો, ની ખરીદી “ગુજરાત પુસ્તકાલય, સહાયક સહકારી સ. મંડળ, વડોદરા પાસેથી કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૧૩

વિષય.: વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ધનકચરા નિકાલની કામગીરી ગૌરી
કોન્ટ્રાક્ટર,વાપી પાસે કરાવેલ જેનું આવેલ બીલ રૂ.૬૬૦૦૦/- મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૬૩/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા
વિસ્તારમાં ડોર ટુ ડોર ધનકચરા નિકાલની કામગીરી, IAS ઓફીસરશ્રી,જાસ્મીન હસરતશ્રીના, ચીફ
ઓફીસર તરીકે વલસાડ નગરપાલિકાનો ચાર્જ સાંભળેલ. તે સમયગાળા દરમિયાન તેઓ દ્વારા
શહેરની વિઝીટ કરતાં તેઓએ કરેલ સૂચન મુજબ તાત્કાલિક અસરથી સદરહું જાણાવેલ વિસ્તારમાં
ઉપરોક્ત કામગીરી કરાવેલ. જે કરાવેલ કામગીરીને બહાલ રાખી,જેનું આવેલ ગૌરી કોન્ટ્રાક્ટસ,
વાપીનું બીલ રૂ. ૬૬,૦૦૦/-એકે છ્યાંસઠ હજાર પુરાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૧૪

વિષય.: નામદાર સરકારશ્રીની અમૃત યોજના હેઠળ વોટર સપ્લાય સેક્ટર હેઠળ વર્ષ : ૨૦૧૭-૨૦ હેઠળ ૪૫૦ એમ.એમ.ની રાઈઝીંગ મેઈન અબ્રામા વોટર વર્ક થી કલ્યાણ બાગ સંપ સુધી વોટર સપ્લાય પાઈપ લાઈન નાખવા ને.હા.ઓથોરીટી ઓફ ઈન્ડિયા મંજૂરી લેવા અંગે ડીમાન્ડડ્રાફ્ટ અને પરફોર્મન્સ બેંક ગેરેન્ટી બનાવવા અંગે નિર્ણય થવા બાબત.

સભ્યશ્રી પુષ્પાબેન ઓઝા ગયા
દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૬૫/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ નામદાર સરકારશ્રીની અમૃત યોજના હેઠળ વોટર સપ્લાય સેક્ટર હેઠળ વર્ષ : ૨૦૧૭-૨૦ હેઠળ ૪૫૦ એમ.એમ.ની રાઈઝીંગ મેઈન અબ્રામા વોટર વર્ક થી કલ્યાણ બાગ સંપ સુધી વોટર સપ્લાય પાઈપ લાઈન નાખવા ને.હા.ઓથોરીટી ઓફ ઈન્ડિયાની મંજૂરી લેવાની થાય છે. જે અતર્ગત મંજૂરી માટે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના પત્ર ક્રમાંક: NHAI /PIU- SURAT(EXPRESSWAY) /SDM-07/RG-130 /2020 માં જણાવ્યા મુજબ રૂ.૧,૨૦.૨૭૧/-નો પબ્લિક યુટીલીટી લાઈસન્સ / રેન્ટલ ચાર્જ (પાંચ વર્ષ) ના ડીપોઝીટ કરવાના થાય છે. તથા રૂ.૨,૮૮,૨૫૦/- ની પરફોર્મન્સ બેંક ગેરેન્ટી આપવાની થાય છે. જે કામે સદરહું મંજૂરી માટે ડીમાન્ડડ્રાફ્ટ અને પરફોર્મન્સ બેંક ગેરેન્ટી બનાવવા અંગેનું કામ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

જા.બો.ઠ.નં.૮૦૮/ તા.૦૯-૧૧-૨૦૨૦

કા.નં. - ૧૫

વિષય.: વલસાડ નગરપાલિકાનો સને : ૨૦૧૯-૨૦૨૦ નો તા.:૦૧/૦૪/૨૦૧૯ થી
તા.:૩૧/૦૩/૨૦૨૦ સુધીનો બાર-માસિક હિસાબ મંજૂર કરવા બાબત..

સભ્યશ્રી છાયાબેન પટેલ ગયા
દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૬૭/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકાનો
સને-૨૦૧૯-૨૦૨૦ નો તા.:૦૧/૦૪/૨૦૧૯ થી તા.:૩૧/૦/૨૦૨૦ સુધીનો બાર-માસિક
હિસાબ, મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૧૬

વિષય.: વલસાડ નગરપાલિકામાં શોપીંગ મોલના મુળ માળખામાં ફેરબદલી અંગેના કામે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

સભ્યશ્રી નિતેશભાઈ વશીએ જણાવ્યું કે, સભ્યશ્રી યશોષ માલી તથા સભ્યશ્રી ઉજ્જેશભાઈ પટેલ નીચે આવેલ શોપીંગ મોલ હરાજી સમયે ઓક્શન પ્રક્રિયામાં ભાગ લીધેલ ન હોય પૈસા જમા કર્યા ન હોય તેવી બાબતોને પ્રશ્ન ઉપસ્થિત કરી શોપીંગ મોલ સમય મર્યાદામાં જલ્દીથી કાર્યરત થાય તે માટે નગરપાલિકાની પેનલના એડવોકેટશ્રીનો અભિપ્રાય મેળવી રજુ કરવાનું જણાવ્યું પ્રમુખશ્રીએ જણાવ્યું કે વકીલશ્રીનો અભિપ્રાય મેળવી હાલ મુલતવી રાખીએ.

ઠરાવ.:

આ મુદ્દા પર પુખ્ત ચર્ચા કરવાની બાકી હોય , જેથી આવનારી બોર્ડમાં આ વિષય પર પુખ્ત ચર્ચા કરવાની જરૂરી હોય, જેથી હાલે આ કામ મુલતવી રાખવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૧૭

વિષય.: વ્યવસાય વેરા ગ્રાન્ટની ફાળવેલ ગ્રાન્ટમાંથી કામો નક્કી કરવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૭૨/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ ના.ગુજરાત સરકારશ્રીના ગુ.મ્યુ.ફાઈ.બોર્ડ.,ગાંધીનગરના દ. હુકમ ક્રમાંક.: મફબ / વ્યવસાયવેરા ગ્રાન્ટની હુકમ ક્રમાંક.: મફબ / વ્ય.વેરા (૫૦%) ન.પા./૨૦૧૯-૨૦ /૨૦૨૦/૧૬૩૩ તા.:૨૩-૦૧-૨૦૨૦ થી વલસાડ નગરપાલિકા -વલસાડને વ્યવસાયવેરા ગ્રાન્ટ હેઠળ રૂ.૧,૪૯,૭૨,૭૨૬/-પુરાની ફાળવવામાં આવેલ છે. જે વ્યવસાયવેરા ગ્રાન્ટની શરતો મુજબ અગ્રતા ક્રમના ધોરણે વલસાડ શહેરના હદ વિસ્તારમાં નીચે જણાવેલ વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેઈટની રકમ
૧	૧	રાખોડીયા તળાવ પાસે પીવાના પાણીની ટાંકી બનાવવાનું કામ.	પાણીની ટાંકી	૫૧૩૯૯૦૦
૨	૧	ફાટીવાલા ચાલ, નાના પારસીવાડ વિસ્તારમાં	પેવરબ્લોક	૪૫૮૬૦૦
૩	૧	વોર્ડ નં-૧, ઉમાબેન,આંધીયાવાડ ચોતરા તથા સુનિતાબેન ટેડેલના ઘરની આજુ-બાજુ પેવરબ્લોક બેસાડવાનું કામ.	પેવરબ્લોક	૭૫૦૩૦૦
૪	૧	વોર્ડ નં-૧, શિવમ કોમ્પ્લેક્સ,દેસાઈવાડ પાસે તથા જયંત આર્ટના ઘર પાસે પેવરબ્લોક બેસાડવાનું કામ.	પેવરબ્લોક	૨૩૮૩૦૦
૫	૧	રોશનઅલી વાળા વિસ્તાર માથી ટેકરો ઉતરી જાહીરભાઈની દુકાન તથા ઓનેસ્ટ ગેરેજ સામેની લાઈન તથા બરૂડીયાવાડની લાઈન તેમજ ઉમર ફળિયા થી કૂવા પાસેની લાઈન	ડ્રેનેજ લાઈન	૮૬૫૧૦૦
૬	૨	એલ.પી.ચાલ વિસ્તારમાં	પેવરબ્લોક	૫૫૩૯૦૦
૭	૨	વલસાડ પારડી કોમ્યુનીટી હોલ થી મનસુખભાઈના ઘર સુધી	પેવરબ્લોક	૩૬૪૪૦૦
૮	૨	ડો.દીલીપ પારેખના લાઈન	વરસાદી ગટર	૯૧૭૫૦૦
૯	૨	બેજનબાગ થી વેલકમ એપાર્ટમેન્ટ સુધી	વરસાદી ગટર	૫૩૮૬૦૦
૧૦	૨	મોહમ્મદભાઈ ના ઘર થી મુખ્ય ગટર શાજિદભાઈના ઘર સુધી (સિપાઈવાડ)	વરસાદી ગટર	૩૦૩૯૦૦
૧૧	૨	સરકારીસંઘ થી મુખ્યગટર સુધી તથા રાજુભાઈ સભ્યશ્રીના ઘર થી મુખ્ય ગટર સુધી	વરસાદી ગટર	૭૧૬૫૦૦
૧૨	૩	વોર્ડ નં-૦૩ અંબાજીનગર થી રામઆશરેના ઘર સુધી (બોક્ષ ડ્રેઈન)	વરસાદી ગટર	૫૨૩૦૦૦
૧૩	૩	કોટેશ્વર મંદિર નજીક ઠક્કર નિવાસ તથા નીકીતા ની બે ગલીના	પેવરબ્લોક	૨૪૮૨૦૦
૧૪	૩	પોલીસ હેડ ક્વાર્ટર મુખ્ય રસ્તાથી સુરેશના ઘર સુધી શિવ	પેવરબ્લોક	૩૯૦૨૦૦

		શકિતના વિસ્તારમાં		
૧૫	૩	લોટનની ગલીમાં	પેવરબ્લોક	૨૬૬૩૦૦
૧૬	૩	લોટનની ગલીમાં	વરસાદી ગટર	૩૦૩૯૦૦
૧૭	૩	મોગરાવાડી ઝોન ઓફિસના આગળના ભાગમાં પતરાંનો શેડ બનાવવાનું કામ	પતરાંનો શેડ	૨૮૩૮૦૦
૧૮	૩	રેલ્વે ગળનારા પાસે મોટર પેનલ માટે પતરાંનો શેડ	પતરાંનો શેડ	૩૨૯૦૦
૧૯	૩	જૂના લશ્કરી રોડ થી પોલીસ હેડ ક્વોર્ટર શાળાની ગલીમાં	પેવરબ્લોક	૪૫૮૨૦૦
૨૦	૩	જે.કે.ચીકન થી મોટા તળાવ તરફ જતો રોડ	પેવરબ્લોક	૬૧૬૩૦૦
૨૧	૩	પોલીસ હેડક્વોર્ટર રોડ થી રેલ્વે મેદાન તથા હનુમાન મંદિરની ગલી	પેવરબ્લોક	૪૩૬૦૦૦
૨૨	૪	સીમા એપાર્ટ. થી મુખ્ય રોડ સુધી	પેવરબ્લોક	૩૭૦૬૦૦
૨૩	૪	સંજય ચૌહાણના ઘર થી સોનુ સીરકે (ખ્યાતિનગર)	પેવરબ્લોક	૩૪૦૬૦૦
			કુલ રકમ રૂ.	૧૫૧૧૭૦૦૦

સ.મ.મંજુર..

કા.નં. - ૧૮

વિષય.: ના.સરકારશ્રી તરફથી ફાળવેલ ટીવીન એન્જન બોટર્સમાં એન્જનમાં જરૂરી સર્વિસીંગ તેમજ રીપેરીંગ કામનું આવેલ બીલ રૂ.૨,૮૯,૪૯૫/-મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૭૩/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ ના.સરકારશ્રી તરફથી ફાળવેલ ટીવીન એન્જન બોટર્સમાં એન્જનમાં જરૂરી સર્વિસીંગ તેમજ રીપેરીંગ કામની જરૂરિયાત સંદર્ભે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મળેલ સુચના અનુસાર હાલે ચોમાસાની સીઝન હોય, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવતી રેલ રાહતમાં મદદરૂપ થવા કામની અગત્યતાને લઈ, આવશ્યક સેવાને ધ્યાનમાં રાખી, સદરહું કામગીરી મે. નરસિહદાસ મોરારજી વાડિયા - બીલીમોરા પાસે કરાવેલ, જે કરાવેલ કામગીરીને બહાલ રાખી, કરેલ કામગીરીનું આવેલ બીલ રૂ.૨,૮૯,૪૯૫/- મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૧૯

વિષય.: વો.વ.ક.ઠ.નં ૧૧ /તા.:૧૧/૦૫/૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની ૧૪ માં નાણાં પંચ યોજના હેઠળ અબ્રામા હેડ વર્ક્સ ખાતે ૧૧ એમ.એલ.ડી. પ્લાન્ટ તથા ૧૦ લાખ લીટર અંડર ગ્રાઉન્ડ સંપ તથા ચેમ્બરો બનાવવાના કામ અંગે ટેન્ડર સિવાય વધારેની કામગીરીને બહાલી આપી વધારેનો ખર્ચ મંજૂર કરી આવેલ બિલ રૂ.૧,૬૩,૮૫૭ /-મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૮૦/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની ૧૪ માં નાણાં પંચ યોજના હેઠળ અબ્રામા હેડ વર્ક્સ ખાતે ૧૧ એમ.એલ.ડી. પ્લાન્ટ તથા ૧૦ લાખ લીટર અંડર ગ્રાઉન્ડ સંપ તથા ચેમ્બરો બનાવવાના કામ અંગે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વો.વ. જા. નં. ૨૦૨ / તા.: ૦૪/૦૧ /૨૦૧૮ થી રાજેશ્રી એન્જનીયર- અમદાવાદને વર્ક ઓડર ઈસ્યુ કરવામાં આવેલ. સદર કામગીરી દરમિયાન સાઈટ ઉપર જરૂરી એવી ટેન્ડરમાં ઉલ્લેખ ન થયેલ કામગીરી કરવામાં આવે તોજ સદરહું પ્રોજેક્ટને આખરી ઓપ આપી શકાય તેમ હોય તેમજ સદરહું કામગીરીની સમય મર્યાદાને ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબની કામગીરી ઈજનેરશ્રીના નીરીક્ષણ હેઠળ કરવામાં આવેલ છે. જે અંગે ટેન્ડર સિવાયની વધારેની કામગીરીને બહાલી આપી વધારેનો ખર્ચ રૂ.૧,૬૩,૮૫૭ /-મંજૂર કરી આવેલ બિલનું ચુકવણું કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

(1)400 mm Dia HDPE pipe Line Shifting Work (GWSSB)	-25000=00
(2)RCC Chambar Repairing(M-200)(Item no 05033A1) R & B SOR-2015-16)	- 38609=31
(3)Wash out line Chambar upgradation Work	- 37500=00
(4)Earth Filling work with selected soil andmorrum brought fromout side(R&B SOR It No. 3004008A Pg 49)	- 62748=00

	163857=31.

સ.મ.મંજૂર.

કા.નં. - ૨૦

વિષય.: ના.સરકારશ્રીની અમૃત યોજના (૨૦૧૭-૨૦) હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી પીવાના પાણીની લાઈન શીફ્ટીંગની કરવાના કામનો એસ્ટીમેટ રૂ.૧,૨૮,૭૨,૦૦૦/- પુરાનો મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૮૧/ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની અમૃત યોજના (૨૦૧૭-૨૦) હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ઈજનેરશ્રીના રીપોર્ટમાં જણાવ્યા મુજબ સદરહું કામ કરાવવા માટે ઠેકેદારશ્રી ક્ષિપ્તા કન્સ્ટ્રક્શન કંપની એ/૩૭ અને ૨૮ નગરપાલિકા શોપિંગ સેન્ટર ધોબીઘાટ મહેસાણાનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે.સદરહું કામે માર્ગ અને મકાન વિભાગ વલસાડ તેમજ ઈસ્કોન ઈન્ટરનેશનલ લીમીટેડ દ્વારા ધરમપુર રોડ આવેલ રેલ્વે ઓવરબ્રિજ તોડી નવો ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવાનું હોય જે અન્વયે વલસાડ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ અબ્રામા વોટરવર્ક્સથી કલ્યાણ બાગ સુધી પીવાના પાણીની લાઈન સદરહું રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી પસાર થાય છે. અને જે પીવાના પાણીની લાઈન શીફ્ટીંગ કરવાની જરૂરિયાત હોય, જેથી સદરહું બાબતને ધ્યાનમાં લેતાં સદરહું કામે ઉપરોક્ત યોજનાના મંજૂર કરેલ ઠેકેદારશ્રી પાસેથી પીવાના પાણીની લાઈન શીફ્ટીંગ કરવાના કામનો એસ્ટીમેટ રૂ ૧.૧,૨૮,૭૨,૦૦૦/-પુરાનો રજૂ કરવામાં આવેલ છે. અને સદરહું પાણીની લાઈનના શીફ્ટીંગ અંગે થનાર ખર્ચ રૂ.૧,૨૮,૭૨,૦૦૦/- પુરા ભારત સરકારશ્રીની પ્રોજેક્ટ એજન્સીશ્રી. Dedicated Fright Corridor Project (DFCC) ના પત્રકમાંક નં -IRCON/3018/DFCCIL-CTP-1/WATER PIPE LINE UTILITY SHIFTING/4989/DATE : 03-02-2020 થી એજન્સીશ્રી. Dedicated Fright Corridor Project (DFCC) ચૂકવણું કરવા સંમત થયેલ છે. જેથી ઉપરોક્ત પાણીની પાઈપ લાઈન શીફ્ટીંગ કરવાની વધારાની કામગીરી એજન્સીશ્રી ક્ષિપ્તા કન્સ્ટ્રક્શન કંપની એ/૩૭ અને ૨૮ નગરપાલિકા શોપિંગ સેન્ટર ધોબીઘાટ મહેસાણા પાસેથી કામગીરી કરાવવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૨૧

વિષય.: વલસાડ નગરપાલિકા હસ્તકે ચાલતા , પારડી સાંઢપોર ગ્રામ પંચાયત ખાતે સર્વે નં. ૧૭૬ , માં STP+MPS+TWW+SBM માટે સર્વે નંબરમાં જરૂરી ભાગ પાડવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. ૧૩/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેર અને ચીફ ઓફિસરશ્રીનો રિમાર્ક્સ વાળો રિપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા તરફથી શહેરીજનોને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડ્રેનેજ નેટવર્કની સુવિધા આપવામાં આવે છે. પારડી સાંઢપોર ગ્રામ પંચાયત વિસ્તારમાં ઔરંગા નદી કિનારે વલસાડ નગરપાલિકા દ્વારા SBM સાઈટ આવેલ છે. જેમાં હાલે નામદાર સરકારશ્રીની અમૃત યોજના હેઠળ ૨૦.૨ એમ.એલ.ડી. STP-1 બનાવવાનું કામ ચાલે છે. તેમજ મેઈન પમ્પિંગ સ્ટેશન (MPS) બનાવવાનું કામ પ્રગતિમાં છે.

હાલે નામદાર સરકારશ્રી તરફથી ટ્રીટમેન્ટ વેસ્ટ વોટર (TWW) નો પ્રોજેક્ટ પણ પ્રગતિમાં છે. જેમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી ઈન્ડસ્ટ્રીયલ યુઝ માટે પાણી સપ્લાય કરવામાં આવશે. વધુમાં બાકી રહેતી જગ્યામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (SBM) માટે ઉપયોગમાં લેવાની થાય છે. ઉપરોક્ત હકીકત વિદિત થતાં ઉપર જણાવેલ ૪ (ચાર) પ્રોજેક્ટ માટે અલગ-અલગ એજન્સીઓ કામગીરી કરે છે જેને પાવર કનેક્શન અલગ અલગ આપવાના થાય છે અને એક સર્વે નં. માં ભાગ પાડવાના થાય છે.

સર્વે નં. ૧૭૬ : ૧૮ ,૦૦૪ ચો.મી.(૭/૧૨ મુજબ)

STP-1 : ૮૨૭૫ ચો.મી. (અંદાજે), MPS-1 : ૧૦૫૦ ચો.મી. (અંદાજે)

TWW : ૩૭૧૧ ચો.મી. (અંદાજે), SBM : ૪૮૬૮ ચો.મી. (અંદાજે)

ઉપરોક્ત બાબતે સિટી સર્વે જોડે પત્ર વ્યવહાર કરવા તેમજ આવનાર જરૂરી ચાર્જિસ ભરી આ કામ કરાવવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૨૨

વિષય.: ૨૦.૨ MLD STP-1 પારડી સાંઢપોર ખાતે બાયપાસ લાઈન ૭૨(બોત્તેર) મીટર લંબાઈની ૧૨" ડાયા ડ્રેનેજ લાઈન નાખેલ જેનો અંદાજીત ખર્ચ રૂ.૨ ,૦૪,૮૮૦/- ને મંજૂર કરી જરૂરી બહાલ આપવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. ૧૪/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા હાલે નામદાર સરકારશ્રીને "અમૃત" યોજના અંતર્ગત ઔરંગા નદી કિનારે પારડી- સાંઢપોર ખાતે 20.2 MLD STP-1 નું કામગીરી ચાલે છે. સદર પ્રિમાયસીસની બાજુમાં મેઈન પંપીંગ સ્ટેશન (MPS) બનાવવાનું થાય છે. સદર MPS નું કામગીરી ચાલુ કરતાં એસ્કેવેશન દરમ્યાન હયાત ડ્રેનેજ લાઈન વચ્ચે આવેલ જેથી ઈમરજન્સીના ભાગ રૂપે બાયપાસ લાઈન નાખેલ અને MPS ની કામગીરીને જરૂરી વેગ આપેલ છે. જેથી "20.2 MLD STP-1, પારડી- સાંઢપોર ખાતે બાયપાસ લાઈન 72 (બોત્તેર) મીટર લંબાઈની 12" ડાયા ડ્રેનેજ લાઈન ના સને ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ વાર્ષિક ભાવ મુજબ અંદાજીત ખર્ચ રૂ.૨,૦૪,૮૮૦/- (બે લાખ ચાર હજાર આઠસો નેવું) થાય છે. સદર ખર્ચ નામદાર સરકારશ્રીની અમૃત યોજના અંતર્ગત કરી સદર કામને બહાલ રાખવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર

કા.નં. - ૨૩

વિષય.: “બાયપાસ લાઇન, મલ્ટીલેવલ પાર્કિંગ પાસે,” ૬૦૦ એમ.એમ. ડાયાની ૭૧(એકોતેર) મીટરની લાઇન નાખવા અંદાજિત ખર્ચ રૂ. ૨,૦૦,૩૩૦/- મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ- કા.સ.ઠ.નં. ૧૫/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા હાલે નામદાર સરકારશ્રીની ગ્રાન્ટ માંથી નગરપાલિકા પાર્કિંગ પ્લોટમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું કામ હાથ ધરેલ છે. સદર કામગીરી કરતા સમયે એક લાઇન સદર પ્રીમાયસીસ માં આવે છે. સદર લાઇનને ડીસમેન્ટલ કરવા માટે અલાયદી બહારના ભાગે લાઇન નાખવાની જરૂરીયાત ઉભી થયેલ છે. જેથી સદર પ્રોજેક્ટને જરૂરી વેગ મળી રહે. જેથી “બાયપાસ લાઇન, મલ્ટીલેવલ પાર્કિંગ પાસે, વલસાડ” માટે કુલ ૭૧ (એકોતેર) મીટર લંબાઈની ૨૪” ડાયાની લાઇન સને ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ ભાવ મુજબ અંદાજિત ખર્ચ રૂ. ૨,૦૦,૩૩૦/- (બે લાખ ત્રણસો ત્રીસ) થાય છે. સદર ખર્ચો સરકારશ્રીની ગ્રાન્ટમાં કરી સદર કામ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર

કા.નં. - ૨૪

વિષય.: ડ્રેનેજ શાખામાં જેટીંગ મશીન માટે હોસ પાઈપ+નોઝલ વિગેરે ખરીદી કરવા આવેલ
અંદાજીત ખર્ચ રૂા.૧,૬૮,૭૦૬/- મંજૂર કરવા બાબત...

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ. રાજુભાઈ ડી.રાઠોડ

ઠરાવ- કા.સ.ઠ.નં. ૧૬/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને
ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા તરફથી શહેરીજનોને
ડ્રેનેજ સર્વિસ આપવામાં આવે છે. જેમાં જરૂરી સફાય કામ કરવા માટે જેટીંગ મશીનનો ઉપયોગ
કરવામાં આવે છે. જેથી સુવ્યવસ્થિત ડ્રેનેજ નેટવર્ક કાર્યરત રહે. હાલે જેટીંગ મશીનમાં હોસ પાઈપ
ડેમેજ થયેલ છે. જેને લોકલ માર્કેટમાં રીપેરીંગ કામ કરાવેલ પરંતુ થોડા દિવસ થતાં સદર ડેમેજમાંથી
પાણી લીકેજ ચાલુ થઈ જાય છે. સદર બાબતે પ્રમુખશ્રી અને ડ્રેનેજ કમીટી ચેરમેનશ્રી જોડે ચર્ચા
કરતાં તાત્કાલિક ધોરણે હોસ પાઈપ + નોઝલ રીપ્લેસ કરવાની સૂચના મળેલ છે. સદર હોસ
પાઈપ + નોઝલની ખરીદી માટે “મનીયાર કંપની, અમદાવાદ” તરફથી ક્વોટેશન મંગાવેલ જે અત્રેની
કચેરીએ આવક નં. ૬૨૮૦/તા. ૧૭/૦૨/૨૦૨૦ રૂા. ૧,૬૮,૭૦૬/- નું રજૂ થયેલ છે. સદર ખર્ચો
મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ.મંજૂર-

કા.નં. - ૨૫

વિષય.: “તરીયાવાડ હોલ + વલસાડ પારડી જાહેર શૌચાલય” માટે 43(તેતાલીસ) મીટર લંબાઈ 9” ડાયાની ડ્રેનેજ લાઈન નાખેલ જેનો અંદાજીત ખર્ચ રૂ 1. ૧,૦૩,૩૧૦/- ને જરૂરી બહાવી આપવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.રાજુભાઈ રાઠોડ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૧૭/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા હસ્તકે તરીયાવાદ ખાતે કમ્યુનીટી હોલ આવેલ છે. જેમાં ત્યાના રહીશો માટે આંગણવાડી ચાલે છે તેમજ નામદાર સરકારશ્રીની યોજના મુજબ રાત્રીના સમય ગાળા દરમ્યાન ગરીબો રહેવાની સુવિધા આપવા માટે શેલટર હાઉસનું આયોજન કરેલ. સદર બાબતે ત્યાના શૌચાલય ચાલુ કરવા માટે નવી ડ્રેનેજ લાઈન નાખવાની જરૂરીયાત ઉભી થયેલ જે બાબતે સ્થળ વીઝીટ કરી નવી લાઈન નાખી સદર શૌચાલય કાર્યરત કરેલ. તેમજ વલસાડ પારડી ખાતે જાહેર શૌચાલય આવેલ છે. જેનો ઉપયોગ અવાર-નવાર ત્યાના રહીશો દ્વારા કરવામાં આવે છે. જેમાં સમય જતા આઉટલેટની લાઈન ડ્રેનેજ થયેલ જેથી ત્યાં ગંદકીનું વાતાવરણ ઉભુ થયેલ અને સદર શૌચાલય ની બાજુમાં 2(બે) આંગણવાડી પણ ચાલે છે. જેથી નાના બાળકોને સ્વાસ્થ્યને અસર કરે એમ છે.જેથી સદર પાઈપ ને રીપ્લેસ કરી નવી ડ્રેનેજ લાઈન નાખી સફાય કરી શૌચાલય કાર્યરત કરેલ છે. જેથી “તરીયાવાડ હોલ+ વલસાડ પારડી જાહેર શૌચાલય” માટે 43(તેતાલીસ) મીટર લંબાઈ 9” ડાયાની ડ્રેનેજ લાઈન નાખેલ છે. જેનો સને : ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ વાર્ષિક ભાવ મુજબ અંદાજીત ખર્ચ રૂ 1. ૧,૦૩,૩૧૦/- (એક લાખ ત્રણ હજાર ત્રણસો દસ) થાય છે. જે કામને બહાલ રાખવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૨૬

વિષય.: “પાણીની ટાંકી પાસે, હાલર” વિસ્તારમાં ૧૨“ ડાયાની બાયપાસ લાઈન ૧૧૦ (એકસો દસ) મીટર લંબાઈની ડ્રેનેજ લાઈન નાખવા અંદાજીત ખર્ચ રૂ. ૩,૨૮,૭૮૦ મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૧૮/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં હાલર ખાતે તળાવ આવેલ છે. જેમાં ચોમાસા દરમ્યાન પાણીનો સારો સંગ્રહ થાય છે. અને આસપાસના વિસ્તારના વોટર - લેવલ ઉચા રહે છે. હાલે ઘણા સમયથી સદર તળાવમાં ડ્રેનેજ લાઈનનું ગંદુ પાણી એક ખૂણા માંથી પડે છે. જેના લીધે તળાવમાં ગંદકીનું પ્રમાણ વધે છે , સદર બાબતે ત્યાના સ્થાનિક સભ્યશ્રીઓની સૂચના મળતા સ્થળ તપાસ કરેલ જરૂરી સફાય-કામગીરી પણ હાથ ધરેલ પરંતુ વ્યાજબી નિવારણ મળેલ નથી . સદર સમસ્યાના નિવારણ માટે સ્થાનિક સભ્યશ્રી તેમજ પ્રમુખશ્રીની સૂચના મળેલ છે કે તાત્કાલિક ધોરણે જરૂરી લાઈન નાખી તળાવમાં થતી ગંદકી રોકવી અને સમસ્યાનું કાયમી નિવારણ લાવવું. જેથી “પાણીની ટાંકી પાસે હાલર” માં નવી બાયપાસ લાઈન ૧૧૦ (એકસો દસ) મીટર લંબાઈની 12 “ડાયાની ડ્રેનેજ પાઈપ લાઈન નાખવા સને ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ ભાવ મુજબ અંદાજીત ખર્ચ રૂ.૩,૨૮,૭૮૦/- (ત્રણ લાખ ઓગણત્રીસ હજાર સાતસો એસી) મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૨૭

વિષય.: “કલ્લાબાપાની વાડી, ઘડુચીતળાવ પાસે” નવી ડ્રેનેજ લાઇન ૨૦૨ મીટર લંબાઈની ૧૨” ડાયા ની નાખવા માટે અંદાજીત ખર્ચ રૂા. ૪,૯૭,૦૨૦/- મંજૂર કરી કામગીરી કરવા બાબત . . .

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.રાજુભાઈ રાઠોડ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૧૮/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કલ્લાબાપાની વાડી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની ફરીયાદ છાશવારે આવે છે. અત્રેની કચેરીએથી લાઇની સફાઈ વારંવાર કરવા છતા કાયમી નિવારણ મળેલ નથી. સદર વિસ્તાર સ્લમ એરીયા તરીકે ઓળખાય છે જેમાં ગરીબ પરીવારના ઘરો આવેલ છે. જેમાં અવારનવાર સદર વિસ્તારના રહીશોની ફરીયાદ રહે છે કે ડ્રેનેજ નું ગંદુ પાણી બેક મારી ઘરોમાં આવે છે અને આરોગ્ય બગાડે છે. સદર બાબતે ડ્રેનેજ કમીટી ચેરમેનશ્રી રાજુભાઈ તેમજ સભ્યશ્રી નિમીષાબેન જોડે સ્થળ વિઝિટ કરતા અને પ્રમુખશ્રી જોડે ચર્ચા કરતા નવી ડ્રેનેજ લાઇન તાત્કાલીક નાખી કાયમી નિવારણ લાવવા સુચના મળેલ છે. ઉપરોક્ત હકીકત વિદિત થતા “કલ્લાબાપાની વાડી, ઘડુચી તળાવ પાસે” નવી ડ્રેનેજ લાઇન ૨૦૨ મીટર લંબાઈની ૧૨” ડાયા ની નાખવા માટે સને ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ ભાવ મુજબ અંદાજીત ખર્ચ રૂા. ૪,૯૭,૦૨૦/- (ચાર લાખ સંતાણુ હજાર વીસ) થવા જઈ રહેલ છે. સદર ખર્ચ મજૂર કરી કામગીરી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૨૮

વિષય.: “બાયપાસ લાઇન, જગનનાથ મંદીર પાછળ,” રૂ(છવીસ) મીટરની ૧૨” ડાયની લાઇન નાખવા અંદાજિત ખર્ચ રૂ. ૬૪,૧૮૫/- મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.રાજુભાઈ રાઠોડ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૨૦/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની સુવિધા આપવામાં આવે છે. જેમાં ઘણા સમયથી છીપવાડ ખાતે જગનનાથ મંદીર ના પાછળના ભાગે ડ્રેનેજ લાઇન ઉભરાવવાની ફરીયાદ છાશવારે આવે છે જેના ભાગ રૂપે અત્રેની કચેરી તરફથી જરૂરી સફાયકામ કરવામાં આવે છે પરંતુ થોડા દિવસમાં ફરીથી પરીસ્થિતી એજ થઈ જાય છે. સદર જાહેર રસ્તા પર ડ્રેનેજ નું ગંદુ પાણી બહાર આવે છે તેમજ સદર વિસ્તાર બજાર એરીયા છે. સદર બાબતે ત્યાના સ્થાનિક સભ્યશ્રી માલીભાઈ અને ભારતીબેન જોડે સ્થળ તપાસ કરતા સદર ભાગમા નવી પાઇપ નાખવાની જરૂરીયાત જણાયેલ છે. સદર બાબતે પ્રમુખશ્રી જોડે ચર્ચા કરતા તાત્કાલીક સદર કામગીરી પુર્ણ કરી સમસ્યાનું નીવારણ લાવવાની સુચના મળેલ છે. જેથી “બાયપાસ લાઇન, જગનનાથ મંદીર પાછળ, વલસાડ” માટે કુલ રૂ(છવીસ) મીટર લંબાઈની ૧૨” ડાયની લાઇન સને ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ ભાવ મુજબ અંદાજિત ખર્ચ રૂ. ૬૪,૧૮૫/- (ચોસેઠ હજાર એકસો પંચચાસી) થાય છે. સદર ખર્ચો મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૨૯

વિષય.: “ સમૃદ્ધિ એપાર્ટમેન્ટ , અમીત હોસ્પિટલ પાછળ” પાસે નવી ડ્રેનેજ લાઈન 65(પાસેઠ) મીટર લંબાઈની 12” ડાયાની લાઈનનો અંદાજીત ખર્ચ રૂ ૧,૫૮,૨૪૦/- મંજૂર કરી જરૂરી બહાલી આપવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.રાજુભાઈ રાઠોડ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૨૧/ તા.૨૯-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા હદ વિસ્તાર “ સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, અમીત હોસ્પિટલ પાછળ” છાશવારે ડ્રેનેજ લાઈન ઉભરાવવાની ફરીયાદ રહે છે. જેના નિવારણના ભાગ રૂપે અત્રેની કચેરીએથી કર્મચારીઓ જઈ સફાય કામ કરતા નિવારણ લાવવામાં આવે છે. હાલે વલસાડ નગરપાલિકા તરફથી ડામર રોડનું કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સદર વિસ્તારમાં પ્રમુખશ્રી જોડે સ્થળ તપાસ કરતાં ઈમરજન્સીમાં નવી ડ્રેનેજ લાઈન નાખી સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે સુચના કામગીરી પૂર્ણ કરેલ છે. અને સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવેલ છે. જેથી “સમૃદ્ધિ એપાર્ટમેન્ટ , અમીત હોસ્પિટલ પાછળ” પાસે નવી ડ્રેનેજ લાઈન 65(પાસેઠ) મીટર લંબાઈની 12” ડાયાની ડ્રેનેજ પાઈપ લાઈન સને ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ વાર્ષિક ભાવ મુજબ અંદાજીત ખર્ચ ૧,૫૮,૨૪૦/- (એક લાખ અઠાવન હજાર બસો ચાલીસ) થાય છે. જે મંજૂર કરી સદર કામને બહાલ રાખવા ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૦

વિષય.: ડ્રેનેજ શાખામાં ટ્રેક્ટર જેટીંગમાં જરૂરી રીપેરકામ માટે આવેલ અંદાજીત ખર્ચ રૂ ૩૩,૨૬૩/- મંજૂર કરી કામગીરી કરાવવા બાબત.. ૧.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.રાજૂ રાઠોડ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૨૨/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા વલસાડ નગરપાલિકા તરફથી શહેરીજનોને ડ્રેનેજ સર્વિસ આપવામાં આવે છે. જેમાં જરૂરી સફાય કામ કરવા માટે જેટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી સુવ્યવસ્થીત ડ્રેનેજ નેટવર્ક કાર્યરત રહે. હાલે ટ્રેક્ટર જેટીંગ મશીનમાં બ્રેક ડાઉન આવેલ છે. જેથી ટ્રેક્ટર બંધ હોવાને કારણે જેટીંગ મશીન બંધ છે. જેથી ડ્રેનેજ ચોક-અપની ફરીયાદનું કાયમી નિવારણ લાવવામાં તકલીફ પડે છે. સદર ટ્રેક્ટરને સ્થાનિક બજારમાં ગેરેજમાં બતાવતા રીપેરીંગ કામ માટે અત્રેની કચેરીએ આવક નં. ૬૨૮૮ /તા. ૧૭/૦૨/૨૦૨૦ થી અંદાજીત ખર્ચ રૂ ૩૩,૨૬૩/- (તેત્રીસ હજાર બસો તેસઠ) નું આવેલ છે. સદર ખર્ચો મંજૂર કરાવવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૧

વિષય.: “મહાલક્ષ્મી ટાવર , તીથલ રોડ” પાસે બાયપાસ લાઈન ૧૭(સતર) મીટર લંબાઈની 12”

ડાયાની ડ્રેનેજ લાઈનનો અંદાજિત ખર્ચ રૂ.૧.૪૩,૫૮૫ ને મંજૂર કરી જરૂરી બહાવી આપવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.રાજુભાઈ રાઠોડ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૨૩/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ડ્રેનેજ ઈજનેરશ્રી અને ચીફ ઓફીસરશ્રીનો રીમાર્ક્સ વાળો રીપોર્ટ વંચાણે લેતા હાલે આર.એન્ડ.બી. શાખા તરફથી તીથલ રોડને વાયડનીંગનું કામગીરી ચાલે છે. જેમાં જે.સી.બી.ની મદદ થી દબાણ દૂર કરી ખોદાણ કરવામાં આવે છે. સદર કામગીરી કરતાં સમયે તીથલ રોડ ખાતે ડ્રેનેજ લાઈન ડેમેજ થયેલ જે બાબતે પ્રમુખશ્રી જોડે સ્થળ તપાસ કરતાં ડેમેજ પાઈપને તાત્કાલીક રીપ્લેસ કરવાની સુચના મળેલ. સદર બાબતે જરૂરી પાઈપ લાઈન નાખી સમસ્યાનું નિવારણ લાવવામાં આવેલ છે. ઉપરોક્ત હકીકત વિદિત થતાં “મહાલક્ષ્મી ટાવર , તીથલ રોડ ” પાસે બાયપાસ લાઈન ૧૭ (સતર) મીટર લંબાઈની 12” ડાયાની ડ્રેનેજ પાઈપ સને ૨૦૧૭-૧૮ ના મંજૂર થયેલ વાર્ષિક ભાવ મુબજ રૂ ૧.૪૩,૫૮૫ (તેતાલીસ હજાર પાનસો પંચયાસી) થાય છે. સદર કામને બહાલ રાખવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૨

વિષય.: વલસાડ નગરપાલિકા હદમાં તરીયાવાડ , નવી ચાલ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટર (બોક્ષ ગટર) બનાવવાના કામ બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ - કા.સ.ઠ.નં. ૩૩૧/ તા.૨૮-૦૪-૨૦૨૦ની ભલામણ મુજબ ઈજનેરશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીની રીમાર્ક્સ અન્વયેનો રીપોર્ટ વંચાણે લીધો , વલસાડ નગરપાલિકા હદમાં તરીયાવાડ વિસ્તારમાં નવીચાલમાં વરસાદી પાણીનો ભરાવો રહેતો હોય , જેના કારણે સદરહુ વિસ્તારના રહીશોને અવર-જવર માટે ખુબજ મુશ્કેલીઓ પડતી હોય , સદરહુ બાબતને ધ્યાને લઈ સદરહુ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટર (બોક્ષ ગટર) બનાવવાના કામનો આવેલ એસ્ટીમેન્ટ રૂા.૩ ,૦૭,૮૩૫/- પુરાનો આવેલ છે. તો સદરહુ કામગીરી કરવા માટે આવેલ એસ્ટીમેન્ટનો ખર્ચ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૩

વિષય.: વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ ડીપાર્ટમેન્ટમાં ચાલતી રીબેટ સ્કીમ ચાલુ રાખવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. ૪૭૮/ તા.૨૭-૦૩-૨૦૨૦ની ભલામણ મુજબ ટેક્સ સુપ્રીન્ટેન્ડન્ટ ,
હાઉસ ટેક્સ શાખા તથા ચીફ ઓફિસરશ્રીનો રીપોર્ટ વંચાણે લીધો, વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ
ડીપાર્ટમેન્ટમાં સને : ૨૦૧૨-૧૩ થી ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૨૭૧
હેઠળ મિલકત વેરાના રીબેટ અને દંડના નિયમો-૨૦૧૦ થી મંજૂર કરાવેલ છે. તે પ્રમાણે દર વર્ષે જૂન
માસમાં ૧૦% રીબેટ આપવાની સરકારશ્રીની સ્કીમ સને : ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ચાલુ રાખવાનું
ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૪

વિષય.: વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ ડીપાર્ટમેન્ટમાં ચાલતા સેનીટેશન યુઝર ચાર્જ બાબતે જરૂરી નિર્ણય થવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. ૮ / તા.૨૭-૦૩-૨૦૨૦ની ભલામણ મુજબ ટેક્સ સુપ્રીન્ટેન્ડન્ટ હાઉસ ટેક્સ શાખા , ચીફ સેનેટરી ઈન્સપેક્ટર તથા ચીફ ઓફિસરશ્રીનો રીપોર્ટ વંચાણે લીધો. વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ ડીપાર્ટમેન્ટમાં સને : ૨૦૧૯-૨૦ ના વર્ષમાં સેનીટેશન યુઝર ચાર્જ નવો નાખવામાં આવેલ છે. જે યુઝર ચાર્જ કારપેટ એરીયા આધારિત પરિબળોને આધારે નાખવામાં આવેલ છે. જે સેનીટેશન યુઝર ચાર્જ નાખવામાં આવેલ છે તેમાં F=4 બિન રહેણાંક પરિબળમાં ઔદ્યોગિક એકમો અને કારખાનામાં વધારે યુઝર ચાર્જ હોવાથી અમુક અરજદારોએ યુઝરચાર્જ નથી ભર્યો તો અમુક અરજદારોએ વાંધા સાથે યુઝર ચાર્જ ભરેલ છે.

કારખાના તથા ઔદ્યોગિક એકમોના યુઝરચાર્જની વિગત નીચે પ્રમાણે છે.

અ.નં.	મિલકતનો પ્રકાર	વાર્ષિક સેનીટેશન યુઝર ચાર્જ	યુઝરચાર્જનો નવો દર	કુલ મિલકત
૧	કારખાના , ફેક્ટરી, લેશનું કારખાનું માર્બલની દુકાન, ખુલ્લા પ્લોટ વિગરે	૧૨,૦૦૦/-	૨૪,૦૦/-	૪૩

વધુમાં ફેક્ટરીઓ તથા માર્બલની દુકાનોમાંથી નગરપાલિકા કચરો ઉઠાવતી નથી. તેમજ લેથનું કારખાનું નાની દુકાનમાં હોય કચરો ઓછો નીકળે છે. જેથી કારખાના , ફેક્ટરી, લેથનું કારખાનું તથા માર્બલની દુકાનમાં અરજદારોની આવેલ વાંધા અરજીઓને ધ્યાનમાં લઈ , સને : ૨૦૨૦-૨૧ થી ઉપરોક્ત જણાવેલ નવા દર મુજબ સેનીટેશન યુઝર ચાર્જસ વસુલાત કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૫

વિષય.: કોવિડ-૧૯ મહામારી થી ઉદભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવતું કરવા માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ જાહેર કરવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. ૩૭ / તા.૨૦-૦૫-૨૦૨૦ની ભલામણ મુજબ સુપ્રીન્ટેન્ડન્ટ , ડાયરેક્ટ ટેક્સિસ તેમજ ચીફ ઓફિસરશ્રીનો રીપોર્ટ વંચાણે લીધો. ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : અપલ/૧૦૨૦૨૦/૧૦૮/૧૮૫૨૨૪/ક સચિવાલય તા.૦૫-૦૬-૨૦૨૦ દ્વારા સંદર્ભ હેઠળના પરિપત્રથી કોવિડ-૧૯ મહામારી થી ઉદભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવતું કરવા માટે ગુજરાત આત્મ નિર્ભર કરવા માટે પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચૂકવણાંની ચાલુ વર્ષની બાકીની રકમ ઉપર ૨૦% માફી આપવાનો તથા તમામ રહેણાંક મિલકત ઉપર વર્ષ ૨૦૨૦-૨૧ ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચૂકવણાંની ચાલુ વર્ષની બાકીની રકમ જો ૩૧ , જુલાઈ ૨૦૨૦ સુધી ચૂકવવામાં આવે તો ૧૦% ની માફી આપવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જે અન્વયે સરકારશ્રીના સંદર્ભ હેઠળના પરિપત્ર મુજબ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલ વાણિજ્ય તથા રહેણાંક મિલકતોને ઉપરોક્ત યોજનાનો લાભ આપવાનો થાય છે.

વધુમાં , વલસાડ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ નગરપાલિકામાં નોંધાયેલ મિલકત ધારકોને તા.૦૧-૦૬-૨૦૨૦ થી તા.૩૦-૦૬-૨૦૨૦ (એક માસ) સુધી ચાલુ રકમની બાકી ઉપર ૧૦% લેખે વળતર આપવાનું ચાલુ કરેલ છે. વલસાડ નગરપાલિકાએ વ્યાજ અને વળતરના મંજૂર કરવામાં આવેલ નિયમ મુજબ માહે જૂન-૨૦૨૦માં ૧૦% વળતર આપવામાં આવે છે. ત્યાર પછી માહે ઓક્ટોબર-૨૦૨૦ થી માહે માર્ચ-૨૦૨૧ સુધી દર માસે ક્રમાનુસાર ૧.૫% વ્યાજની રકમ વધારી માર્ચ-૨૦૨૧ સુધી ૮% સુધી વ્યાજ વસુલ કરવામાં આવે છે. ઉપરોક્ત લાભ આપવાથી કોમર્શિયલ એકમોને ૨૦% પ્રોપર્ટી ટેક્સમાં + ૧૦% રીબેટ સાથે કુલ ટેક્સમાં ૩૦% આપવાની થશે. તેમજ જુલાઈ ૨૦૨૦ થી માર્ચ -૨૦૨૧ સુધી કોમર્શિયલ મિલકતમાં ૨૦% પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની થશે તથા ફક્ત જુલાઈ માસમાં રહેણાંક મિલકતમાં ૧૦% પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની થશે. વાણિજ્ય એકમોને ફક્ત જૂન માસમાં ૨૦% પ્રોપર્ટી ટેક્સમાં તથા ૧૦% રીબેટ મળી ૩૦% રાહત આપવામાં આવશે. ત્યારબાદ જુલાઈ-૨૦૨૦ થી માર્ચ-૨૦૨૧ સુધી પ્રોપર્ટી ટેક્સના ૨૦% પ્રમાણે રાહત આપવાની રહેશે. જે લોકોએ હાઉસ ટેક્સ ચૂકવી દીધેલ છે અને પ્રોપર્ટી ટેક્સના ૨૦% રાહતનો લાભ લીધેલ નથી. તેઓને સને : ૨૦૨૧-૨૨ ના બિલમાં પ્રોપર્ટી ટેક્સના ૨૦% રકમ મજરે આપવામાં આવશે.

રહેણાંક એકમોને ફક્ત જૂન માસમાં ૧૦% પ્રોપર્ટી ટેક્સના તથા ૧૦% રીબેટ મળી કુલ ૨૦% રાહત આપવામાં આવશે તથા જુલાઈ ૨૦૨૦ માં ફક્ત ૧૦% પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવશે. જે લોકોએ હાઉસ ટેક્સ ચૂકવી દીધેલ છે. અને પ્રોપર્ટી ટેક્સમાં ૨૦% રાહતનો લાભ લીધેલ નથી.

તેઓને સને : ૨૦૨૧-૨૨ ના બિલમાં પ્રોપર્ટી ટેક્સના ૧૦% રકમ મજરે આપવામાં આવશે.

વધુમાં સરકારશ્રીના તા.૦૫-૦૬-૨૦ પરિપત્રમાં જણાવ્યા મુજબ કોમર્શિયલમાં ૨૦% તથા રહેણાંકમાં ૧૦% જે રાહત આપવામાં આવેલ છે. તે રકમની ગ્રાન્ટ સરકારમાંથી નગરપાલિકાને ચૂકવવામાં આવશે તથા જૂન માસમાં ૧૦% રીબેટના બદલામાં ઓક્ટોબર માસથી દર મહિને ૧.૫% લેખે વ્યાજ વસુલ કરવામાં આવે છે.
જે ઉપરોક્ત હકીકતોથી વિદિત થતાં સદરહુ કામ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૬

વિષય : કેસ નં. CMA-DC/78-2019 તથા RCA/47/2010 ની ફી ચુકવણી કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : ઈજનેરશ્રી પ.વ.ડી. ના રીપોર્ટમાં જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકાના ચાલતા કેસોમાં જરૂરી કાયદાકીય કામગીરી અંગેના કેસ નં. CMA-DC/78-2019 તથા RCA/47/2010 ની વકીલાત ફી અંગે શ્રી મુકેશ જી. પાંચાલનું આવેલ કુલ બિલ રૂા.૭૩૦૦૦ + ૭૩૦૦૦ = ૧૪૬૦૦૦/- પુરાના બિલનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

-સ.મ. મંજૂર-

કા.નં. - ૩૭

વિષય : ડ્રેનેજ શાખામાં STP પ્લાન્ટના ભંગાર નિકાલના કામે તા.૧૪-૦૭-૨૦૨૦ ની કારોબારી સમિતિના સભ્યોનો આવેલ પત્ર અંગે નિર્ણય થવા બાબત.

સભ્યશ્રી પ્રવિણભાઈ પટેલ સભ્યશ્રી ઉજ્જેશભાઈ પટેલ ગયા
દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : સદરહુ કામ સામાન્ય સભામાં નક્કી થયા મુજબ ભંગાર પ્રકરણમાં નગરપાલિકાના મુખ્ય ઈજનેરશ્રી હિતેષભાઈ પી.પટેલ દ્વારા FIR ફડાવવા માટે નિમાણુક કરવામાં આવે છે. તેથી તેમણે FIR કરવાની રહે છે. અને ભંગાર પ્રકારમાં જે તે કસુરવાર સામે ખાતાકીય તપાસ કરવા મામલતદાર કક્ષાના અથવા સક્ષમ અધિકૃત અધિકારીની નિમાણુક કરી કાયદેસરના પગલાં ભરવા માટે સર્વાનુમતે ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર-

કા.નં. - ૩૮

વિષય : મનોરંજનકર ગ્રાંટની ફાળવેલ ગ્રાંટમાંથી કામો નક્કી કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ: કા.સ.ઠ.નં. ૬૧ / તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ ના.ગુજરાત સરકારશ્રીના (૧) ગુ.મ્યુ.ફાઈ.બોર્ડ.,ગાંધીનગરના દ. હુકમ ક્રમાંક.: મફબ / મનો. કર /ગ્રાન્ટ /૨૦૧૯-૨૦ /વશી /૩૪૪૧ તા.:૨૦-૨-૨૦૨૦(૨) મફબ / મનો. કર /SCSPગ્રાન્ટ/૨૦૧૯-૨૦/વશી /૩૦૨૯ તા.:૧૬-૨-૨૦૨૦થી વલસાડ નગરપાલિકા વલસાડને મનોરંજન કર ગ્રાન્ટ હેઠળ રૂ. ૧૭૭૯૮૦૭/- પુરાની ફાળવવામાં આવેલ છે. જે મનોરંજન કરની ગ્રાન્ટની શરતો મુજબ અગ્રતા ક્રમના ધોરણે વલસાડ શહેરના હદ વિસ્તારમાં નીચે જણાવેલ વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેટની રકમ
જનરલ - ૧૬૫૩૬૧૫				
૧	૧૦	શાંતિનગર સોસાયટીનો મુખ્ય રોડ તેમજ આંતરિક ગલીમાં ડામર રસ્તાનું કામ	ડામર રોડ	૧૭૫૨૫૦૦
SCSP - ૧૨૬૧૯૨				
૨	૧	ઓનેસ્ટ ગેરેજની આસ-પાસનો વિસ્તાર	પેવરબ્લોક	૧૮૩૫૦૦
			કુલ રકમ રૂ.	૧૯૩૬૦૦૦

સ.મ.મંજુર..

કા.નં. - ૩૯

વિષય.: નામદાર સરકારશ્રીની મનોરંજનકર ગ્રાન્ટ વર્ષ : ૨૦૧૫-૧૬ રીવાઈઝડ તથા વર્ષ : ૨૦૧૬-૧૭ થી ફાળવવામાં આવેલ રકમ પૈકી બાકી રહેતી રકમ રૂ.૯૯૪૪૯૦/- બચત રકમ હેઠળ કામો નક્કી કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.: કા.સ.ઠ.નં. ૬૬ / તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ નામદાર સરકારશ્રીની મનોરંજનકર ગ્રાન્ટ વર્ષ : ૨૦૧૫-૧૬ રીવાઈઝડ તથા વર્ષ : ૨૦૧૬-૧૭ થી ફાળવવામાં આવેલ રકમ રૂ. ૨૩,૮૪,૧૧૪/- પૈકી મીની વોટર ટેન્કર ખરીદી કરેલ છે. તે પૈકી બાકી રહેતી રકમ રૂ.૯,૯૪,૪૯૦/- બચત રકમ હેઠળ આરોગ્ય શાખા માટે ઉપ એચ.પી. ના સારી કંપનીના ટ્રેક્ટર નંગ-૨, ખરીદ કરવા માટેની જરૂરી આગળની કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૪૦

વિષય : સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૧૮ અન્વયે અબ્રામા હેડવર્ક્સ ખાતે કમ્પોસ્ટીંગ પીટ બનાવવાનું આયોજન કરવામાં આવેલ અને સદરહુ કામગીરી કરવા માટે ઠેકેદારશ્રી રન્નાદે કન્સ્ટ્રક્શન , તિથલ રોડ , વલસાડ પાસે કરાવેલ. જે કરેલ કામગીરીનું બીલ રૂા.૨ ,૮૮,૫૪૬/- મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ: કા.સ.ઠ.નં. ૧૨૨ / તા.૧૮-૧૦-૨૦૨૦ની ભલામણ મુજબ સ્વચ્છ સર્વેક્ષણ - ૨૦૧૮ અન્વયે અબ્રામા હેડવર્ક્સ ખાતે કમ્પોસ્ટીંગ પીટ બનાવવાનું આયોજન કરવામાં આવેલ અને સદરહુ કામગીરી કરવા માટે ઠેકેદારશ્રી રન્નાદે કન્સ્ટ્રક્શન , તિથલ રોડ , વલસાડ પાસે કરાવેલસદરહુ કામગીરી અન્વયે કન્સલ્ટન્ટશ્રી દ્વારા સ્થળ તપાસ કરી ઠેકેદારશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ બીલનું જરૂરી COP આપવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ ઠેકેદારશ્રી કરેલ કામગીરીનું આવેલ બીલ રૂા.૨,૮૮,૫૪૬/- અંકે રૂા. બે લાખ અઠ્ઠાણું હજાર પાંચ સો છેતાલીસ ચુકવાણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૪૧

વિષય : વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં અબ્રામા પોલીસ હેડક્વાર્ટર ખાતે ના.સરકારશ્રીની યોજના હેઠળ ડામર રોડ બનાવવાની કામગીરી હાલે પ્રગતિમાં છે. સદરહું વિસ્તારમાં રસ્તા પહોળા કરવાના કામે આર.સી.સી.ફેન્સીંગ પોલ (હેવી ડયુટી)નંગ-૧૦૦ ની ખરીદી તાત્કાલિક જરૂરીયાત હોય, સદરહું કામે વલસાડના સ્થાનિક વેપારી વસંત હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોર્સ, વલસાડ પાસેથી ખરીદી કરી કામગીરી કરાવેલ. જે કરાવેલ કામગીરીને બહાલ રાખી આવેલ બીલ રૂ.૨૯,૫૦૦/- મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૨૩ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં અબ્રામા પોલીસ હેડક્વાર્ટર ખાતે ના.સરકારશ્રીની યોજના હેઠળ ડામર રોડ બનાવવાની કામગીરી હાલે પ્રગતિમાં છે. સદરહું વિસ્તારમાં રસ્તા પહોળા કરવાની જરૂરીયાત હોય, સદરહું વિસ્તારમાં રસ્તા પહોળા કરવાના કામે આર.સી.સી.ફેન્સીંગ પોલ (હેવી ડયુટી)ની જરૂરીયાત હોય, તે માટે આર.સી.સી.ફેન્સીંગ પોલ (હેવી ડયુટી)નંગ-૧૦૦ ની ખરીદી તાત્કાલિક જરૂરીયાત હોય, સદરહું કામે વલસાડના સ્થાનિક વેપારી વસંત હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોર્સ, વલસાડ પાસેથી ખરીદી કરી કામગીરી કરાવેલ. જે કરાવેલ કામગીરીને બહાલ રાખી આવેલ બીલ રૂ.૨૯,૫૦૦/- અંકે રૂ. ઓગણત્રીસ હજાર, પાંચસો પુરાનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર.

કા.નં. - ૪૨

વિષય : વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં હાલર ચાર રસ્તા સર્કિટ હાઉસના પાછળના ભાગે આવેલ સી.સ.નં. ૪૪૩૬ / અ પૈકી, ટી.પી.સ્કીમ નં.-૦૨, ફા.પ્લોટ નં.-૪૨૧/૧/૨વાળો ન.પા. હસ્તકના ખુલ્લા પ્લોટમાં ફેંસીંગ કરવાના કામે માલ-સામાન ખરીદી, વલસાડના સ્થાનિક વેપારી વસંત હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોર્સ, વલસાડ પાસેથી કરેલ. જે અંગેનું આવેલ બીલ રૂ.૪૯,૮૬૨/- મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.-૧૨૪ / તા.: ૧૯-૧૦-૨૦૧૯ ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા હદમાં હાલર ચાર રસ્તા સર્કિટ હાઉસના પાછળના ભાગે આવેલ સી.સ.નં. ૪૪૩૬ / અ પૈકી, ટી.પી.સ્કીમ નં.-૦૨, ફા.પ્લોટ નં.-૪૨૧/૧/૨વાળો નગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ફેંસીંગ કરવાના કામે માલ-સામાન ખરીદ કરવાનું મંજૂર કરવામાં આવેલ છે. સદરહુ મંજૂર થયા મુજબ ફેંસીંગ કરવા માટે માલસામાન વસંત હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોર્સ, આઝાદ ચોક, વલસાડ પાસે ખરીદ કરવામાં આવેલ. સદરહુ ખરીદી અંગેનું આવેલ બીલ રૂ.૪૯,૮૬૨/- અંકે રૂ.ઓગણ પચાસ હજાર, આઠસો બાસઠ પુરાનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર.

કા.નં. - ૪૩

વિષય : વલસાડ નગરપાલિકા હદમાં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહત તા.:૦૮-૦૨-૨૦૧૯ ના રોજ અબ્રામા ખાતે આયોજન કરવામાં કરવામાં આવેલ છે.સદરહું ખાતમુહતના કાર્યક્રમમાં જરૂરીયાત મુજબના સ્ટેજ,ખુરશી, બેકડ્રોપ, મંડપ, સાઉન્ડ સીસ્ટમ, વિગેરેની કામગીરી મંજૂર થયેલ વાર્ષિક ભાવોથી સદરહું કામગીરી રામગીર ડેકોરેટર્સ,વલસાડ પાસેથી કરાવેલ. જે અંગેનું આવેલ બીલ રૂ.૪૦,૬૮૫/- મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૨૫ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા હદમાં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહત તા.:૦૮-૦૨-૨૦૧૯ ના રોજ અબ્રામા ખાતે આયોજન કરવામાં કરવામાં આવેલ છે.સદરહું ખાતમુહતના કાર્યક્રમમાં જરૂરીયાત મુજબના સ્ટેજ, ખુરશી, બેકડ્રોપ, મંડપ, સાઉન્ડ સીસ્ટમ, વિગેરેની કામગીરી મંજૂર થયેલ વાર્ષિક ભાવોથી સદરહું કામગીરી રામગીર ડેકોરેટર્સ,વલસાડ પાસેથી કરાવેલ. જે અંગેનું આવેલ બીલ રૂ.૪૦,૬૮૫/- અંકે રૂ. ચાલીસ હજાર, છસો પંચ્યાંસી પુરાનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર.

કા.નં. - ૪૪

વિષય : ના.સરકારશ્રીની અમૃત યોજના હેઠળ જુદા જુદા કામોમાં કન્સલ્ટન્ટ તરીકે ધવલ એન્જીનીયર્સ, ગાંધીનગર ધ્વારા બીલોની ચકાસણી કરી બીલોનું ચુકવણું કરવા માટે જરૂરી સર્ટીફિકેટ ઓફ પેમેન્ટ (cop) આપવામાં આવે છે. જેથી (cop) આપવા અંગેનું કન્સલ્ટન્ટશ્રી ધવલ એન્જીનીયર્સ, ગાંધીનગરનું આવેલ બીલ રૂ. ૧,૮૪,૧૫૬/- મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૩૦ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની અમૃત યોજના હેઠળ (૧) સને: ૨૦૧૬-૧૭ ના વર્ષ દરમ્યાન અબ્રામા ઓવરબીજ થી ધરમપુર ચોકડી સુધી કુટપાથ અને સાયકલ ટ્રેક બનાવવાનું કામ (૨) સને : ૨૦૧૭-૨૦ ના વર્ષ દરમ્યાન અર્બન ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં મલ્ટીલેવલ પાર્કિંગ ફોર પબ્લીક (ગ્રાઉન્ડ ફ્લોર + એકમાળ) બનાવવાનું કામ તેમજ (૩) સને : ૨૦૧૭-૨૦ ના વર્ષ હેઠળ વલસાડ નગરપાલિકા હદમાં વરસાદી ગટર બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ છે. સદરહું હાલે પ્રગતિ હેઠળ છે. અને એજન્સી ધ્વારા કરેલ કામગીરીનું બીલ અત્રેની કચેરીએ રજુ કરવામાં આવેલ છે. ઉપરોક્ત યોજના હેઠળ મંજૂર કરેલ કામોમાં કન્સલ્ટન્ટ તરીકે ધવલ એન્જીનીયર્સ, ગાંધીનગરની નિમણુંક કરવામાં આવેલ છે. ઉપરોક્ત યોજના અન્વયે અત્રેની કચેરીએ ઠેકેદારશ્રી ધ્વારા રજુ કરવામાં આવેલ બીલોની કન્સલ્ટન્ટશ્રી ધવલ એન્જીનીયર્સ, ગાંધીનગર ધ્વારા સ્થળ તપાસ કરી બીલોનું ચુકવણું કરવા માટે જરૂરી સર્ટીફિકેટ ઓફ પેમેન્ટ (cop) આપવામાં આવે છે. ઉપરોક્ત યોજનાના ઠેકેદારશ્રી તરફથી રજુ કરવામાં આવેલ બીલોનું સર્ટીફિકેટ ઓફ પેમેન્ટ (cop) કન્સલ્ટન્ટશ્રી ધવલ એન્જીનીયર્સ, ગાંધીનગરનું ધ્વારા આપવામાં આવેલ છે. જેથી ઉપરોક્ત યોજના અન્વયે બીલોનું cop આપવા અંગેનું કન્સલ્ટન્ટશ્રી ધવલ એન્જીનીયર્સ, ગાંધીનગરનું બીલ રૂ. ૧,૮૪,૧૫૬/- અંકે રૂ. એક લાખ, ચોરાણું હજાર, એકસો છપ્પન પુરાનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર.

કા.નં. - ૪૫

વિષય : વલસાડ નગરપાલિકા હદમાં અબ્રામા વિસ્તારમાં આવેલ વસનજીપાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાય ગયેલ હોય, જેના નિકાલ માટે આયોજન કરી, ૮૦ મીટર જેટલી ૪૫૦ એમ.એમ.ડાયની આર.સી.સી. પાઈપલાઈન નાંખવાનું કામ, મંજૂર કરવામાં આવેલ વાર્ષિક ભાવોથી ઠેકેદારશ્રી શાંતિલાલ કે. બારીયા, અબ્રામા, વલસાડ પાસેથી કામગીરી કરાવવાનું નક્કી કરેલ. જે અંગેનું એસ્ટીમેઈટ તેમજ બીલ મંજૂર કરી કરેલ કામગીરીનો ખર્ચ રૂ. ૨૮૧૭૦૦/- મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૩૨ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા હદમાં અબ્રામા વિસ્તારમાં આવેલ વસનજીપાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાય ગયેલ હોય, જેના નિકાલ માટે આયોજન કરી, ઉપરોક્ત કામગીરી કરવા માટે અંદાજે ૮૦ મીટર જેટલી ૪૫૦ એમ.એમ.ડાયની આર.સી.સી. પાઈપલાઈન શ્રી સ્વામી નારાયણ સ્કુલના ગ્રાઉન્ડમાંથી નાખી ધારાનગરની વરસાદી ગટરમાં જોડવામાં આવેલ છે. અને સ્થળ ઉપર વરસાદી પાણીનો પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલ છે. સદરહું કામગીરી મંજૂર કરવામાં આવેલ વાર્ષિક ભાવોથી ઠેકેદારશ્રી શાંતિલાલ કે. બારીયા, અબ્રામા, વલસાડ પાસેથી કામગીરી કરાવવાનું નક્કી કરેલ. જે અંગેનું એસ્ટીમેઈટ તેમજ બીલ મંજૂર કરી કરેલ કામગીરીનો ખર્ચ રૂ. ૨૮૧૭૦૦/- અંકે રૂ.બે લાખ, એકયાંશી હજાર, સાતસો પુરા ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર.

કા.નં. - ૪૬

વિષય : માર્ગ અને મકાન વિભાગ,વલસાડ ધ્વારા સ્ટેટ હાઈવેનો રસ્તો પહોળો કરવાની કામગીરીમાં સદરહુ ગટરથી ઔરંગા નદી સુધી આર.સી.સી. પ્રોટેક્શન વોલ બનાવેલ છે. જેમાં નીકળેલ માટી સદરહુ પસાર થતી ગટર નજીક નાખવામાં આવેલ છે. જેને કારણે સદરહુ ગટર પુરાઈ જવાથી વરસાદની સીઝનમાં પાણીનું વહેણ અટકવાની પરીસ્થિતી સર્જાય એવી શક્યતા હોય, સદરહુ ગટરમાં પડેલ માટી કાઢવી ખુબજ જરૂરી અને આવશ્યક હોવાથી સદરહુ કામગીરી આઘશક્તિ એન્જીનીયરીંગ વર્ક્સ, સ્વાધ્યાય મંડળરોડ,પારડી પાસેથી કામગીરી કરાવવા માટે જરૂરી વર્કઓર્ડર આપવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૩૩ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની વર્ષ : ૨૦૧૮-૧૯ ના વર્ષની ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વલસાડ નગરપાલિકા હદમાં છીપવાડ રેલ્વે ગરનાળામાંથી પસાર થતી ગટર ઉપર બોક્ષ કલવર્ટ તેમજ આર.સી.સી. રોડ બનાવવાના કામે નાયબ માહિતી ખાતા મારફતે ટ્રેનિક પેપરમાં બહોળી પ્રસિધ્ધી કરાવી ઓનલાઈન ટેન્ડરીંગ કરવામાં આવતા મુદત દરમ્યાન કુલ-૦૨ ટેન્ડરો આવેલ છે. સદરહુ આવેલ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તા.:૦૪-૦૨-૨૦૨૦ ના રોજ ખુલ્લા કરવામાં આવેલ છે. અને સદરહુ બંને ટેન્ડરો કવોલીફાઈડ થતાં ઓનલાઈન ટેન્ડર તા.:૦૪-૦૨-૨૦૨૦ ના રોજ ખુલ્લા કરવામાં આવેલ છે. સદરહુ ખુલ્લા કરવામાં આવેલ ટેન્ડરોનું તુલનાત્મક પત્રક જોતાં એકંદરે ટેન્ડરરશ્રી આઘશક્તિ એન્જીનીયરીંગ વર્ક્સ, સ્વાધ્યાય મંડળ રોડ, આદર્શ સોસાયટી, ગર્વમેન્ટ ગેસ્ટ હાઉસની પાછળ, પારડીનું ટેન્ડર એસ્ટીમેઈટની રકમ રૂ. ૨૦,૦૧,૭૦૦/- થી ૧૦.૪૪% નીચા ભાવથી આવેલ રકમ રૂ. ૧૭,૯૨,૭૨૨/- નીચા ભાવથી ટેન્ડર આવેલ છે. જે અન્વયે કા.સ.ઠ.નં.-૪૫૫ / તા.: ૦૬-૦૨-૨૦૨૦ થી ટેન્ડરરશ્રી આઘશક્તિ એન્જીનીયરીંગ વર્ક્સ, સ્વાધ્યાય મંડળ રોડ, આદર્શ સોસાયટી, ગર્વમેન્ટ ગેસ્ટ હાઉસની પાછળ, પારડીનું ટેન્ડરમંજુર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.:૧૬-૦૩-૨૦૨૦ થી સદરહુ કામનો વર્કઓર્ડર આપવામાં આવેલ છે. જે અન્વયે એજન્સી ધ્વારા જરૂરી કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અને હાલે કોવીડ-૧૯ ના કારણે સદરહુ એજન્સી ધ્વારા કામગીરી બંધ કરવામાં આવેલ છે. સદરહુ કામગીરી કરવી ખુબજ આવશ્યક હોય, કારણ કે સદરહુ છીપવાડ ગરનાળા બંધ હોવાને કારણે આજુબાજુના ગામડાઓને ખુબજ ફેરાઓ ફરીને અવર-જવર કરવાની હોય, જો આ બાકી રહેલ કામગીરી થઈ જાય તો સદરહુ ગળનારું અવર-જવર કરવા માટે ખુલ્લુ કરી શકાય એમ છે. સદરહુ એજન્સી ધ્વારા ના.સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સદરહુ બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. સદરહુ કામ અન્વયે માર્ગ અને મકાન વિભાગ,વલસાડ ધ્વારા સ્ટેટ હાઈવેનો રસ્તો પહોળો કરવાની કામગીરીમાં સદરહુ ગટરથી ઔરંગા નદી સુધી આર.સી.સી. પ્રોટેક્શન વોલ બનાવેલ છે. જેમાં નીકળેલ માટી સદરહુ પસાર થતી ગટર નજીક નાખવામાં આવેલ છે. જેને કારણે સદરહુ ગટર પુરાઈ જવાથી વરસાદની સીઝનમાં પાણીનું વહેણ અટકવાની પરીસ્થિતી સર્જાય એવી શક્યતા હોય, સદરહુ ગટરમાં પડેલ માટી કાઢવી ખુબજ જરૂરી અને આવશ્યક હોવાથી સદરહુ કામગીરી આઘશક્તિ એન્જીનીયરીંગ વર્ક્સ, સ્વાધ્યાય મંડળરોડ,પારડી પાસેથી ચોમાસાની સીઝનને ધ્યાને લઈ કરવી ખુબજ જરૂરી જણાય છે. સદરહુ એજન્સી પાસે પોકલેન્ડ વાહન હોય, સદરહુ ગટરમાં પોકલેન્ડ જેવા વાહનથીજ સદરહુ ગટરની માટી કાઢી શકાય તેવી હાલતમાં હોય, સદરહુ એજન્સી પાસેથી કામગીરી કરાવવા માટે જરૂરી વર્કઓર્ડર આપી કામગીરી કરાવવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર.

કા.નં. - ૪૭

વિષય : વોર્ડ નં.-૧૧ માં જુદા જુદા ત્રણ વિસ્તારોમાં જેવાં કે,વાલિયા ફળિયા, અબ્રામા વિગેરે વિસ્તારમાં વરસાદી ગટર તેમજ ડામર રસ્તા બનાવવા માટે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૩૫ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વોર્ડ નં.-૧૧ માં જુદા જુદા ત્રણ વિસ્તારોમાં જેવાં કે,વાલિયા ફળિયા, અબ્રામા વિગેરે નીચે જણાવેલ વિસ્તારોમાં વરસાદી ગટર તેમજ ડામર રસ્તા બનાવવા માટેની જરૂરીયાત હોય, આયોજન મંડળની ગ્રાંટમાં સદરહું નીચે જણાવેલ કામનો સમાવેશ કરી, સદરહું કામગીરી કરવાનું ઠરાવવામાં આવે છે.

નંબર.	કામની વિગત.
૧	વાલિયા ફળિયા, અબ્રામા વિસ્તારમાં ભુગર્ભ લાઈનનું કામ.
૨	પંચવટી વિસ્તારમાં વિનોદ વિઠ્ઠલભાઈ પટેલની સામેની ગટરલાઈન તથા વિગેરે વિસ્તાર
૩	તાપાવાડ વિસ્તારમાં વોટર વર્ક્સ પાસેનો રસ્તો ડામરનો કરવાનું કામ.

સ.મ.મંજુર..

કા.નં. - ૪૮

વિષય : ના.સરકારશ્રીની વર્ષ : ૨૦૧૮-૧૯ ના વર્ષની ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વ.ન.પા.હદમાં છીપવાડ રેલ્વે ગરનાળામાંથી પસાર થતી ગટર ઉપર બોક્ષ કલવર્ટ તેમજ આર.સી.સી. રોડ બનાવવાના કામે ટેન્ડરરશ્રી આઘશક્તિ એન્જીનીયરીંગ વર્ક્સ, સ્વાધ્યાય મંડળરોડ, પારડીનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ.સદરહું કામે એસ્ટીમેઈટમાં ૫૫ મી.નો આર.સી.સી. રોડ મંજૂર કરવામાં આવેલ પરંતુ સ્થળ ઉપર કામગીરી શરૂ કરતાં ૭૨મી.નો રસ્તો જણાતા ૭૨ મી.નો આર.સી.સી. રોડ બનાવવામાં આવેલ છે. જેથી મંજૂર કરેલ ટેન્ડર એસ્ટીમેઈટ રકમથી વધારાનો ખર્ચ થયેલ છે. જેથી વધારાનો થયેલ ખર્ચનું ચુકવણું કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૩૬ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની વર્ષ : ૨૦૧૮-૧૯ ના વર્ષની ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વ.ન.પા.હદમાં છીપવાડ રેલ્વે ગરનાળામાંથી પસાર થતી ગટર ઉપર બોક્ષ કલવર્ટ તેમજ આર.સી.સી. રોડ બનાવવાના કામે ટેન્ડરરશ્રી આઘશક્તિ એન્જીનીયરીંગ વર્ક્સ, સ્વાધ્યાય મંડળ રોડ, પારડીનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ.સદરહું કામના એજન્સીની તા.: ૧૩-૦૭-૨૦૨૦ ની આવેલ અરજીમાં જણાવ્યા મુજબ સદરહું કામે એસ્ટીમેઈટમાં ૫૫ મીટરનો આર.સી.સી. રોડ મંજૂર કરવામાં આવેલ. પરંતુ સ્થળ ઉપર કામગીરી શરૂ કરતાં ૭૨ મીટરનો રસ્તો જણાતા ૭૨ મીટરનો આર.સી.સી. રોડ બનાવવામાં આવેલ છે. જેથી મંજૂર કરેલ ટેન્ડર એસ્ટીમેઈટ રકમથી વધારાનો ખર્ચ થયેલ છે. જેથી વધારાનો થયેલ ખર્ચનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૪૯

વિષય :

વોર્ડ નં.-૧૦ અમિત હોસ્પિટલ ગલીમાં નવો ડામર રોડનું કામ મંજૂર થયેલ હતું. જે અન્વયે ડામર રસ્તાનાં પહેલાં વરસાદી પાણીનાં નિકાલ માટેની આર.સી.સી. પાઈપલાઈનનું કામ કરવું ખુબજ જરૂરી છે. જે અંગે ૩૦૦ એમ.એમ.ડાયની આર.સી.સી. પાઈપલાઈનનું કામ અંગેનું એસ્ટીમેઈટ રૂા.૨,૦૩,૪૮૬/- મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૩૭ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ શરતચુકથી વોર્ડ નં.-૧૦ લખાયેલ છે.જેમાં સુધારો કરતાં વોર્ડ નં-૧૦ ને બદલે, વોર્ડ નં.-૮ માં આવેલ અમિત હોસ્પિટલ ગલીમાં નવો ડામર રોડનું કામ મંજૂર થયેલ હતું. જે અન્વયે ડામર રસ્તાનાં પહેલાં વરસાદી પાણીનાં નિકાલ માટેની આર.સી.સી. પાઈપલાઈનનું કામ કરવું ખુબજ જરૂરી છે. જે અંગે ૩૦૦ એમ.એમ.ડાયની આર.સી.સી. પાઈપલાઈનનું કામ અંગેનું એસ્ટીમેઈટ રૂા.૨,૦૩,૪૮૬/- અંકે રૂા. બે લાખ, ત્રણ હજાર, ચારસો છયાંસી પુરાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૫૦

વિષય :

ના.સરકારશ્રીની SJMMSVY-UDP-88(2018-19) હેઠળ વલસાડ નગરપાલિકા હદમાં જુદા જુદા પ્રકારના આંતરમાળખાકીય સુવિધાના વિકાસના કામો કરવા માટે (ખાનગી સોસાયટીનાં આંતરીક માર્ગો સિવાયનાં) કામોની દરખાસ્ત કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૪૧ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની SJMMSVY-UDP-88(2018-19) હેઠળ વલસાડ નગરપાલિકા હદમાં જુદા જુદા પ્રકારના આંતરમાળખાકીય સુવિધાના વિકાસના કામો કરવા માટે જા.બો.ઠ.નં.૫૩૭ / ૨૪-૦૭-૨૦૧૮ થી કુલ-૨૨ જેટલાં વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવેલ છે. સદરહું મંજૂર કરવામાં આવેલ કામોનું મે.પ્રાદેશિક કમિશ્નરશ્રી, સુરતના અધિકારીઓ ધ્વારા કામોનું સ્થળ તપાસ કરતાં નગરપાલિકા ધ્વારા મંજૂર કરવામાં આવેલ કામો પૈકી (૧) પ્રાકન / SJMMSVY-UDP-88(2018-19 / ગ્રાન્ટ / વલસાડ ન.પા. / વહીવટી મંજૂરી / પ્રથમ હપ્તો / વશી ૩૬૬ / ૨૦૧૮ / તા.૧૭૧૬ થી ૧૭૨૩ / તા.૦૨-૦૩-૨૦૧૯ થી કુલ-૧૮, વિકાસલક્ષી કામોની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ (૨) પ્રાકન / SJMMSVY-UDP-88(2018-19 / ગ્રાન્ટ / વલસાડ ન.પા. / વહીવટી મંજૂરી / પ્રથમ હપ્તો / વશી. ૨૮૪ / ૨૦૧૮ / તા.૨૦૮૮ થી ૨૦૯૫ / તા.૨૮-૧૧-૨૦૧૮ થી કુલ-૦૧ વિકાસલક્ષી કામોની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. એમ કુલ-૨૨ કામો પૈકી ૧૯ કામોની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે.

ઉપરોક્ત ના.સરકારશ્રીની યોજના હેઠળ કુલ-૨૨ કામો પૈકી નીચે જણાવ્યા મુજબના દરખાસ્ત કરવાના બાકી રહેતા કુલ-૦૩ કામો ખાનગી સોસાયટીમાં વરસાદી ગટર તેમજ ડામર રસ્તા બનાવવાના કામો મંજૂર કરેલ હોવાથી જરૂરી સોસાયટીઓના રહીશો ધ્વારા સોસાયટીના રસ્તા નગરપાલિકાને સુપ્રત કર્યેથી જરૂરી પ્રાદેશિક કમિશ્નરશ્રી, સુરતને દરખાસ્ત કરવાની થાય છે.

અ.નં.	કામનું નામ.	રકમ
૧	પ્રમુખ આશિયાના સોસાયટી, મુખ્ય રોડ ઉપરની ગટર અબ્રામા, ધરમપુર રોડ વિસ્તારમાં વરસાદી ગટર બનાવવાનું કામ.	૨૧,૬૭,૦૦૦/-
૨	પ્રમુખ શિવાલય મેઈન રોડથી આંતરિક ગલીઓમાં, અબ્રામા વિસ્તારમાં ડામર રોડ બનાવવાનું કામ.	૨૧,૯૯,૩૦૦/-
૩	રણછોડજી નગરની આંતરિક ગલીઓમાં ડામરરોડ બનાવવાનું કામ.	૧૪,૮૩,૬૦૦/-
	કુલ રકમ રૂ.	૫૮,૪૯,૯૦૦/-

ઉપરોક્ત ૦૩ કામો પૈકી અનુક્રમ નં.-૦૧ અને ૦૨ ના સોસાયટીના રહીશો ધ્વારા વરસાદી ગટર તેમજ ડામર રસ્તા બનાવવા માટે જરૂરી એફીડેવીટ નોટરી કરાવી અત્રેની કચેરીએ રજુ કરેલ છે. જે એફીડેવીટને ધ્યાને લઈ નગરપાલિકા ધ્વારા જરૂરી કારોબારી ઠરાવ કરી ૦૨(બે) કામોની મે. પ્રાદેશિક કમિશ્નરશ્રી, સુરતને દરખાસ્ત કરવામાં આવેલ.

ઉપરોક્ત ૦૨(બે) કામો અન્વયે પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ, સુરતના પત્ર ક્રમાંક નં.-પ્રાકન / ન.પા. / પત્ર નં. ૭૧૯ / ૨૦૧૯-૨૦ / જા.નં.૩૧૨૭ / તા.:૩૦-૦૭-૨૦૨૦ થી જણાવ્યા મુજબ ઉપરોક્ત ૦૨(બે) કામોની કરેલ દરખાસ્ત અન્વયે RCM કચેરી, સુરતના કાર્યપાલક ઈજનેરશ્રી ધ્વારા તા.:૧૪-૦૭-૨૦૨૦ ના રોજ કામોનું સ્થળ તપાસ કરતાં જણાવેલ છે કે " ખાનગી સોસાયટીના આંતરિક માર્ગો જણાયેલ છે. ખાનગી સોસાયટીના માર્ગોનો સમાવેશ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના આ ઘટક તળે થઈ શકે નહીં. " જેથી પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ, સુરત ધ્વારા કરેલ ૦૨(બે) કામોની દરખાસ્ત અત્રેની કચેરીએ પરત કરેલ છે.

જેથી ઉપરોક્ત આવેલ RCM ના પત્રને ધ્યાને લેતા ઉપરોક્ત દરખાસ્ત કરવાના બાકી રહેતા કુલ-૦૩(ત્રણ) કામો SJMMSVY-UDP-88(2018-19) ની ગ્રાન્ટમાંથી રદ કરવાના થાય છે. જેથી ઉપરોક્ત ૦૩(ત્રણ) કામો રદ કરી, રદ કરેલ કામોની રકમમાંથી નીચે જણાવ્યા મુજબના નવા વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેઈટની રકમ
૧	૯	હાલર, સીગ્નેચર એપાર્ટમેન્ટ થી કેવલ એપાર્ટમેન્ટ સુધી	ટ્રીમીક્ષ	૨૩૮૩૨૦૦
૨	૯	શ્રીનગર સોસાયટી, શંકર ભગવાનના મંદિર થી દિનેશભાઈના ઘર સુધી	પેવરબ્લોક	૧૧૫૭૭૦૦
૩	૯	શ્રીનગર, શિવાલી એપાર્ટમેન્ટની બાજુમાં સોસાયટી વાળી ગલીમાં	પેવરબ્લોક	૧૮૭૩૦૦
૪	૯	જલારામ મંદિરની બાજુની ગલીમાં તથા કોટક બેન્કની ગલીમાં	વરસાદી ગટર	૧૩૭૯૬૦૦
૫	૧૦	કેતનપાર્ક સોસાયટીમાં ડામર રસ્તાનું કામ	ડામર રોડ	૧૦૦૦૪૦૦
			કુલ રકમ રૂ.	૬૧૦૮૨૦૦

સ.મ.મંજુર..

કા.નં. - ૫૧

વિષય :

ફા.એન્ડ લા.ક.ઠ.નં.૧/તા.:૧૧/૯/૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ, સ્ટ્રીટલાઈટ સુવિધા અંગે અંદર ગ્રાઉન્ડ 50MM DIA DWC PIPE નાંખવા અંગેનું આવેલ બીલ રૂા.૩,૮૮,૨૨૦/-મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૪૨ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ,વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ડી.એસ.પી. ઓફીસથી ચાર રસ્તા - તિથલરોડ સુધીના રસ્તાની મધ્યમાં R.C.C. ડીવાઈડરો બનાવવાની કામગીરી કાર્યરત હોય જે સંદર્ભે મે. કલેક્ટરશ્રીની સુચના અન્વયે સદરહુ ડીવાઈડરો બાંધકામના ચાલુ કામે સ્ટ્રીટ લાઈટ સુવિધા અંગે જરૂરીયાત મુજબના કેબલ / પાઈપો નાખવા સુચન કરેલ હોય, જે ધ્યાને લેતાં સદરહુ ડીવાઈડરમાં અંદર ગ્રાઉન્ડ 50MM DIA DWC PIPE નાંખવાની જરૂરીયાત સંદર્ભે, તાકીદે વલસાડના સ્થાનિક કેપ્ટન્સ ઈલેક્ટ્રીકલ્સ એન્ડ કંટ્રોલ્સ - વલસાડ પાસે જરૂરીયાત મુજબના ૨૦૦૦ મીટર જેટલાં પાઈપ ખરીદ કરેલ, જે અંગેનું આવેલ બીલ રૂા.૩,૮૮,૨૨૦/- અંકે રૂા. ત્રણ લાખ,અઠ્યાંશી હજાર, બસો વીસ પુરાનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૫૨

વિષય :

યોગેશભાઈ કિશોરભાઈ સોલંકી, સફાઈ કામદાર સ્વ.કિશોરભાઈ કાલીદાસ સોલંકીના વારસદાર પુત્રની વારસદાર તરીકે રહેમરાહે નિમણુંક આપવા બાબતની અરજી અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.પ્રવિણભાઈ એસ.પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૪૩/ તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકાના ડ્રેનેજ શાખામાં કાયમી હરીજન સફાઈ કામદાર કિશોરભાઈ કાલીદાસ સોલંકીનું તા.:૨૬/૦૪/૨૦૨૦ ના રોજ દુખદ અવસાન થયેલ હતું. નામદાર ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ઠરાવ ક્રમાંક: નપમ / ૧૨૨૦૧૭ / સી.ફા.૨૮ / આર સચિવાલય,ગાંધીનગર તારીખ.:૧૮/૧૦/૨૦૧૭ ના રોજ પરીપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યની નગરપાલિકાઓમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારનું ચાલું નોકરી દરમ્યાન અવસાન પામનાર સફાઈ કામદારના વારસદારને વારસદાર તરીકે રહેમરાહે નિમણુંક આપવાના સંજોગોમાં તેના એક વારસદારને પરિશિષ્ટની શરતોને આધીન વારસદાર તરીકે રહેમરાહે નિમણુંક આપવાનું ઠરાવવામાં આવેલ છે. મરણ પામનાર હરીજન કામદાર કિશોરભાઈ કાલીદાસ સોલંકીની નોકરી પાંચ વર્ષ કરતાં વધુ થયેલ છે

આ યોજનાઓ હેતુ કોઈપણ જીવન નિર્વાહમાં સાધન સિવાય સ્થિતિમાં નગરપાલિકાઓમાં ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર સફાઈ કામદારના આશ્રિત કુટુંબના એક સભ્યને રહેમરાહે નિમણુંક આપી નાણાંકીય ભીસમાં રાહત આપવા અને આવી રહેલ આકસ્મિક કટોકટીને પહોંચી વળવામાં કુટુંબને મદદ કરવાની આ યોજનાનો હેતુ છે

પરિશિષ્ટ ૧,૨,બી મુજબ આશ્રિત કુટુંબના સભ્યમાં વારસદારના પુત્રને લાભ મળવાપાત્ર થાય છે અરજદાર શ્રી યોગેશભાઈ કિશોરભાઈ સોલંકી વારસદારનાં પુત્ર છે. તેઓ એ આ યોજનાનો લાભ આપવાનો થાય છે.

શ્રી યોગેશભાઈ કિશોરભાઈ સોલંકીએ તેઓના પિતાનાં અવસાન બાદ આ યોજનાનો લાભ મેળવવા તારીખ.:૧૫ /૦૫ / ૨૦૨૦ ના રોજ અરજી કરેલ છે જે અરજી વારસદારનો મૃત્યુ પછી છ માસમાં કરવાની થાય છે. શ્રીયોગેશભાઈ કિશોરભાઈ સોલંકીએ છ માસની મુદતની અંદર અરજી કરેલ છે. અરજદારે વારસદારમાં મરણનો દાખલો, સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ, જાતિનો દાખલો, રેશનકાર્ડ, આધાર કાર્ડ , વિગેરે પુરાવા અરજી સાથે રજુ કરેલ છે. સરકારશ્રીની યોજના મુજબ અરજદાર તેઓનાં પિતા કિશોરભાઈ કાલીદાસ સોલંકીની ખાલી પડેલ જગ્યાએ વારસાઈ હકકના ધોરણે નિમણુંક આપવા અરજીમાં જણાવેલ છે. જે મુજબ અરજદારને નિમણુંક આપવા માટે આગળની નિયમ મુજબની કાર્યવાહી થવા અંગેના આવેલ કામે, ચર્ચા વિચારણાના અંતે,અરજદારશ્રી યોગેશભાઈ કિશોરભાઈ સોલંકીને વારસાઈ હકકના ધોરણે નિમણુંક આપવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૫૩

વિષય :

કોરોના (COVID-19) વૈશ્વિક મહામારીના કપરા સમયમાં વલસાડ વિસ્તારમાં રહેતા ઘરવિહોણા લોકો, ભિક્ષુકો, રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો, લોકડાઉનને કારણે ફસાયેલ, તેમજ બીજા રાજ્યમાંથી રોજગારી અર્થે આવેલ અને પાછા ફરી ન શકેલ એવા લાભાર્થીઓને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત **SUH** ઘટક હેઠળ ચલાવવામાં આવેલ કામચલાઉ આશ્રયસ્થાન કે જે તિથલરોડ પર આવેલ કુમાર છાત્રાલયમાં રાખવામાં આવેલ ૧૩૦ જેટલાં લાભાર્થીઓને રહેવાની, જમવાની અને ચા નાસ્તાની સુવિધા માટે અનાજ કરીયાણાના સામાન તેમજ તેમની પર્સનલ હાઈઝીનને ધ્યાનમાં રાખીને તેમને હાઈઝીન કિટનું વિતરણ કરવામાં આવેલ. જેની ખરીદી બોમ્બે ગ્રેઈન એન્ડ પ્રોવીઝન સ્ટોર, તીથલરોડ, વલસાડ પાસે કરેલ. જેનું આવેલ બીલ રૂ. ૨૭,૬૮૦/- પુરા મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૪૬ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ કોરોના (COVID-19) વૈશ્વિક મહામારીના કપરા સમયમાં વલસાડ વિસ્તારમાં રહેતા ઘરવિહોણા લોકો, ભિક્ષુકો, રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો, લોકડાઉનને કારણે ફસાયેલ, તેમજ બીજા રાજ્યમાંથી રોજગારી અર્થે આવેલ અને પાછા ફરી ન શકેલ એવા લાભાર્થીઓને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત **SUH** ઘટક હેઠળ ચલાવવામાં આવેલ કામચલાઉ આશ્રયસ્થાન કે જે તિથલરોડ પર આવેલ કુમાર છાત્રાલયમાં રાખવામાં આવેલ ૧૩૦ જેટલાં લાભાર્થીઓને રહેવાની, સુવાની તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓ ઉપરાંત સવારનો નાસ્તો ચા બપોરનું અને રાતનું જમવાનું સેવા મિત્ર મંડળ અને જલારામ અન્નક્ષેત્ર જેવી સામાજીક સંસ્થાઓ ધ્વારા આપવામાં આવતું હતું ત્યારબાદ વલસાડ નગરપાલિકા ધ્વારા લાભાર્થીઓને જમવાની અને ચા નાસ્તાની સુવિધા કરવામાં આવેલ છે જે માટે જરૂરી અનાજ કરીયાણાના સામાન તેમજ તેમની પર્સનલ હાઈઝીનને ધ્યાનમાં રાખીને તેમને હાઈઝીન કિટનું વિતરણ કરવામાં આવેલ. જેની ખરીદી બોમ્બે ગ્રેઈન એન્ડ પ્રોવીઝન સ્ટોર, તીથલરોડ, વલસાડ પાસે કરેલ. જેનું આવેલ બીલ રૂ. ૨૭,૬૮૦/- પુરાનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર.

કા.નં. - ૫૪

વિષય :

હાઉસ ટેક્ષ ડીપાર્ટમેન્ટમાં જુન-૨૦૨૦ માં દર વર્ષની જેમ ૧૦% રીબેટ સ્કીમ દરમ્યાન કરદાતાને ગરમી તથા વરસાદથી બચવા તથા કોરોના મહામારીને લીધે સોશીયલ ડીસ્ટેન્સીંગ સાથે લાઈનમાં પૈસા ભરવામાં તકલીફ ન પડે તે માટે સાગર મંડપ ડેકોરેશન પાસે ૧-માસ માટે મંડપ બંધાવેલ. જે અંગેનું આવેલ બીલ રૂ. ૨,૪૦,૦૦૦/- મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૪૮ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ હાઉસ ટેક્ષ ડીપાર્ટમેન્ટમાં જુન-૨૦૨૦ માં દર વર્ષની જેમ ૧૦% રીબેટ આપવાનું થાય છે. રીબેટ સ્કીમ દરમ્યાન ટેક્ષ ભરનારાઓ ઘણી મોટી સંખ્યામાં ટેક્ષ ભરવા આવે છે. તેને લીધે ડીપાર્ટમેન્ટની બહાર સુધી લાઈન લાગે છે. જુન માસમાં ગરમી તથા વરસાદ બંને ઋતુ હોય મંડપ બંધાવવાની જરૂરીયાત જણાતાં તથા કોરોના મહામારીને લીધે સોશીયલ ડીસ્ટેન્સીંગ સાથે લોકો લાઈનમાં પૈસા ભરવામાં તકલીફ ન પડે તે માટે સાગર મંડપ ડેકોરેશન, રાખોડીયા તળાવ, ગાયત્રી મંદિર સામે, વલસાડ પાસે ૧-માસ માટે મંડપ બંધાવેલ. જે અંગેના આવેલ બીલ નં.૫૦૭, ૫૦૮/ તા.:૩૦-૬-૨૦૨૦ થી આવેલ બીલ રૂ. ૧,૨૦,૦૦૦/- + રૂ. ૧,૨૦,૦૦૦/- મળી કુલ બીલની રકમ રૂ. ૨,૪૦,૦૦૦/- અંકે રૂ. બે લાખ, ચાલીસ હજાર પુરાનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર..

કા.નં. - ૫૫

વિષય :

વલસાડ નગરપાલિકાની માલિકીની ન્યુ સુપર માર્કેટમાં આવેલ દુકાનોનું ભાડુ વસુલ કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : વલસાડ નગરપાલિકાની માલિકીની ન્યુ સુપર માર્કેટમાં આવેલ દુકાન નં-૭-૮ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટના સ્પેશીયલ સીવીલ એપ્લીકેશન નં-૩૪૮૨/૨૦૧૨ થી કેસ ચાલુ છે. હાઈકોર્ટમાં કેસ ચાલુ હોય, હાઈકોર્ટના કેસનો આખરી નિર્ણય આવ્યેથી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૫૬

વિષય :

હોસ્પીટલ કમીટી ઠરાવ નં.૪ / તા.:૨૮-૦૫-૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ હોસ્પીટલ માટે બેડ નંગ-૫૦(પલંગ) ખરીદ કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૬૬ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ હાલ કોવીડ-૧૯ ના કોરોના વાઈરસની મહામારીમાં હોસ્પીટલને ડેડિકેટડ કોવીડ હેલ્થ સેન્ટર વલસાડ જીલ્લા માટે અધિકૃત કરવામાં આવેલ છે. જેથી ચાર જનરલ વોર્ડ, સેમી સ્પેશીયલ રૂમ તેમજ ઈમરજન્સી વોર્ડ તથા આઈ.સી.સી. યુ. વોર્ડ જે બધુ મળી કુલ-૭૫ જેટલા બેડો થવા જાય છે. હાલે હોસ્પીટલ પાસે કુલ-૫૦ બેડ (પલંગ) ઉપલબ્ધ છે.જેથી ભવિષ્યને ધ્યાને લઈ તથા હેલ્થ ડીપાર્ટમેન્ટની સુચના અન્વયે ૧૦૦ બેડની હોસ્પીટલનું આયોજન રાખવા સુચના આપવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ વધુ -૫૦ બેડ જેટલા (પલંગ) ખરીદ કરવા માટે સરકારશ્રીના વેબ પોર્ટલ જેમ ઉપરથી એલ-૧, પાસે કારોબારી સમીતીની મંજૂરતની અપેક્ષાએ ખરીદ કરેલ, જેને બહાલ રાખવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર..

કા.નં. - ૫૭

વિષય :

હોસ્પીટલ કમીટી ઠરાવ નં.૬ / તા.:૨૮-૦૫-૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ હોસ્પીટલમાં પાવર સપ્લાઈ ના હોય તેવા સંજોગોમાં ઈમરજન્સી માટે જનરેટર ખરીદ કરી ઈન્સ્ટોલેશન અને ઈરેક્શન તથા ઓપરેશન મેઈન્ટેનન્સ કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૬૮ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ હાલ કોવીડ-૧૯ ના કોરોના વાઈરસની મહામારીમાં હોસ્પીટલને ડેડીકેટ કોવીડ હેલ્થ સેન્ટર વલસાડ જીલ્લા માટે અધિકૃત કરવામાં આવેલ છે. અને મે. જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની તા.: ૦૬-૦૫-૨૦૨૦ ના રોજની ચીફ ઓફીસરશ્રી સાથેની રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉપરોક્ત વિષયે કોવીડ-૧૯ ના કોરોના વાઈરસના દર્દીઓ માટે ઓક્સીજનની વ્યવસ્થા કરવાનું જણાવેલ છે. હાલે હોસ્પીટલમાં પાવર સ્પલાઈનની સુવિધા ઉભી કરવા ૬૨.૫ કે.વી.એ.ડીઝલ જનરેટર મુકીને પાવર સ્પલાઈનની વ્યવસ્થા કરવાની જણાય છે સદરહુ જનરેટર સરકારશ્રીના વેબ પોર્ટલ જેમ ઉપરથી ખરીદ કરી ઈન્સ્ટોલેશન અને ઈરેક્શન તથા ઓપરેશન મેઈન્ટેનન્સ કરવાનું કારોબારી સમિતિની તથા સમગ્ર સભાની મંજૂરતની અપેક્ષાએ કામગીરી સત્વરે શરૂ કરાવી પુર્ણ કરવાનું અને આવેલ બીલનું ચુકવણું કરવાનું તથા નગરપાલિકા ઓફિસમાં પણ આ મુજબનું કામ કરાવી ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજૂર..

કા.નં. - ૫૮

વિષય :

હોસ્પિટલ કમીટી ઠરાવ નં.૮ / તા.:૨૮-૦૫-૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ હોસ્પિટલમાં સેન્ટ્રલાઈઝ ઓક્સીજન પાર્કિંગ લાઈન, ઓક્સીજન જમ્બો સીલીન્ડરને ખરીદ કરી ઈન્સ્ટોલેશન અને ઈરેક્શન તથા ઓપરેશન મેઈન્ટેનન્સ કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૭૦ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ હાલ કોવીડ-૧૯ ના કોરોના વાઈરસની મહામારીમાં હોસ્પિટલને ડેડીકેટ કોવીડ હેલ્થ સેન્ટર વલસાડ જીલ્લા માટે અધિકૃત કરવામાં આવેલ છે. અને મે. જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની તા.: ૦૬-૦૫-૨૦૨૦ ના રોજની ચીફ ઓફીસરશ્રી સાથેની રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉપરોક્ત વિષયે કોવીડ-૧૯ ના કોરોના વાઈરસના દર્દીઓ માટે ઓક્સીજનની વ્યવસ્થા કરવાનું જણાવેલ છે.

આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી સીવીલ હોસ્પિટલના મંજુર થયેલ ભાવોથી સદરહું કામગીરી કરાવવા માટે ચીફ ઓફીસરશ્રીને સુચના આપવામાં આવતા હાલની પરિસ્થિતીને ધ્યાને લઈ અગ્રિમતાના ધોરણે આ કામના જાણકાર એવા જયરાજ એન્ટરપ્રાઈઝ, હનુમાન ભાગડા પાસે નગરપાલિકા સંચાલિત હોસ્પિટલના તમામ રૂમોમાં ઓક્સીજન પાર્કિંગ લાઈન, ઓક્સીજન જમ્બો સીલીન્ડરને ખરીદ કરી ઈન્સ્ટોલેશન અને ઈરેક્શન તથા ઓપરેશન મેઈન્ટેનન્સ કરવાનું કારોબારી સમિતિની તથા સમગ્ર સભાની મંજુરતની અપેક્ષાએ કામગીરી સત્વરે શરૂ કરાવી પુર્ણ કરવાનું અને આવેલ બીલનું ચુકવણું કરવાનું ઠરાવેલ. જેને બહાલ રાખવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજુર..

કા.નં. - ૫૮

વિષય :

હોસ્પીટલ કમીટી ઠરાવ નં.૨/ તા.:૧૪ -૦૬-૨૦૧૯ થી ઠરાવથી આઉટસોસીંગથી લેબોરેટરી ટેકનીશીયન લેવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.પ્રવિણભાઈ ભાનુશાલી

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૭૮ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પીટલમાં લેબોરેટરી એટલે કે દર્દીઓ માટે લોહી-પેશાબનુ પૃથ્થકરણ કરવા માટે હોસ્પીટલમાં આવેલી લેબોરેટરી વિભાગમાં પૃથ્થકરણ કરવા માટે સાધનો સરકારશ્રીની ગ્રાન્ટમાંથી ખરીદ કરવામાં આવેલ છે.

હાલમાં સરકારશ્રી ટી.બી. એટલે કે આર.એન.ટી.પી.સી.પી. નાં પ્રોગ્રામ હેઠળ એક લેબ ટેકનીશીયનની નિમણુંક કરવામાં આવેલ છે. પરંતુ તેમનાથી લેબોરેટરીના રીપોર્ટ કરવા માટે પહોંચી વળાય એમ નથી.

તેથી હોસ્પીટલમાં હાલમાં આઉટસોસીંગ થી અન્ય સ્ટાફની ભરતી કરવામાં આવેલ છે. અને આ વિશ્વા એન્ટરપ્રાઈઝ જે મેનપાવર સપ્લાય કરે છે.તેમાંથી લેબોરેટરીમાં જરૂરીયાત મુજબની લાયકાત ધરાવતાં લેબ ટેકનીશીયનની નિમણુંક કરવામાં આવે તો હોસ્પીટલમાં આવતા દર્દીઓને રાહતદરે લોહી-પેશાબના રીપોર્ટ મળી શકે એમ છે. જે હકીકતોથી વિદીત થતાં એક (૧) લેબ ટેકનીશીયનની લાયકાત મુજબની નિમણુંક કરવા અંગેની જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અંગે હો.ક.ઠ.નં.-૨૭ / તા.: ૩૦-૯-૨૦૨૦થી ઠરાવ્યા મુજબ ચીફ ઓફીસરશ્રીને સત્તા આપવામાં આવેલ છે. જેના આધારે હોસ્પીટલ જા.નં. ૮૨૯ / તા.: ૧૪-૧૦-૨૦૨૦ થી શકિત સીક્યુરીટી, તાડવાડી રાંદેર, સુરત સીટીને હોસ્પીટલ માટે આઉટ સોસીંગ સ્ટાફ પુરો પાડવા બાબતનો વર્ક ઓર્ડર આપીને ક્રમાંક નં.-૫ થી લેબ ટેકનીશીયન-૧(એક) લેવામાં આવેલ છે. જેને મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૦

વિષય :

ના.સરકારશ્રીની " અમૃત " યોજના અંતર્ગત પારડી -સાંઢપોર ખાતે ૨૦.૨ MLD STP-1 પ્રિમાઈસીસમાં " 174 KW નો સોલર પાવર પ્રોજેક્ટ " DPR ને જરૂરી બહાલી આપવા બાબતેનું આવેલ કામે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૭૯ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની " અમૃત " યોજના અંતર્ગત પારડી -સાંઢપોર ખાતે ૨૦.૨ MLD STP-1 નો પ્રોજેક્ટ ચાલે છે. સદર STP ના ઉપયોગથી શહેરીજનોને જરૂરી ડ્રેનેજ સુવિધા આપવામાં આવે છે. સદર ચાલવા માટે હેવી ઈલેક્ટ્રીક મશીનરીઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેને ચાલવા માટે DGVCL તરફથી જરૂરી પાવર લોડ લેવામાં આવેલ છે. સદર પ્લાન્ટ નજીકના સમયમાં ચાલુ થનાર હોઈ અને DGVCL નું દર મહીને લાઈટ બીલ જનરેટ થશે અને લાખો રૂપિયાનું ભારણ પડશે. સદર ભરણને ઘટાડવા માટે નામદાર સરકારશ્રીની " ગુજરાત સોલર પાવર પોલીસી-૨૦૧૫ " અમલીકરણ કરવામાં આવે છે, સદર બાબતે GUDC તરફથી અત્રેની કચેરીએથી જરૂરી પાવર કન્સમ્પશનની માહિતી માંગવામાં આવેલ અને સરકારશ્રી લેવલે જરૂરી મંજૂરી લીધેલ.

ઉપરોક્ત હકીકતોથી વિદિત થતાં GUDC અને કન્સલ્ટન્ટશ્રી " TUV ,ગાંધીનગર " તરફથી STP સાઈટ પર જરૂરી સાઈટ વિઝિટ કરેલ અને પ્રાયમરી લે-આઉટ અને લોડ શીટ ફીઝિબિલિટીના હિસાબે બનાવવામાં આવેલ જેમાં સદર પ્રિમાઈસીસમાં 174 KW સોલર પાવર પ્રોજેક્ટ ફીઝિબલ છે. સદર બાબતે અત્રેની કચેરી તરફથી તા.: 24/7/2020 ના રોજ ઈ-મેલ થી ડી.પી.આર. બનાવવા જણાવવા આવેલ અને તા.: 01/08/2020 ના રોજ ઈ-મેલ થી GUDC તરફથી સદર ડી.પી.આર. મોકલવામાં આવેલ છે જેમાં 174 KW સોલર પાવર પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ કોસ્ટ રૂ.93.78 લાખનો જણાવવામાં આવેલ છે. સદર પ્રોજેક્ટ કોસ્ટ સરકારશ્રી તરફથી કરવામાં આવશે. સદર ડી.પી.આર. અને પ્રોજેક્ટને જરૂરી બહાલી આપવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૧

વિષય :

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૦ની ઉજવણીના ભાગરૂપે આઝાદ ચોક ખાતેનું સર્કલ રીપેરીંગ / રીનોવેશન અંગેનું આર્યનંદ એન્વેરિક પ્રા.લી.-અમદવાદનું ભાવપત્રક મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૧ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૦ની ઉજવણીના ભાગરૂપે આઝાદ ચોક ખાતે ધ્વજવંદન માટેનાં પોલનું સર્કલ રીપેરીંગ / રીનોવેશન કરવાની જરૂર છે આ અંગે તા.: ૨૩-૧-૨૦નું આર્યનંદ એન્વેરિક પ્રા.લી.-અમદવાદનું ભાવપત્રક અત્રેની કચેરીએ મળેલ છે. સદરહું કામ તાત્કાલિક ધોરણે કરવાની જરૂર છે. જે અંગેનું આવેલ ભાવપત્રક મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૨

વિષય :

ના.સરકારશ્રીની ૧૪ માં નાણાંપંચની યોજના હેઠળ મોગરાવાડી જુની ઝોન ઓફિસ લાઈબ્રેરી તેમજ મેમોરીયલ હોલ બનાવવાના વધારાની કરેલ કામગીરી અન્વયે રૂા.૧૫,૨૧,૭૨૪/- પુરાનો ખર્ચ મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૨ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ના.સરકારશ્રીની ૧૪ માં નાણાંપંચની યોજના હેઠળ મોગરાવાડી જુની ઝોન ઓફિસ લાઈબ્રેરી તેમજ મેમોરીયલ હોલ બનાવવાનું કામ ઠેકેદારશ્રી ભરતકુમાર એ. ઓડેદરા, વલસાડનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ. જે અન્વયે ઠેકેદારશ્રી ધ્વારા સ્થળ ઉપર કામગીરી કરવામાં આવેલ છે. પરંતુ એજન્સીની અત્રેની કચેરીએ આવેલ અરજીમાં જણાવ્યા મુજબ સ્થળ ઉપર વધારાની આઈટમ તેમજ આઈટમોના જથ્થામાં વધારો કરવામાં આવેલ છે. જે અરજી અન્વયે કન્સલટન્ટશ્રી ધ્વારા સ્થળ તપાસ કરી વધારાના ખર્ચ અંગેનો જરૂરી અભિપ્રાય અત્રેની કચેરીએ સાદર કરેલ છે. સદરહુ અભિપ્રાયમાં જણાવ્યા મુજબ ટેન્ડરમાં મંજૂર થયેલ આઈટમોના જથ્થામાં વધારો થવા પામેલ છે અને મંજૂર થયેલ આઈટમો જરૂરીયાત મુજબ વપરાતા તે આઈટમની રકમમાં બચત પણ થયેલ છે. તેમજ કન્સલટન્ટશ્રીના પત્રમાં જણાવ્યા મુજબ મોગરાવાડી વિસ્તારના સદસ્યોની માંગણીને ધ્યાને લઈ તેમજ તે માંગણીને ધ્યાને લઈ ઈજનેરશ્રી સાથે રૂબરૂ ચર્ચા કરી ટેન્ડરના બહારની આઈટમ જરૂરીયાત મુજબ નાખવામાં આવેલ છે. જેથી ઉપરોક્ત બાબતને ધ્યાને લેતાં ઠેકેદારશ્રી ભરતકુમાર એ. ઓડેદરા, વલસાડ ધ્વારા સ્થળ ઉપર મંજૂર કરેલ ટેન્ડર રકમ કરતાં વધારાની કરેલ કામગીરી અન્વયે રૂા.૧૫,૨૧,૭૨૪/- પુરાનો ખર્ચ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૩

વિષય :

વલસાડ નગરપાલિકાના કાયમી પટાવાળા શ્રી સુરેશચંદ્ર જમનાદાસ ખંભાતીની તા.: ૩૦-૧૧-૨૦૨૦ ના રોજથી સ્વૈચ્છીક નિવૃત્તીની માંગણી કરતી આવેલ અરજી અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ઉજ્જેશભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૩ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકાના કાયમી પટાવાળા શ્રી સુરેશચંદ્ર જમનાદાસ ખંભાતી કે જેઓની વલસાડ નગરપાલિકાના ઓકટ્રોઈ શાખામાં તા.:૧૯-૯-૧૯૯૧ થી નિમણુંક થયેલ છે. ઓકટ્રોઈ નાબુદ થતાં વારિગૃહ શાખામાં ફિલ્ટર એટેન્ડન્ટની જગ્યાએ મુકવામાં આવેલ છે. હાલે તેઓ વહીવટી શાખામાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. તેમની જન્મ તા.: ૧૭ / ૧૧ / ૧૯૬૧ છે. તેઓ આગામી તા.: ૩૦-૧૧-૨૦૨૧ ના રોજ નિવૃત્ત થઈ રહેલ છે. પરંતુ હાલે તેઓની નાદુરસ્ત તબિયતને કારણે તા.: ૩૦-૧૧-૨૦૨૦ થી સદર આવેલ રાજીનામું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૪

વિષય :

વલસાડ નગરપાલિકાના કાયમી કલાર્ક(હાલે વારીગૃહ શાખા)ના શ્રી દિપક બી. કુબેરની તા.: ૩૦-૧૧-૨૦૨૦ ના રોજની ફરજ બજાવી સ્વૈચ્છીક નિવૃત્તીની માંગણી કરતી આવેલ અરજી અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ઉજ્જેશભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૪ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ નગરપાલિકાના ઓકટ્રોઈ શાખાના કાયમી કલાર્ક (હાલે વારીગૃહ શાખામાં કાયમી કલાર્ક) તરીકે ફરજ બજાવતા શ્રી દિપક બી. કુબેરની અંગત કારણોસર તેમણે તા.: ૨૫/૦૮/ ૨૦૨૦ ના રોજ નગરપાલિકાને અરજી આપી તા.: ૩૦/૧૧/૨૦૨૦ ના રોજની ફરજ બજાવી કચેરી સમય બાદ તેમની ફરજમાંથી સ્વૈચ્છીક નિવૃત્તી માંગેલ છે.

જી.સી.એસ.આર. (પેન્શન)ના નિયમો-૨૦૦૨ ના પ્રકરણ (૩) (નિવૃત્તિ) ૫ (પાંચ) ની જોગવાઈ..

આ નિયમના પેટા નિયમ (૧) અને (૨) માં કોઈપણ મજકુર હોય તેમ છતાં નીચેના કિસ્સા મુજબના કોઈપણ કર્મચારી-૦૩ માસથી ઓછી નહી તેવી લેખીત નોટીશ યોગ્ય અધિકારીને આપી નિવૃત્ત થઈ શકશે.

(૧) પેટાનિયમ (૪) (ક) (૧) માં દર્શાવેલ સરકારી કર્મચારીઓ, પચાસ વર્ષની ઉંમર પુરી થયેથી.

(૨) પેટાનિયમ (૪) (ક) (૨) અને ૪(અ) માં દર્શાવેલ સરકારી કર્મચારીઓ, પંચાવન વર્ષની ઉંમર પુરી થયેથી.

ઉપરોક્ત દર્શાવેલ જોગવાઈઓ પૈકી જોગવાઈ ૫(૧) મુજબ સદર કર્મચારીની જન્મ તારીખ .:૨૭ / ૦૩ /૧૯૬૪ હોઈ તે જોતાં તેઓ ૫૦ (પચાસ) વર્ષ ઉપરની ઉંમરના હોઈ આ જોગવાઈ મુજબ તેઓ સ્વૈચ્છીક નિવૃત્તી લઈ શકે છે. બીજું તેમણે નગરપાલિકાને ૦૩ (ત્રણ) માસ અગાઉ આ બાબતે જાણ કરતી એડવાન્સ નોટીશ પણ તા.: ૨૫ / ૦૮ / ૨૦૨૦ ના રોજ આપેલ છે તે જોતાં તેમની સ્વૈચ્છીક નિવૃત્તી મંજૂર કરવા પાત્ર જણાય છે.

અરજદારની તા.: ૨૫ / ૦૮ / ૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ તેમની નિવૃત્તી પછી તેમને મળવાપાત્ર લાભો આપવા જણાવેલ છે.

ઉપરોક્ત હકીકતોથી વિદિત થતાં અરજદારની સ્વૈચ્છીક નિવૃત્તી મંજૂર કરવા તથા નિવૃત્તી બાદના લાભો આપવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૫

વિષય :

વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જે તે સ્થળોએ કોર્કીટની બેંચ સપ્લાય કરવાના કામે ભાવો મંગાવવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૮ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ કા.સ.ઠ.નં.૬૦ / તા.: ૨૦-૭-૨૦૧૯ થી ઠરાવ્યા મુજબ વલસાડ નગરપાલિકા હદમાં વોર્ડ નં.-૧ થી ૧૧ ના જાહેર સ્થળો, પબ્લીક પ્લેસીસ, જાહેર તળાવો તેમજ મંદિરના પટાંગણમાં જરૂરી આર.સી.સી. વુડન બેન્ચીસ તથા બાળકોના રમત ગમતના સાધનો તેમજ કસરત કરવાના સાધનો મુકવાનું ઠરાવવામાં આવેલ. સદરહુ ઠરાવ્યા મુજબ આર.સી.સી. વુડન બેન્ચીસ ખરીદ કરવા માટે સ્થાનિક બજારોમાંથી ભાવો મેળવવામાં આવેલ, જેમાં એજન્સી શ્રી લક્ષ્મી સીમેન્ટ કોર્પોરેશન, વાઘલઘરા, વલસાડના ભાવો ઓછા આવેલ છે. ઓછા આવેલ ભાવ રૂ.૫૫૦૦/- (ટેક્સ સહીત) કા.સ.ઠ.નં.૨૬૬ / તા.:૧૪-૧૦-૨૦૧૯ થી મંજૂર કરવામાં આવેલ છે.

વિશેષમાં તા.: ૨૭-૧૨-૨૦૧૯ ના રોજ મળેલ બાંધકામ સમિતિની મીટીંગમાં થયેલ ઠરાવ અન્વયે નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડદીઠ નંગ-૧૨ (બાર) બેન્ચીસ ફાળવણી કરવાનું ઠરાવવામાં આવેલ છે. અને સદરહુ બેન્ચીસનો ખર્ચ બાંધકામ શાખા ધ્વારા બાંધકામ વિકાસ પરવાનગી અન્વયે થતી આવક જેવી કે સ્ક્રુટીની ફી, એમીનીટીઝ ફી, વિગેરે જેવી આવકમાંથી કરવાનું ઠરાવેલ છે.

ઉપરોક્ત હકીકતોને ધ્યાને લેતાં સદરહુ બાબતે નિયમોનુસારની ટેન્ડરીંગ પ્રક્રિયા કરી ભાવો મંગાવવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૬

વિષય :

જીલ્લા આયોજન (સને:૨૦૨૦-૨૧) ગ્રાન્ટ હેઠળ નવા વિકાસના કામોનું આયોજન કરી દરખાસ્ત કરવા બાબત..

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૮ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ જીલ્લા આયોજન (સને:૨૦૨૦-૨૧) ગ્રાન્ટ હેઠળ નગરપાલિકાની કા.સ.ઠ.નં.-૪૧૬ / તા.: ૧૮-૦૧-૨૦૨૦ થી જરૂરી કામો મંજૂર કરી દરખાસ્ત કરવામાં આવેલ. જે અન્વયે જિલ્લા આયોજન કચેરી, વલસાડના પત્રક્રમાંક નં.-અજન / વ. મં. / વિવેકાધીન / ૩૮૬-૩૮૮ / ૨૦૨૦-૨૧ / તા.: ૨૬-૦૬-૨૦૨૦ થી (૧) વલસાડ ગામે અબ્રામા તેમજ મોગરાવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે અશોક લેલન્ડ ટેમ્પો નંગ-૦૨ અને (૨) વલસાડ ગામે લક્ષ્મીમાસીના ઘરથી નવજીવન હોસ્પિટલ થઈ સિધ્ધ-શીલા મેઈન ગટર સુધી આર.સી.સી. વરસાદી ગટર (બોક્ષ ડ્રેઈન) બનાવવાના કામે જરૂરી વહીવટી મંજૂરી મળેલ છે. ઉપરોક્ત મળેલ વહીવટી મંજૂરી અન્વયે સરકારશ્રીની ગાર્દલાર્દન મુજબ કામ નં.-૦૧, વલસાડ ગામે અબ્રામા તેમજ મોગરાવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે અશોક લેલન્ડ ટેમ્પો નંગ-૦૨ રકમ રૂ.૧૩,૬૮,૬૩૦/- ખરીદ કરવા અંગે જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા આયોજન કચેરી, વલસાડના પત્ર ક્રમાંક નં.-અજન / સં.મ / COVID-19 / વશી-૧૫૧ / ૨૦૨૦ / તા.: ૨૮-૦૮-૨૦૨૦ થી સદરહુ કામ ના-મંજૂર કરેલ છે.જેથી ઉપરોક્ત મળેલ વહીવટી મંજૂરી અન્વયે કામ નં.-૦૧, વલસાડ ગામે અબ્રામા તેમજ મોગરાવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે અશોક લેલન્ડ ટેમ્પો નંગ-૦૨, રકમ રૂ.૧૩,૬૮,૬૩૦/- કામ, ના-મંજૂર કરી નીચે જણાવ્યા મુજબના નવા વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેઈટની રકમ
૧	૧૧	વાલીયા ફળિયા વિરામભાઈના ઘર થી સામંતના ઘર સુધી તથા દેવર્પાના ઘરને ગલી	વરસાદી ગટર	૧૬૮૩૩૦૦

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૭

વિષય :

ના.સરકારશ્રીની SJMMSVY ની ગ્રાન્ટની ફાળવેલ રકમની મર્યાદામાં નવા વિકાસલક્ષી કામોનું આયોજન કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૯૦ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ગુજ.મ્યુનિ.ફાઈ. બોર્ડ, ગાંધીનગરના દફતરી હુકમ નં.- મફબ / SJMMSVY (UDP-88)૨૦૧૯-૨૦ / ન.પા. / આં.મા. સુ./ ૫૦% / ૨૦૧૯ / ૧૦૮૬૪ / તા.:૧૯-૦૮-૨૦૧૯ થી વલસાડ નગરપાલિકાને જનરલ સદર હેઠળ રૂ.૨,૮૩,૫૯,૩૧૭/- SCSP સદર હેઠળ રૂ. ૭૩,૧૦,૦૦૦ તેમજ TASP સદર રૂ.૮૨,૪૫,૦૦૦/- એમ મળી કુલ રૂ.૪,૩૯,૧૪,૩૧૭/- પુરાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે. જે અન્વયે વલસાડ નગરપાલિકા ધ્વારા કા.સ.ઠ.નં.-૪૧૩ / તા.: ૧૯-૧-૨૦૨૦ તેમજ જ.બો.ઠ.નં.-૭૭૭ / તા.: ૨૮-૦૧-૨૦૨૦ થી જનરલ સદર હેઠળ કુલ-૧૭, SCSP હેઠળ કુલ-૧૦ તેમજ TASP હેઠળ કુલ-૦૮ એમ મળી કુલ-૩૫ વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવેલ છે. જે કુલ-૩૫ કામો પૈકી નીચે જણાવ્યા મુજબના કુલ-૦૩ ડામર રસ્તાના કામો મે.પ્રાદેશિક કમિશ્નરશ્રી, સુરતની મળેલ સુચના અન્વયે જોતાં ખાનગી જગ્યાએ જણાય આવેલ છે.

અ.નં.	કામનું નામ	સદર	રકમ
૧	મુખ્ય રસ્તા થી અક્ષરધામ નદી તરફનો જતો રસ્તો	જનરલ	૧૮,૨૧,૪૦૦/-
૨	મુખ્ય રસ્તા થી લક્ષ્મીનગરના નાકે જતો રસ્તો	જનરલ	૧૧,૯૨,૪૦૦/-
૩	ગ્રીનપાર્ક થી લક્ષ્મીનગર સુધી જતો રોડ	જનરલ	૧૩,૬૭,૭૦૦/-
		કુલ રકમ રૂ.	૪૩,૮૧,૫૦૦/-

ઉપરોક્ત જણાવેલ કુલ-૦૩ કામો રદ કરી તેની જગ્યાએ ના.સરકારશ્રીની SJMMSVY ની ગ્રાન્ટની ફાળવેલ રકમની મર્યાદામાં નીચે જણાવ્યા મુજબના નવા વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેટની રકમ
૧	૫	પ્રભાત પાનના ગલ્લા થી મૃગુલાલ હોસ્પિટલ થઈ મોગરાવાડી ઝોન તરફ જતો રસ્તો	વરસાદી ગટર	૧૯૫૫૯૦૦
૨	૫	કાપડીયા ચાલ અને કાપડીયા ચાલની પાછળની ગટર	વરસાદી ગટર	૫૮૪૦૦૦
૩	૬	વલ્લાની ગલીની વિસ્તાર	વરસાદી ગટર	૧૧૧૮૩૦૦
૪	૬	જળદેવી મંદિર થી લોટસ હોસ્પિટલ થી લાલ સ્કૂલ સુધીનો રોડ	ડામર રોડ	૮૧૮૮૦૦
			કુલ રકમ રૂ.	૪૪૭૭૦૦૦

સ.મ.મંજૂર..

કા.નં. - ૬૮

વિષય :

વલસાડ નગરપાલિકા હસ્તકની પ્રોપર્ટીઓના ટેરેસનો યોગ્ય ઉપયોગ કરી " સોલર રૂફ ટોપ " પ્રોજેક્ટના ઉપયોગ માટે દરખાસ્ત કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૧ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ,વલસાડ નગરપાલિકા તરફથી વલસાડની શહેરીજનોને આવશ્યક સેવાઓ આપવામાં આવે છે. જેમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરો જેવા કે ટાઉનહોલ શોપીંગ સેન્ટર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ઓડીટોરીયમ હોલ, લાઈબ્રેરી વિગેરે સદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરો તેમજ ઓફીસ બિલ્ડીંગો વિગેરેનું લાઈટ બીલ દર મહીને ખુબજ વધારે આવે છે અને નગરપાલિકાને લાખો રૂપિયાનું ભારણ પડે છે. સદર નાણા ભરવામાં કોઈવાર અનિયમીતતા હોઈ તો DGVCL તરફથી જરૂરી પગલાં લેવામાં આવે છે.

સદર પરીસ્થિતીના નીવારણ માટે નગરપાલિકાના ટેરેસ જે હાલે ઉપયોગમાં લેવાતા નથી જેના પર " સોલર રૂફ ટોપ " નો પ્રોજેક્ટ કરવામાં આવે તો નગરપાલિકાને ઘણી રાહત થાય એમ છે અને ખાલી પડેલા ટેરેસોનો સદઉપયોગ થઈ શકે. સદર બાબતે નગરપાલિકાના માલિકીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરોમાં અંદાજે 26.500 Sq.mt જગ્યા ઉપલબ્ધ છે. સદર જગ્યાનો " સોલર રૂફ ટોપ " પ્રોજેક્ટના ઉપયોગ માટે તેમજ સરકારશ્રીને જરૂરી દરખાસ્ત કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર.

કા.નં. - ૬૯

વિષય :

ગુજ.મ્યુનિ. ફાઈ.બોર્ડ,ગાંધીનગરના પત્ર ક્રમાંક નં.-મફબ / SJMMSVY / (UDP-88)ત્રી.ત. /૨૦૨૦-૨૧ / ન.પા.-આં.પા.વિ. / પ્ર.હ./ ૨૦૨૦ / ૧૨૨૨૧ તા.: ૦૫-૦૮-૨૦૨૦ થી સ્વર્ણીમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (૨૦૨૦-૨૧) ગ્રાંટમાંથી કામો નક્કી કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૯૨ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ ગુજ.મ્યુનિ. ફાઈ.બોર્ડ,ગાંધીનગરના પત્ર ક્રમાંક નં.-મફબ / SJMMSVY / (UDP-88)ત્રી.ત. /૨૦૨૦-૨૧ / ન.પા.-આં.પા.વિ. / પ્ર.હ./ ૨૦૨૦ / ૧૨૨૨૧ તા.: ૦૫-૦૮-૨૦૨૦ થી સ્વર્ણીમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (૨૦૨૦-૨૧) ગ્રાંટમાંથી સંદર્ભ હેઠળના પત્રમાં જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકાને ફાળવેલ ગ્રાંટની રકમ રૂ.૫.૦૦કરોડમાંથી સ્વર્ણીમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ની માર્ગદર્શિકા મુજબ નીચે જણાવ્યા મુજબના નવા વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાંટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેટની રકમ
જનરલ સદર રૂ.૩.૪૪૪૫				
૧	૬	ઉત્તમ ડેકોરેટર્સ બંને સાઈડની ગલી તેમજ પાછળની ગલીમાં	ટ્રીમીક્ષ રોડ	૪૭૫૭૦૦
૨	૭	અંબામાતા મંદિર થી બાપા સીતારામ સુધી તથા આંતરિક ગલી	ટ્રીમીક્ષ રોડ	૮૯૧૯૦૦
૩	૮	રાજેશ્વરી સોસાયટી, મધુવન સોસાયટી વિસ્તારમાં	પેવરબ્લોક	૯૪૩૧૦૦
૪	૮	તિથલ રોડ મુખ્ય રસ્તા થી અમરધામ ગેટ તથા કરશનજીપાર્કના ગેટ સુધી	ડામર રોડ	૩૮૩૫૦૦
૫	૮	મુખ્ય રોડ થી રોનક રો હાઉસની ગલી વિસ્તારમાં	પેવરબ્લોક	૪૮૦૮૦૦
૬	૯	ટીવી રીલે કેન્દ્ર પાસે અંડરગ્રાઉન્ડ સંપ તેમજ ઓવર હેડ પાણીની ટાંકી બનાવવાનું કામ (૪.૫૦ લાખ લીટર)	પાણીની ટાંકી	૧૮૧૩૩૦૦૦
૭	૯	હાલર તળાવ થી તિથલ રોડ ચાર રસ્તા સર્કિટ હાઉસ સુધી	પેવરબ્લોક	૭૮૫૪૦૦
૮	૧૦	છોટુભાઈ પાર્કમાં - ૧,૨ અને ૩ માં ડામર રસ્તાનું કામ	ડામર રોડ	૧૭૬૦૭૦૦
૯	૧૦	ઠાકોરજીપાર્ક સોસાયટી ડામર રસ્તાનું કામ	ડામર રોડ	૧૪૪૪૧૦૦
૧૦	૧૦	મણિબાગ-૨ માં નગીનભાઈ પ્રજાપતિની ગલી , ગણેશકૃપા એપાર્ટમેન્ટની ગલી તેમજ પ્રજાપતિ ભ્રત્તકુમારી હોલ વાળી ગલીમાં ડામર રસ્તાનું કામ	ડામર રોડ	૫૯૧૬૦૦
૧૧	૧૦	ગોકુલધામ સોસાયટીની આંતરિક ગલીમાં	ડામર રોડ	૩૪૭૨૪૦૦
૧૨	૧૦	ઉપાબેનના ઘર પાસેના વિસ્તારમાં	પેવરબ્લોક	૩૪૨૦૦૦

૧૩	૧૦	ગીતાબેનના ઘર પાસેના વિસ્તારમાં	પેવરબ્લોક	૩૫૧૨૦૦
૧૪	૧૧	તુલસીવનની ગલીમાં કમલેશભાઈ આશરેના ઘર થી નવીનભાઈના ઘર સુધી	પેવરબ્લોક	૧૧૮૫૮૦૦
૧૫	૧૧	મુખ્ય રસ્તા થી નંદલાલના ઘર સુધી તથા ઉપાધ્યાયની ગલી	પેવરબ્લોક	૧૧૮૩૪૦૦
૧૬	૧૧	સુનિલભાઈના ઘર પાસેથી વાડીવાળાના ઘર સુધી મુખ્ય ગટરને જોડતી	વરસાદી ગટર	૧૦૩૦૬૦૦
૧૭	-	કલ્યાણબાગની સામે આવેલ પાર્કિંગ પ્લોટમાં કંપાઉન્ડ વોલ તેમજ સીક્યુરીટી કેબીન બનાવવાનું કામ	વોલ તેમજ કેબીન	૨૦૫૨૮૫૦
૧૮	૩	મોગરાવાડી લાયબ્રેરી હોલની સામે પોલીસ ચોકની બાજુમાં સીનીયર સીટીઝન શેડ (વિશ્રામ કુટીર)	વિશ્રામ કુટીર	૬૭૧૮૦૦
૧૯	૬	ગણપતિ મંદિર થી વિઠ્ઠલ મંદિર સુધી વરસાદી બોક્ષ ગટર (રસીક આર્ટની ગલીમાં)	વરસાદી ગટર	૫૦૭૫૦૦
			રકમ રૂા.	૩૬૬૮૭૪૫૦
SCSP રૂા.૦.૭૩૧૦				
૨૦	૧	સુઘડ ફળિયા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ (ગ્રાઉન્ડફ્લોર + પ્રથમમાળ)	કોમ્યુનિટી હોલ	૫૫૦૫૮૦૦
૨૧	૧	નવા હરીજનવાસ, શહીદ ચોક વિસ્તારમાં	પેવરબ્લોક	૧૧૧૭૭૦૦
૨૨	૨	બરુડીયાવાડ શપ્તશુંગી મંદિર ની પાસે આવેલ ગટર	વરસાદી ગટર	૨૨૪૮૮૦૦
૨૩	૭	કાલીકામાતાના મંદિર થી દિપકભાઈ વિઠ્ઠલના ઘર સુધી, તેમજ ગણેશ મંડપ સુધી	ટ્રીમીક્ષ રોડ	૩૧૬૭૦૦
૨૪	૭	રૂક્ષાના સલીમના ઘર થી ગણેશ મહોલ્લા સુધી	ટ્રીમીક્ષ રોડ	૨૪૬૪૦૦
			રકમ રૂા.	૮૪૩૬૫૦૦
TASP રૂા.૦.૮૨૪૫				
૨૫	૧૧	તારાબેનની ઘર થી રેખાબેનના ઘર સુધી (તાપાવાડ / નાયકીવાડ)	પેવરબ્લોક	૧૧૦૮૭૦૦
૨૬	૧૧	નાયકીવાડ થી તાપાવાડ થઈ નાઈટ્રેક્ષ મેઈન રસ્તા સુધી તથા અજિતભાઈના ઘર થી આંગણવાડી સુધી	પેવરબ્લોક	૨૪૮૭૭૦૦
૨૭	૧૧	હરીનગરી વિસ્તારની બંને ગલીમાં	પેવરબ્લોક	૧૭૩૩૬૦૦
૨૮	૧૧	વાવ ફળિયા, જયંતિભાઈના ઘર થી આંગણવાડી સુધી	વરસાદી ગટર	૧૬૮૭૧૦૦
૨૯	૭	દિપકભાઈના ઘર થી શબ્બીર દાઉદ રીક્ષા વાળાના ઘર સુધી તથા મુખ્ય ગટર (ગણેશ મહોલ્લો)	વરસાદી ગટર	૧૮૩૨૭૦૦
			રકમ રૂા.	૮૮૪૮૮૦૦
			કુલ રકમ રૂા.	૫૪૮૮૩૭૫૦

સ.મ.મંજુર...

કા.નં. - ૭૦

વિષય :

વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉન બાબતે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૧૮૩ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ , વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉન બાબતે મે. વલસાડ જીલ્લાના જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી વલસાડના પત્રક્રમાંક નં.ડી.સી.બી / એમ.એ.જી / રજી-નં.-૩૭ / ૨૦૧૬ જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી વલસાડના તા.: ૦૪/૦૫/૨૦૧૬ થી શરત નં.-૧, મુજબ વલસાડ જીલ્લાના તમામ ભંગારના ગોડાઉન માલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી ફરજીયાત રીતે રજીસ્ટ્રેશન કરવા બાબતે સર્ટીફિકેટ મેળવી જે તે વિભાગના સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે ભંગાર ગોડાઉનના માલસામાન રાખવા તથા તેની ખરીદી કરવા તેનું વેચાણ કરવા માટે કોઈને પણ અડચણ તેમજ ગંદકી થાય નહી અને સરકારશ્રીના વખતો વખતના નીતી નિયમોનું પાલન કરવાનું રહેશે તે માટે ફરજીયાત પણે રજીસ્ટ્રેશન કરવાની મે. કલેક્ટરશ્રીના ઉપરોક્ત પરીપત્રથી સૂચના આપવામાં આવેલ હતી.

તેમજ સરકારશ્રીના પાર્ટ-૨, સી.જી.ડી.સી.આર (CGDCR) ૨૦૧૭ ના રહેણાંક વિસ્તારમાં ભંગાર અંગેનો વેપાર કરવા ઉપર પ્રતિબંધ છે તમો ફક્ત અને ફક્ત ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ભંગારના ગોડાઉન વેપાર અંગેની કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવે છે. તેમજ તમામોઓને નિયામક રાજ્ય અગ્નિનિવારણ સેવાઓ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર ક્રમાંક સફસ / ૨૨-૮૩ / ૧૧૧ / ૨૦૧૧ તા.:૦૧/૦૬/૨૦૧૮ ના પત્ર મુજબ ફાયર અંગેનું એન.ઓ.સી.નગરપાલિકા પાસેથી ઓનલાઈન મેળવવાનું રહેશે ફાયર અંગેનું સર્ટીફિકેટ ન હોય તો મેળવી લેવાનું રહેશે.

સભ્યશ્રી યશોવભાઈ માલી ગયા....

વલસાડ શહેર રહેણાંક વિસ્તારના તમામ ભંગાર વેપાર સાથે સંકળાયેલ છે અને દરેક ભંગારના ધંધાના વેપારીએ ઉપરોક્ત કલેક્ટરશ્રીના પત્રમાં જણાવેલ શરતોનું પાલન કરવાનું હોય છે અને તમામ વેપારીઓએ ગુમાસ્તા ધારા હેઠળ નોંધણી કરાવવાની ફરજીયાત હોય છે અને જો નોંધણી ન કરાવવી હોય તો ગંભીર પ્રકારનો ગુનો બને છે

વલસાડ શહેર વિસ્તારમાં આવેલ ભંગાર ગોડાઉનમાં આ દરેક પ્રકારનો સામાન એટલે કે લોખંડ / પતરાં / ખરાબ પ્લાસ્ટીક / કેમીકલ વેસ્ટ તથા પસ્તી પુંઠા વિગેરે એકઠો થતો હોવાને કારણે રહેણાંકના વિસ્તારમાં આજુબાજુવાળા ગીચ વસ્તી હોવાને કારણે આગ લાગવાના બનાવો પણ બનેલ છે અને આવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફાયર જેવા સાધનો જઈ શકતા નથી જેના કારણે આગ બુઝાવવા અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેના કારણે રહેણાંક વિસ્તારના કોઈપણ ગંભીર અકસ્માત થવાથી વ્યક્તિઓનું જીવનું જોખમ રહે છે તો વલસાડ શહેર વિસ્તારમાં મદનવાડ, ભીંડીબજાર વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉન બાબતે આવેલ કામે, ચર્ચા વિચારણાનાં અંતે રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉન હોય, તે બંધ કરાવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ. મંજુર..

કા.નં. - ૭૧

વિષય :

વિષય:- કોરોના COVID-19 વૈશ્વિક મહામારીના કપરા સમયમાં વલસાડ વિસ્તારમાં રહેતા ઘરવિહોણા લોકો , ભિક્ષુક, રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો, લોકડાઉનને કારણે ફસાયેલ, તેમજ બીજા રાજ્યમાથી રોજગારી અર્થે આવેલ અને પાછા ફરી ન શકેલ એવા લાભાર્થીઓને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત SUH ઘટક હેઠળ ચલાવવામાં આવેલ કામચલાઉ આશ્રયસ્થાન કે જે તિથલ રોડ પર આવેલ કુમાર છાત્રાલયમાં રાખવામાં આવેલ ૧૩૦ જેટલા લાભાર્થીઓને રહેવાની , જમવાની અને ચા નાસ્તાની તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓ ઉપરાંત સવારનો નાસ્તો ચા બપોરના વિ.વ્યવસ્થા માટે રસોઈયા તેમજ મંજૂર અને રસોઈના સાધનોની વ્યવસ્થા દિલીપ ગૃહ વસ્તુ ભંડાર, નાના પારસીવાડ, વલસાડ પાસેથી કરેલ. જેનું આવેલ બીલ રૂા.૪૫,૭૫૦/- પુરાનુ મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં-૧૮૮/તા.૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ કોરોના COVID-19 વૈશ્વિક મહામારીના કપરા સમયમાં વલસાડ વિસ્તારમાં રહેતા ઘરવિહોણા લોકો , ભિક્ષુક, રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો , લોકડાઉનને કારણે ફસાયેલ , તેમજ બીજા રાજ્યમાથી રોજગારી અર્થે આવેલ અને પાછા ફરી ન શકેલ એવા લાભાર્થીઓને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત SUH ઘટક હેઠળ ચલાવવામાં આવેલ કામચલાઉ આશ્રયસ્થાન કે જે તિથલ રોડ પર આવેલ કુમાર છાત્રાલયમાં રાખવામાં આવેલ ૧૩૦ જેટલા લાભાર્થીઓને રહેવાની , જમવાની અને ચા નાસ્તાની તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓ ઉપરાંત સવારનો નાસ્તો ચા બપોરના વિ.વ્યવસ્થા માટે રસોઈયા તેમજ મંજૂર અને રસોઈના સાધનોની વ્યવસ્થા દિલીપ ગૃહ વસ્તુ ભંડાર , નાના પારસીવાડ, વલસાડ પાસેથી કરેલ. જેનું આવેલ બીલ રૂા.૪૫,૭૫૦/- પુરાનુ ચૂકવણુ કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર .

કા.નં. - ૭૨

વિષય :

ના.સરકારશ્રીની ફાળવેલ ગ્રાન્ટ પૈકી જનરલ સદર હેઠળ રૂા.૧,૨૨ ૮૪૮/- તેમજ SCSP સદર હેઠળ રૂા.૨,૨૭,૮૮૨/- પુરાના નવા વિકાસના કામોનું આયોજન કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૦૩ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, ગુજ.મ્યુનિ.ફાઈ. બોર્ડ, ગાંધીનગરના પત્રક્રમાંક નં.- મફબ / મનોકર / ગ્રાન્ટ / ૨૦૧૮-૧૯ / વશી / ૫૧૧૭ / તા.: ૩૦-૦૩-૨૦૧૯ જનરલ સદર રૂા. ૧૪,૯૮,૪૪૮/- ગુજ.મ્યુનિ.ફાઈ. બોર્ડ, ગાંધીનગરના પત્રક્રમાંક નં.- મફબ / મનોકર / SCSP ગ્રાન્ટ / ૨૦૧૮-૧૯ / વશી/ ૫૩૬૧/ તા.:૩૦-૦૩-૨૦૧૯ SCSP સદર રૂા. ૨,૨૭,૮૮૨/- એમ મળી કુલ રૂા.૧૭,૨૬,૩૩૦/- પુરાની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવેલ છે. જે ગ્રાન્ટ અન્વયે કા.સ.ઠ.નં.-૪૧૨ / તા.: ૧૮-૦૧-૨૦૨૦ થી તેમજ જ.બો.ઠ.નં.-૭૭૬ / તા.: ૨૮-૦૧-૨૦૨૦ થી નીચે જણાવ્યા મુજબના પેવર બ્લોકના કુલ-૦૩ કામો મંજૂર કરવામાં આવેલ છે.

અ.નં.	કામનું નામ	સદર	રકમ
૧	દદીગ્યાં ફળિયા વિસ્તારમાં આંતરિક ગલી	જનરલ	૧૩૭૫૫૦૦.૦૦
૨	રીલે કેન્દ્ર નરેન્દ્ર રાજપુતની ગલીમાં	જનરલ	૨૧૦૫૦૦.૦૦
૩	રીલે કેન્દ્ર અનુપભાઈના ઘરવાળી ગલીમાં	SCSP	૨૮૭૦૦૦.૦૦
		કુલ રકમ રૂા.	૧૮,૭૩,૦૦૦.૦૦

ઉપરોક્ત યોજના હેઠળના મંજૂર કરવામાં આવેલ કામોની વિધિસરની દરખાસ્ત મે.પ્રાદેશિક કમિશ્નરશ્રી, સુરતને તા.: ૨૪-૦૬-૨૦૨૦ થી દરખાસ્ત કરવામાં આવતાં સદરહુ કચેરીના પત્ર ક્રમાંક : RCMO / SRT / મનોરંજન કર / ૨૦૧૮-૧૯ / વલસાડ ન.પા. / વહીવટી મંજૂરી / વશી.૧૬૧ / ૨૦ / તા.: ૨૭-૦૭-૨૦૨૦ થી ઉપરોક્ત કોષ્ટકમાં જણાવ્યા મુજબ અનુ. નં.-૦૧ ની વહીવટી મંજૂરી અત્રેની કચેરીને મળેલ છે.

પ્રાદેશિક કમિશ્નરશ્રી, સુરતના પત્ર ક્રમાંક નં.-પ્રાકન / મનોરંજન-૨૦૧૮-૧૯ / વલસાડ ન.પા. / વશી. ૧૬૧ / ૨૦ / જા.નં.૩૦૯૦ / તા.:૨૭-૦૭-૨૦૨૦ થી ઉપરોક્ત કોષ્ટકમાં જણાવ્યા મુજબ અનુ. નં.-૦૨ અને ૦૩ (જનરલ અને SCSP) મુજબના કામો સદરહુ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ધ્વારા સ્થળ તપાસ કરતાં ખાનગી સોસાયટીના રસ્તાના કામો મનોરંજનકરની ગ્રાન્ટ હેઠળ હાથ ધરી શકાતા ન હોય, મંજૂરી આપી શકાય એમ નથી. જેથી ઉપરોક્ત કોષ્ટકના જણાવેલ અનુ.નં.-૦૨ ને ૦૩ ના કામો રદ કરી નીચે જણાવ્યા મુજબના નવા વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેટની રકમ
જનરલ સદર : રૂા.૧૨૨૮૪૮				
૧	૪	સુકી તલાવડી મુખ્ય રસ્તા થી યાકુલભાઈના ઘર સુધી	પેવરબ્લોક	૧૨૪૮૦૦
SCSP રૂા.૨૨૭૮૮૨/-				
૨	૧	હંસાબેન પરમાર માજીસભ્યશ્રી ઘર થી ચાર રસ્તા ઘડૂચી તળાવ સુધી	વરસાદી ગટર	૨૫૧૮૦૦

સ.મ.મંજૂર..

કા.નં. - ૭૩

વિષય :

કા.સ.ઠ.નં. ૩૪૪ / ૨૯-૦૧-૨૦૧૯ થી ડામર રસ્તા બનાવવાનું ટેન્ડર ઠેકેદારશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની, વડોદરાનું મંજૂર કરવામાં આવેલ છે.સદરહું મંજૂર થયેલા ભાવોથી નગરપાલિકા વિસ્તારમાં કામગીરી કરાવેલ. જેને બહાલ રાખવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૦૪ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, વલસાડ નગરપાલિકા ધ્વારા ના.સરકારશ્રીની ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડનાં પત્ર ક્રમાંક : મફબ / યુ-૨ / ૧૪ મું નાણાંપંચ / બીજો હપ્તો / ૨૦૧૯-૨૦/ ૧૮૪૧૨ / તા.: ૨૭-૧૧-૨૦૧૯ થી વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ ડામર રોડ બનાવવાના કામો કા.સ.ઠ.નં. ૩૬૪ / ૧૦-૦૧-૨૦૨૦ થી મંજૂર કરવામાં આવેલ છે. સદરહું મંજૂર કરેલ કામો પૈકી કુલ-૦૬ કામોની તાંત્રિક મંજૂરી મેળવી નગરપાલિકા ધ્વારા તા.:૦૩-૦૨-૨૦૨૦ થી જરૂરી વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. વિશેષમાં નીચે જણાવ્યા મુજબના ડામર રસ્તાઓ ખુબજ ખરાબ હાલતમાં હોય, અને સદરહું વિસ્તારના રહીશોને અવર-જવર કરવાની ખુબજ મુશ્કેલીઓ પડતી હોય, સદરહું વિસ્તારના રહીશો ધ્વારા અત્રેની કચેરીએ સદરહું રસ્તા બાબતે અવાર-નવાર મૌખિક ફરીયાદો કરતાં હોવાથી સદરહું રસ્તાઓ તાત્કાલિક કરવાની જરૂરીયાત ઉપસ્થિત થતાં અને સદરહું વિસ્તારના રહીશોને સહેલાઈથી અવર જવર થઈ શકે તેવા શુભ આશયથી નીચે જણાવ્યા મુજબના રસ્તાઓ કા.સ.ઠ.નં. ૩૪૪ / તા.: ૨૯-૦૧-૨૦૧૯ થી ડામર રસ્તા બનાવવાનું ટેન્ડર ૯.૮૮% ઉંચા ભાવનું ઠેકેદારશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની, વડોદરાનું મંજૂર કરવામાં આવેલ છે.સદરહું મંજૂર થયેલા ભાવોથી કામગીરી કરાવેલ છે.સદરહું એજન્સી પાસેથી કરાવેલ કામગીરીને બહાલ રાખવાનું ઠરાવવામાં આવે છે.

(૧) બીના નગર મેઈન રોડથી રાધાકૃષ્ણ સોસાયટી, અબ્રામા રૂ.૫,૨૩,૦૦૦/-

(૨) આઝાદ ચોક થી જળદેવી મંદિર અને ચોક વિસ્તાર રૂ.૨૨,૯૮,૫૦૦/-

સ.મ.મંજૂર..

કા.નં. - ૭૪

વિષય :

વલસાડ નગરપાલિકાની માલીકીની શોપીંગ સેન્ટરો અને માર્કેટો તથા જમીન રોકાણ તરીકે દુકાનોના ભાડામાં વધારો કરવા જરૂરી નીર્ણય થવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:- આ મુદ્દા પર પુખ્ત ચર્ચા કરવાની બાકી હોય , જેથી આવનારી બોર્ડમાં આ વિષય પર પુખ્ત ચર્ચા કરવાની જરૂરી હોય, જેથી હાલે આ કામ મુલતવી રાખવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર.....

કા.નં. - ૭૫

વિષય :

ના.સરકારશ્રીની IHSDP યોજના અંતર્ગત સોના સરિતા -અબ્રામા ખાતે એ,બી,સી,ડી, આવાસ બિલ્ડીંગના માલિક તરીકે આકારણીમાં નગરપાલિકાનું નામ દાખલ કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

આ મુદ્દા પર પુખ્ત ચર્ચા કરવાની બાકી હોય , જેથી આવનારી બોર્ડમાં આ વિષય પર પુખ્ત ચર્ચા કરવાની જરૂરી હોય, જેથી હાલે આ કામ મુલતવી રાખવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર...

કા.નં. - ૭૬

વિષય :

ગુજ.મ્યુનિ. ફાઈ.બોર્ડ,ગાંધીનગરના દફતરી હુકમ નં.-મફબ / SJMMSVY (UDP-88) / ૨૦૧૯-૨૦ ન.પા. / આં. મા. સુ. / ૫૦% / ૨૦૧૯ / ૧૦૮૬૪ / તા.:૧૯-૦૮-૨૦૧૯ થી ફાળવેલ ગ્રાન્ટમાંથી વ.ન.પા.ના ડામરના રસ્તાના કામો જેવાં કે, મુખ્ય રસ્તાથી અક્ષરધામ નદી તરફનો જતો રસ્તો વિગેરે અ.નં. ૧ થી ૩ , જણાવેલ કુલ-૦૩ કામો રદ કરવામાં આવેલ છે.જે સદરહું કામ અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૨૭ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, ગુજ.મ્યુનિ.ફાઈ. બોર્ડ, ગાંધીનગરના દફતરી હુકમ નં.- મફબ / SJMMSVY (UDP-88)૨૦૧૯-૨૦ / ન.પા. / આં.મા. સુ./ ૫૦% / ૨૦૧૯ / ૧૦૮૬૪ / તા.:૧૯-૦૮-૨૦૧૯ થી વલસાડ નગરપાલિકાને જનરલ સદર હેઠળ રૂ.૨,૮૩,૫૯,૩૧૭/- SCSP સદર હેઠળ રૂ. ૭૩,૧૦,૦૦૦ તેમજ TASP સદર રૂ.૮૨,૪૫,૦૦૦/- એમ મળી કુલ રૂ.૪,૩૯,૧૪,૩૧૭/- પુરાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે. જે અન્વયે વલસાડ નગરપાલિકા ધ્વારા કા.સ.ઠ.નં.-૪૧૩ / તા.: ૧૯-૧-૨૦૨૦ તેમજ જ.બો.ઠ.નં.-૭૭૭ / તા.: ૨૮-૦૧-૨૦૨૦ થી નીચે જણાવ્યા મુજબના ૦૩ ડામર રસ્તાના કામો મંજૂર કરવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

અ.નં.	કામનું નામ	કામનો પ્રકાર	સદર	રકમ
૧	મુખ્ય રસ્તા થી અક્ષરધામ નદી તરફનો જતો રસ્તો	ડામર રોડ	જનરલ	૧૮,૨૧,૪૦૦/-
૨	મુખ્ય રસ્તા થી લક્ષ્મીનગરના નાકે જતો રસ્તો	ડામર રોડ	જનરલ	૧૧,૯૨,૪૦૦/-
૩	ગ્રીનપાર્ક થી લક્ષ્મીનગર સુધી જતો રોડ	ડામર રોડ	જનરલ	૧૩,૬૭,૭૦૦/-
			કુલ રકમ રૂ.	૪૩,૮૧,૫૦૦/-

ઉપરોક્ત જણાવેલ કુલ-૦૩ કામો રદ કરવામાં આવેલ છે. સદરહું ઉપરોક્ત જણાવેલ કામો અંગે, ચર્ચા વિચારણા કરતાં ઉપરોક્ત ૦૩ કામો અન્વયે સોસાયટી તરફથી સોસાયટીના ખાનગી રસ્તા નગરપાલિકા સુચવે તે મુજબ નગરપાલિકાને સુપ્રત કર્યેથી સરકારશ્રીની યોજનામાં સમાવેશ કરી નિયમોનુસારની દરખાસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને હાલ સદરહું યોજના હેઠળ ઉપરોક્ત ૦૩ કામો રદ કરી નીચે જણાવ્યા મુજબના નવા વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેટની રકમ
૧	૫	પ્રભાત પાનના ગલ્લા થી મૃણાલ હોસ્પિટલ થઈ મોગરાવાડી ઝોન તરફ જતો રસ્તો	વરસાદી ગટર	૧૯૫૫૯૦૦
૨	૫	કાપડીયા ચાલ અને કાપડીયા ચાલની પાછળની ગટર	વરસાદી ગટર	૫૮૪૦૦૦
૩	૬	વલ્લાની ગલીની વિસ્તાર	વરસાદી ગટર	૧૧૧૮૩૦૦
૪	૬	જળદેવી મંદિર થી લોટસ હોસ્પિટલ થી લાલ સ્કૂલ સુધીનો રોડ	ડામર રોડ	૮૧૮૮૦૦
			કુલ રકમ રૂ.	૪૪૭૭૦૦૦

સ.મ.મંજૂર..

જ.બો.ઠ.નં.૮૭૦/ તા.૦૮-૧૧-૨૦૨૦

કા.નં. - ૭૭

વિષય :

વલસાડ નગરપાલિકાના જાહેર બાંધકામ શાખામાં મજુર કામદાર શ્રી ગોવિંદભાઈ સાજનભાઈની તા.: ૩૦-૮-૨૦૨૦ ના રોજથી સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરતી આવેલ અરજી અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૨૮ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, વલસાડ નગરપાલિકાના જાહેર બાંધકામ શાખામાં શ્રી ગોવિંદભાઈ સાજનભાઈ મજુર કામદાર તરીકે ફરજ બજાવતા આવેલ છે. તેઓની તા.: ૩૦-૦૮-૨૦૨૦ ના રોજની અરજીમાં જણાવ્યા મુજબ તેઓના અંગત કારણોસર એટલે કે શરીરે બીમારી તથા અશક્ત હોવાથી વધારે નોકરી કરે શકે એમ નથી. જેથી તેઓ ધ્વારા તા.: ૩૧-૧૨-૨૦૨૦ થી સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરેલ હોય, સદરહુ અરજીને ધ્યાને લઈ મજુર કામદાર શ્રી ગોવિંદભાઈ સાજનભાઈની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજુર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૭૮

વિષય :

વ.ન.પા. હદમાં આવેલ છીપવાડ ગળનારામાં વરસાદી પાણીનો ભરાવો થવાથી અવર જવર બંધ થવાથી તાકીદે મોટર પંપથી વરસાદી પાણીનો સ્થળ પરથી નિકાલ થાય એમ હોય, જેથી સદરહું કામગીરી કરવા માટે વલસાડના સ્થાનિક ફિલ્ડમાર્શલ એજન્સીઝ, વલસાડ પાસેથી મડ પંપ સીગલ ફેઝ (2HP) ૨" ડાયા ડીલેવટીની ખરીદી તેમજ તેને ફીટીંગ કરવા માટે જરૂરીયાત મુજબનો માલ-સામાન તાત્કાલિક ખરીદી કરી ગળનારામાંથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવેલ. જેનું આવેલ બીલ રૂા. ૪૫,૬૯૨/- મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૨૯ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, વ.ન.પા. હદમાં આવેલ છીપવાડ ગળનારામાં વરસાદી પાણીનો ભરાવો થવાથી અવર જવર બંધ થવાથી તાકીદે મોટર પંપથી વરસાદી પાણીનો સ્થળ પરથી નિકાલ થાય એમ હોય, જેથી સદરહું કામગીરી કરવા માટે વલસાડના સ્થાનિક ફિલ્ડમાર્શલ એજન્સીઝ, વલસાડ પાસેથી મડ પંપ સીગલ ફેઝ (2HP) ૨" ડાયા ડીલેવટીની ખરીદી તેમજ તેને ફીટીંગ કરવા માટે જરૂરીયાત મુજબનો નીચે જણાવ્યા પ્રમાણેનો માલ-સામાન તાત્કાલિક ખરીદી કરી ગળનારામાંથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવેલ. જેનું આવેલ બીલ રૂા. ૪૫,૬૯૨/-અંકે રૂા. પીસ્તાળીસ હજાર, છસો બાણું પુરાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

(૧) બીલ નં.-૨૮ / તા.: ૧૦-૦૭-૨૦૨૦ રૂા. ૩૧,૫૦૦/-મડ પંપ સીગલ ફેઝ (2HP).

(૨) બીલ નં.-૨૯/ તા.: ૧૦-૦૭-૨૦૨૦ રૂા. ૧૪,૧૯૨/-

સ.મ.મંજૂર..

કા.નં. - ૭૯

વિષય :

બાંધકામ સમીતી ઠરાવ નં.- ૧૮ / તા.:૧૨-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વોર્ડ નં.-૭ વિસ્તારમાં રોય હોસ્પિટલ થી શહીદચોક વિસ્તારમાં ૩૦૮ મીટર લંબાઈની ૧૨" ડાયાની નવી ડ્રેનેજ પાઈપલાઈન નાંખવાનું આવેલ કામે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.રાજેશભાઈ રાઠોડ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૪૭ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, બાંધકામ સમીતી ઠરાવ નં.- ૧૮ / તા.:૧૨-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વોર્ડ નં.-૭ વિસ્તારમાં રોય હોસ્પિટલ થી શહીદચોક વિસ્તારમાં ૩૦૮ મીટર લંબાઈની ૧૨" ડાયાની નવી ડ્રેનેજ પાઈપલાઈન નાંખવાની જરૂરીયાત હોય, સદરહું કામનો ખર્ચ રૂ. ૬,૧૦,૬૧૦/- અંકે રૂ. છ લાખ, દશ હજાર, છસો દશ પુરા થવા જાય છે. જેથી સદરહું કામને ૧૪ માં નાણાંપંચ યોજનામાં સમાવેશ કરી, કામગીરી કરાવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૮૦

વિષય :

બાંધકામ સમીતી ઠરાવ નં.- ૧૮ / તા.:૧૨-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ સીટી પેલેસ થી તિથલ રોડ સ્વર્ગાશ્રમ ગલી વિસ્તારમાં ૨૮૨ મીટર લંબાઈની ૧૨" ડાયાની નવી ડ્રેનેજ પાઈપલાઈન નાંખવાના આવેલ કામે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.રાજૂભાઈ રાઠોડ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૪૮ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, બાંધકામ સમીતી ઠરાવ નં.- ૧૮ / તા.:૧૨-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ સીટી પેલેસ થી તિથલ રોડ સ્વર્ગાશ્રમ ગલી વિસ્તારમાં ૨૮૨ મીટર લંબાઈની ૧૨" ડાયાની નવી ડ્રેનેજ પાઈપલાઈન નાંખવાની જરૂરીયાત હોય, સદરહું કામનો ખર્ચ રૂ.૫,૮૩ ,૫૬૫ /- અંકે રૂ. પાંચ લાખ, ત્યાંશી હજાર, પાંચસો પાંસઠ પુરા થવા જાય છે. જેથી સદરહું કામને ૧૪ માં નાણાંપંચ યોજનામાં સમાવેશ કરી, કામગીરી કરાવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૮૧

વિષય :

વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે શહેરના મુખ્યમાર્ગો પાર્કિંગ અંગે જરૂરી પીળા તથા સફેદ પટ્ટા પાડવાની જરૂર હોય તેમજ મુખ્ય માર્ગો ઉપર રીક્ષા સ્ટેન્ડ અને ટેક્ષી સ્ટેન્ડનું સ્થળ દર્શાવવા માટે જરૂરી સાઈઝના બોર્ડ તથા એક માર્ગીય તરીકે જાહેર કરવામાં આવેલ વન-વે જરૂરી સાઈઝના બોર્ડ બનાવવાની કામગીરી ભાવિન કન્સ્ટ્રક્શન,વડોદરા પાસેથી કરાવવામાં આવેલ જેને બહાલ રાખવાનું મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૫૩ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, મે.પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ અધિક્ષકની કચેરી, વલસાડના પત્ર ક્રમાંક નં.-જી.ટ્રા.શાખા / ૪૫૦ / ૨૦૨૦ / તા.:૦૧-૦૮-૨૦૨૦ થી જણાવ્યા મુજબ વલસાડ શહેરમાં વાહનોની સંખ્યામાં થયેલ વધારો તથા શહેરના સાંકડા રસ્તા તેમજ મકાનોની ગીચતાને કારણે રસ્તાઓ ઉપર અવાર-નવાર ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઉદ્ભવે છે. એવી રજુઆત અત્રેની કચેરીએ કરેલ છે.

ઉપરોક્ત બાબતે વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે શહેરના મુખ્યમાર્ગો પાર્કિંગ અંગે જરૂરી પીળા તથા સફેદ પટ્ટા પાડવાની જરૂર હોય તેમજ મુખ્ય માર્ગો ઉપર રીક્ષા સ્ટેન્ડ અને ટેક્ષી સ્ટેન્ડનું સ્થળ દર્શાવવા માટે જરૂરી સાઈઝના બોર્ડ તથા એક માર્ગીય તરીકે જાહેર કરવામાં આવેલ વન-વે જરૂરી સાઈઝના બોર્ડ બનાવવાની જરૂરીયાત હોય, સદરહુ તમામ કામગીરી કરવા માટેનો થનાર સઘળો ખર્ચ મંજૂર કરી, કરવામાં આવેલ કામગીરી ભાવિન કન્સ્ટ્રક્શન,વડોદરા પાસેથી કરાવવામાં આવેલ છે. સદરહુ કરાવેલ કામગીરીને બહાલ રાખવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૮૨

વિષય :

જીલ્લા આયોજન,વલસાડ પત્રકમાંકનં.-અજન/વ.મં/વિવેકાધિન/૬૨૩-૬૨૫ / ૨૦૧૯-૨૦ / તા.: ૧૯-૦૮-૨૦૧૯ થી વ.ન.પા. હદમાં આદિવાસી વિસ્તારમાં બોરીગ બનાવવાના કામે બચત થયેલ ગ્રાન્ટમાંથી નવા વિકાસલક્ષી કામો કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૫૪ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, જીલ્લા આયોજન,વલસાડ પત્રકમાંક નં.- આયોજન / સં.મ / વિ. આયો. દરખાસ્ત / ૨૦૧૮ / ૮૭૮-૮૮૮ / તા.:૨૯-૧૨-૨૦૧૮ થી આવેલ પત્રમાં જણાવ્યા મુજબ વિકેન્દ્રીત જીલ્લા આયોજન કાર્યક્રમ વર્ષ : ૨૦૧૯-૨૦ ના વર્ષમાં રૂા.૨૫.૦૦ લાખના કામોનું આયોજન કરવાનું જણાવેલ છે. સદર ગ્રાન્ટ અન્વયે જિલ્લા આયોજન, વલસાડપત્ર ક્રમાંક નં.- અજન / વ.મં / વિવેકાધિન / ૬૨૩ - ૬૨૫ / ૨૦૧૯-૨૦ / તા.: ૧૯-૦૮-૨૦૧૯ વલસાડ નગરપાલિકા હદમાં આદિવાસી વિસ્તારમાં બોરીગ બનાવવાના કામની જરૂરી સૈધ્ધાંતિક મંજૂરી મેળવેલ છે. સદર કામગીરી કરવાના કામે ઓનલાઈન ટેન્ડર કરી ટેન્ડર (આઈ.ડી. નં.- ૩૭૯૯૯૧) મંગાવવામાં આવતા મુદત દરમ્યાન કુલ-૦૨(બે) ટેન્ડરો આવેલા છે.સદરહું આવેલ ટેન્ડર ડોક્યુમેન્ટ તા.: ૨૧-૧૨-૨૦૧૯ ના રોજ ચીફ ઓફીસરશ્રી, મે.પ્રમુખશ્રી, તેમજ ચેરમેનશ્રી, કારોબારી સમિતિ રૂબરૂ ખુલ્લા કરવામાં આવેલ, અને ઓનલાઈન ટેન્ડર તા.:૨૩-૧૨-૨૦૧૯ ના રોજ ખુલ્લા કરવામાં આવેલ, સદરહું ખુલ્લા કરવામાં આવેલ ટેન્ડરોનું તુલનાત્મક પત્રક જોતાં એકંદરે ઠેકેદારશ્રી ભરતકુમાર એ.ઓડેદરા, વલસાડનું ટેન્ડર એસ્ટીમેટેડ કોસ્ટ રૂા.૧૩,૦૫,૫૭૪/- કરતાં ૯૯.૦૦% ઉંચા ભાવથી આવેલ છે. જેથી ઉંચા ભાવ મુજબ રૂા.૨૫,૯૮,૦૯૨.૨૬/- પુરાનું ટેન્ડર આવેલ છે.

સદરહું આવેલ ભાવો ખુબજ ઉંચા આવેલ છે.જેથી સદરહું કામ રદ કરી નીચે જણાવ્યા મુજબના નવા વિકાસલક્ષી કામો કરવા અંગેની જરૂરી નિયમોનુસારની આગળની કાર્યવાહી કરાવવાનું તથા ફાળવેલ ગ્રાન્ટ કરતાં જો ખર્ચની રકમ વધુ થશે તો તે વધારાનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળ માથી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	વોર્ડ નં.	કામની વિગત	કામનો પ્રકાર	એસ્ટીમેટની રકમ
૧	૧૧	વાલિયા ફળિયા ફોગાભાઈના ઘર થી નગાભાઈના ઘર સુધી તથા ભીખાભાઈના ઘર થી રામભાઈના ઘર સુધી	વરસાદી ગટર	૧૫૯૩૪૦૦
			કુલ રકમ રૂા.	૧૫૯૩૪૦૦

સ.મ.મંજૂર..

કા.નં. - ૮૩

વિષય :

વલસાડ નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોમાં ડામર રોડ મે.ભાવિન કન્સ્ટ્રક્શન કું વડોદરાએ બનાવેલ છે. વલસાડ શહેરમાં જુદા જુદા સ્થળ ઉપર અંદાજે ૩૦ જેટલા રસ્તાની કામગીરી બંને ટેન્ડરમાં જણાવ્યા મુજબ કરાવવામાં આવેલ છે. જે રસ્તાઓને લાગુ રોડ તથા વધુ પહોળાઈમાં તથા લંબાઈ રસ્તો ખોદીને નવો રસ્તાની કામગીરી પેટે અંદાજે રૂ.૫૮૬૫૮૧૫/- વધારાની કામગીરી ભાવિન કન્સ્ટ્રક્શન કું.વડોદરાએ કરેલ.જેનું ચુકવણું કરવાનું મંજુર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૫૭ / તા.:૧૮-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, મે. ભાવિન કન્સ્ટ્રક્શન કંપની વડોદરાની તા.: ૦૪ / ૧૦ / ૨૦૨૦ ની અરજી નગરપાલિકા આવક નં.૨૮૦૬ / તા.: ૦૮-૧૦-૨૦૨૦ ની અરજી અત્રેની શાખાને મળેલ છે. સદરહું ઠેકેદારશ્રીએ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ નામદાર સરકારશ્રીની ૧૪ માં નાણાપંચ (૨૦૧૮-૧૯) ની યોજના હેઠળ ડામર રસ્તા બનાવવાના કામો કરવામાં આવેલ છે. સદરહું કામોના ટેન્ડર આઈ.ડી.નં. ૩૪૦૫૪૫ તથા ટેન્ડર આઈ. ડી. નં. ૩૪૦૫૫૬ થી મંજુર થયેલ ટેન્ડર મુજબ સદરહું એજન્સીએ ડામર રોડના કામો કરવામાં આવેલ છે.

વિશેષમાં વલસાડ શહેરમાં જુદા જુદા સ્થળોએ અંદાજે ૩૦ જેટલાં રસ્તાની કામગીરી બંને ટેન્ડર આઈ.ડી.માં જણાવ્યા મુજબ સદરહું એજન્સી પાસેથી ડામર રસ્તા બનાવવાની કામગીરી કરાવવામાં આવેલ છે. જે તે સ્થળોએ ડામર રસ્તા બનાવવાની કામગીરી દરમ્યાન સદરહું વિસ્તારના રહીશો તેમજ સભ્યશ્રીઓની રજુઆતોને ધ્યાનમાં લઈમંજુર રસ્તાને લાગુ રોડ તેમજ લંબાઈ તથા પહોળાઈમાં તેમજ જુનો રસ્તો ખોદી નવો રસ્તો (વોલ ટુ વોલ) બનાવવાના કામગીરી પેટે અંદાજે રૂ.૫૮,૬૫,૮૧૫/- ની વધારાની કામગીરી એજન્સી ધ્વારા કરવામાં આવેલ છે. સદરહું એજન્સી ધ્વારા નગરપાલિકાના નિયત કરવામાં આવેલ ટેન્ડર સ્પેશીફીકેશન મુજબ જે તે સ્થળ ઉપર કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.સદરહું એજન્સી ધ્વારા સ્થળ ઉપર કરેલ કામગીરી રૂ. ૧,૮૮,૧૨,૦૦૦/- જેટલી રકમની કામગીરી પૂર્ણ કરેલ છે. જે અન્વયે નગરપાલિકા ધ્વારા મંજુર કરવામાં આવેલ રકમ રૂ.૧,૨૯,૪૬,૧૮૫/-પુરાનું ચુકવણું એજન્સીને કરવામાં આવેલ છે. જે અન્વયે સ્થળ ઉપર જે તે પ્રકારની વધારાની કામગીરી સ્થળ સ્થિતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. તો કરેલ વધારાની કામગીરીને બહાલ રાખી સદરહું વધારાની કામગીરીનો ખર્ચ રૂ.૫૮,૬૫,૮૧૫/-પુરાનો મંજુર કરવાનું ઠરાવવામાં આવેલ છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૮૪

વિષય :

કોરોના (COVID-19) વૈશ્વિક મહામારીના કપરા સમયમાં વલસાડ તથા તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા રોજગારી અર્થે આવેલ અને પાછા ફરી ન શકેલ હોય એવા લાભાર્થીઓને લોકડાઉનના કારણે મજૂરી ન મળતા પોતાના વતન જવા માટેની વ્યવસ્થા તેમજ જેમના જમવા માટે હોટલ સાંઈ કિરણમાંથી ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલ. જે અંગેના આવેલ જુદા જુદા બીલોનું ચુકવણું કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૫૮ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, હાલ કોરોના (COVID-19) વૈશ્વિક મહામારીના કપરા સમયમાં વલસાડ તથા તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા રોજગારી અર્થે આવેલ અને પાછા ફરી ન શકેલ હોય એવા લાભાર્થીઓને લોકડાઉનના કારણે મજૂરી ન મળતા પોતાના વતન જવા માટેની વ્યવસ્થા અત્રેની કચેરી ધ્વારા કરવામાં આવી હતી જેમના જમવા માટે હોટલ સાંઈ કિરણમાંથી ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી જે અંગેના નીચે જણાવ્યા પ્રમાણેના આવેલ હોટલ સાંઈ કિરણ, સ્ટેશનરોડ, વલસાડના જુદા જુદા બીલોનું ચુકવણું કરવા અંગેની જરૂરી આગળની કાર્યવાહી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

અ.નં.	આવક નંબર / તારીખ.	બીલની રકમ	
૧	૪૨૧ / ૨-૬-૨૦૦૦	૧૭,૫૦૦-	
૨	૪૧૮ / ૨-૬-૨૦૦૦	૭૦૦૦-	
૩	૪૨૨ / ૨-૬-૨૦૦૦	૨૪,૫૦૦-	
૪	૪૨૦ / ૨-૬-૨૦૦૦	૧૭,૫૦૦-	
૫	૪૧૬ / ૨-૬-૨૦૦૦	૨૪,૫૦૦-	
૬	૪૧૯ / ૨-૬-૨૦૦૦	૧૨,૬૦૦-	
૭	૪૧૭ / ૨-૬-૨૦૦૦	૭,૦૦૦-	

સ.મ.મંજૂર..

કા.નં. - ૮૫

વિષય :

વિષય : વલસાડ નગરપાલિકા હદમાં વલસાડ શહેર, અબ્રામા ઝોન અને મોગરાવાડી ઝોન વિસ્તારમાં નવા સ્ટ્રીટ લાઈટ પોલ, ઓફવાયર તેમજ નવા મીટર મુકવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : ફાયર એન્ડ લાઈટ કમીટી ઠરાવ નં - ૦૬ તા.૧૫-૧૦-૨૦૧૮ ની ભલામણ મુજબ, વલસાડ નગરપાલિકા હદ વિસ્તારના શહેરીજનો તથા સભ્યશ્રીઓની સ્ટ્રીટ લાઈટ અંગેની ફરીયાદોના નિકાલ સંદર્ભેની રજૂઆત અંગે નવા પોલ , ઓફ વાયર તથા નવા મીટર મુકવા બાબતે સદર કામગીરી કરવા અંગે ઈચા.લાઈટ ઈન્સ્પેક્ટર તથા અબ્રામા/મોગરાવાડીના આવેલ રીપોર્ટ મુજબ આગળની કાર્યવાહી અર્થે સરકારશ્રીની ગ્રાંટ હેઠળ આવરી લઈ નિયમોનુસારની જરૂરી યોગ્ય કાર્યવાહી કરવાનું નક્કી કરવાનું ઠરાવવામાં આવે છે.

સ્ટ્રીટ લાઈટ પોલ

અ.નં.	વોર્ડ નંબર	વિસ્તાર	પોલની સંખ્યા
૧	૦૧	કાંતિની ચાલ વાળા વિસ્તારમાં	૦૧
૨	૦૧	નવી ચાલ, ઢીમ્મર શેરી વિસ્તારમાં	૦૧
૩	૦૧	રાખોડીયા તળાવ, આંગણવાડીની સામે, જલેબીકૂવા વિસ્તારમાં	૦૧
૪	૦૧	મહાદેવ મંદિર, દેરાફળિયા વિસ્તારમાં	૦૧
૫	૦૧	દુલ્લભ ભગતના મંદિર પાસેના વિસ્તારમાં	૦૧
૬	૦૧	ખડકી ભાગડા, જાહેર જાંજરા સામેના વિસ્તારમાં	૦૧
૭	૦૧	ખડકી ભાગડા, દાજીભાઈ પ્રજાપતિના ઘર પાસેના વિસ્તારમાં	૦૧
૮	૦૧	નાના પારસીવાડ ગેરેજ સામેના વિસ્તારમાં	૦૧
૯	૦૬	નાના તાઈવાડ નર્સરી પાસેના વિસ્તારમાં	૦૧
૧૦	૦૬	નાના તાઈવાડ લાયબ્રેરી વિસ્તારમાં	૦૨
૧૧	૦૬	નરેશ ભંગાર ગોડાઉન પાસેના વિસ્તારમાં	૦૧
૧૨	૦૬	મોટી મહેતવાડ નિરંજન ભટ્ટના ઘર પાસેના વિસ્તારમાં	૦૧
૧૩	૧૦	ભરતભાઈ આહીર વાળો વિસ્તાર, તાપાવાડ વિસ્તારમાં	૧૦
૧૪	૧૦	દેરા ફળિયા વિસ્તારમાં	૦૮
૧૫	૧૦	સુધાનગર કાદરભાઈના ઘર પાસેનો વિસ્તાર	૦૩
૧૬	૧૦	વાલિયા ફળિયા વિસ્તારમાં	૦૮
૧૭	૧૦	નવી નગરી વિસ્તારમાં	૦૫
૧૮	૧૦	બીલીયા ફળિયા વિસ્તારમાં	૦૬

૧૯	૧૦	વાવ ફળિયા જાવેદભાઈના ઘર પાસે તથા રામદેવપીર , તેમજ ટેકરાવાળા વિસ્તારમાં	૧૧
૨૦	૧૦	તુલસીવન રામલાલાના ઘર પાસેના વિસ્તારમાં	૦૧
૨૧	૧૦	રાજન નગર વિસ્તારમાં	૦૬
૨૨	૧૦	લોકો શેડની સામે ઝરાણાપાર્કની બાજુના વિસ્તારમાં	૦૫
૨૩	૧૦	રાધાકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં	૦૬
૨૪	૧૦	મણિબાગ, ૧-૨-૩ વિસ્તારમાં	૦૮
૨૫	૧૦	ગોકુલધામ વિસ્તારમાં	૦૫
૨૬	૧૦	કોલસી ફળિયા, બીનાનગર વિસ્તારમાં	૧૦
૨૭	૧૦	ઠાકોરભાઈ પાર્ક વિસ્તારમાં	૦૪
૨૮	૧૦	સોના પ્લોટ, સોનાનગર વિસ્તારમાં	૦૫
૨૯	૧૦	છેલ્લીવાડી વિસ્તારમાં	૦૫
૩૦	૧૦	તડકેશ્વર વિસ્તારમાં	૦૩
૩૧	૧૦	બીલીયા વિસ્તારમાં	૦૮
૩૨	૧૦	બીના નગર વિસ્તારમાં	૦૧
૩૩	૧૦	પુનિત પ્લોટ વિસ્તારમાં	૦૨
૩૪	૧૦	તડકેશ્વર સોસાયટીમાં	૦૧
૩૫	૦૯	દડીંગ્યા, આમલી પાસેના વિસ્તારમાં	૦૧
૩૬	૦૯	આર.પી.એફ. કૂવા પાસેના વિસ્તારમાં	૦૧
૩૭	૦૯	મિશન કોલોની સુથારચાલ વિસ્તારમાં	૦૧

ઓફવાયર

અ.નં.	વિસ્તાર	ઓફ વાયર (મીટરમાં)
૧	વાલિયા ૩ ની ફેક્ટરી થી કાકરાશેરી નેશનલ હાઈવે સુધી	૬૮૦
૨	વાવ ફળિયા, નવીનગરી, તાપાવાડ, નાયકીવાડ વિસ્તારમાં	૭૦૦
૩	વાલીયા ફળિયા વિસ્તારમાં	૧૮૦

સ્ટ્રીટ લાઈટ મીટર

અ.નં.	વિસ્તાર	સ્ટ્રીટ લાઈટ મીટર
૧	બીલીયા ફળિયા વિસ્તારમાં	૦૧
૨	વાવ ફળિયા વિસ્તારમાં	૦૧
૩	ધરમપુર રોડ, મેલડીમાતાના મંદિર વિસ્તારમાં	૦૧

સ.મ.મંજૂર....

કા.નં. - ૮૬

વિષય :

વલસાડ નગરપાલિકાનો સને.૨૦૨૦-૨૦૨૧નો તા.:૦૧ / ૦૪ /૨૦૨૦ થી તા.: ૩૦/૦૬/૨૦૨૦ સુધીનો ત્રી-માસિક હિસાબ તથા સને.૨૦૨૦-૨૦૨૧નો તા.:૦૧ / ૦૪ /૨૦૨૦ થી તા.: ૩૦/૦૯/૨૦૨૦ સુધીનો છ-માસિક હિસાબ મંજૂર કરવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૫૯ / તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, વલસાડ નગરપાલિકાનો સને.૨૦૨૦-૨૦૨૧નો તા.:૦૧/ ૦૪ /૨૦૨૦ થી તા.:૩૦/૦૬/૨૦૨૦ સુધીનો ત્રી-માસિક હિસાબ તથા સને.૨૦૨૦-૨૦૨૧નો તા.:૦૧ / ૦૪ /૨૦૨૦ થી તા.: ૩૦/૦૯/૨૦૨૦ સુધીનો છ-માસિક હિસાબ સુધારા વધારા સહિત મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

કા.નં. - ૮૭

વિષય :

વારિગૃહ શાખામાં વાલ્વમેન તરીકે રોજમદાર પગારદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારી મગનભાઈ ખાલપભાઈ પટેલને ઔદ્યોગીક એક્ટ મુજબ ગ્રેજ્યુઈટી ચુકવવા બાબતનું આવેલ કામ મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત..

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ.:-

કા.સ.ઠ.નં.- ૨૬૦/ તા.:૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ, વલસાડ નગરપાલિકા- વલસાડના વારિગૃહ શાખામાં વાલ્વમેન તરીકે રોજમદાર પગારદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારી મગનભાઈ ખાલપભાઈ પટેલ, તા.: ૩૧-૦૮-૨૦૨૦ ના રોજ નિવૃત્ત થયેલ હતા, તેઓની હંગામી કર્મચારી તરીકેની નોકરીનો કુલ સમયગાળો ૩૭ વર્ષ (મહત્તમ ૩૩ વર્ષ) થાય છે. જે હકીકત ધ્યાને લઈ તેઓને સદરહુ એક્ટ મુજબ નીચે જણાવ્યા પ્રમાણેની ગ્રેજ્યુઈટી ચુકવવા અંગેની જરૂરી નિયમોનુસારની કાર્યવાહી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

- દૈનિક વેતન રૂ. ૩૩૨.૫૦

- ગ્રેજ્યુઈટીની રકમ રૂ. ૩૩૨.૫૦ × ૧૫ × ૩૩ = રૂ. ૧,૬૪,૫૮૮/-

સ.મ.મંજૂર..

કા.નં. - ૮૮

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી નિતેશભાઈ મહાદેવભાઈ વશી અને સભ્યશ્રી મહેબૂબ(ઝાકીર) ગુલશેરખાન પઠાણની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.(તા.૦૨-૦૫-૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ મિલકત વેરામાં રાહત બાબત)

દ.મુ. નિતેશભાઈ મહાદેવભાઈ વશી
ટે.આ.ગુલશેરખાન પઠાણ

ઠરાવ : વલસાડ નગરપાલિકા દર વર્ષેજૂનમાસમાં કુલ વેરામાં ૧૦% રાહત આપેલ છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં સભ્યશ્રી નિતેશભાઈ મહાદેવભાઈ વશી તથા સભ્યશ્રી ગુલશેરખાન પઠાણની ૫૧(૩)ની રજુઆત બાબતે ચર્ચામાં કરવામાં આવેલ કે આ બાબતે સરકારશ્રીનો આદેશ નું પાલન કરવામાં આવેલ છે. જેથી સદર બાબત નીતિવિષયક હોય , સરકારશ્રીની સૂચનાનો અમલ થયેલ છે.

કોવિડ-૧૯ ના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા વાણિજ્ય એકમોને ટેક્ષમાં રાહત આપવાનો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. તેનો લાભ સદર મિલકત ધારકોએ લીધેલ છે. સરકારશ્રીના આદેશનું પાલન કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર..

કા.નં. - ૮૮

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી
ગીરીશભાઈ દેસાઈની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત. (તા.૦૮-૦૫-૨૦૨૦ ની અરજીમાં
જણાવ્યા મુજબ મિલકત વેરામાં રાહત બાબત)

દ.મુ. ગીરીશ દેસાઈ

ટે.આ.મહેબુબ ગુલશેરખાન પઠાણ

ઠરાવ : સદરહુ કામ સામાન્ય સભામાં નક્કી થયા મુજબ ભંગાર પ્રકરણમાં નગરપાલિકાના
મુખ્ય ઈજનેરશ્રી હિતેષભાઈ પી.પટેલ દ્વારા FIR ફાવવા માટે નિમાણુક કરવામાં આવે છે. તેથી
તેમણે FIR કરવાની રહે છે. અને ભંગાર પ્રકારમાં જે તે કસુરવાર સામે ખાતાકીય તપાસ કરવા
મામલતદાર કક્ષાના અથવા સક્ષમ અધિકૃત અધિકારીની નિમાણુક કરી કાયદેસરના પગલાં ભરવા માટે
સર્વાનુમતે ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર...

કા.નં. - ૯૦

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી ઉજ્જેશકુમાર આઈ. પટેલની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.(તા.૨૦-૦૭-૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ નવા શોપીંગ સેન્ટર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, પ્રધાનમંત્રી આવાસ યોજના બાબત)

દ.મુ. ઉજ્જેશકુમાર ઈશ્વરલાલ પટેલ

ટે.આ.યશેષ માલી

ઠરાવ : વલસાડ નગરપાલિકાના હિસાબી શાખામાં બજેટ વર્ષ ૨૦૧૮-૧૯ , ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ માં સ્ટ્રોમવોટર ડ્રેનેજ માહે માં નવા શોપીંગ સેન્ટરનો ખર્ચ કરેલ એવું દર્શાવવામાં આવેલ હતું. આ બાબતે ચર્ચા કરતાં એકાઉન્ટ ઓફિસર દ્વારા જવાબ આપ્યો , સદરહુ ખર્ચ કેપીટલ ખર્ચના હેડમાં નવા શોપીંગ સેન્ટરનો ખર્ચ દર્શાવવામાં આવેલ હતો. અને કેપીટલ ખર્ચ ડ્રેનેજ પાઈપલાઈનની જગ્યાએ પંપીંગ સ્ટેશન મશીનરીમાં શરતચુક થી દર્શાવવામાં આવેલ હતો. આ બાબતે એકાઉન્ટ ઓફિસરને ભવિષ્યમાં આ અંગે ચોકસાઈથી કામગીરી કરવા ધ્યાન દોરવામાં આવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતે આવાસો માટે અરજદારે અરજી કરેલ અને જે અરજદાર હકકદાર છે તેમણે જ આવાસો આપવા જો કોઈ ગેરરીતિ થયેલ હોય તો તપાસ કરી આ બાબતે ઈજનેરશ્રી ને રિપોર્ટ તૈયાર કરી આગામી જનરલ બોર્ડમાં રજુ કરવાનું ઠરાવવામાં આવ્યું.

સ.મ.મંજુર...

કા.નં. - ૯૧

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી યશોભાઈ જે. માલીની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.(તા.૨૦-૦૭-૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ ધોબીતળાવ, નાની મહેતવાડ વિસ્તારમાં પાણી માટે બુસ્ટર વ્યવસ્થા બાબત)

દ.મુ. યશોભ જે.માલી
ટે.આ.ઉજ્જેશભાઈ પટેલ

ઠરાવ : વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી માટે પૂરતું પ્રેશર મળી રહે તે માટે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબ સભ્યશ્રી યશોભાઈ જે. માલીએ અરજીની રજૂઆત કરેલ જે બાબતે ચર્ચામાં આ કામે ઈજનેરશ્રી વોટરવર્ક્સ દ્વારા હકીકતલક્ષી વિગતવાર અહેવાલ તૈયાર કરી આગામી જનરલ બોર્ડમાં રજૂ કરવાનું ઠરાવવામાં આવ્યું.

સ.મ.મંજુર...

કા.નં. - ૯૨

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી રાજેશભાઈ મંગુભાઈ પટેલની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.
(તા.૨૦-૦૭-૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ પીવાના પાણીની લાઈન બાબત.)

દ.મુ. રાજેશભાઈ મંગુભાઈ પટેલ
ટે.આ.ઉર્વશીબેન પટેલ

ઠરાવ : વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી રાજેશભાઈ મંગુભાઈ પટેલની અરજી બાબતે ઈજનેરશ્રી વોટર વર્ક્સ શાખા દ્વારા હકીકતલક્ષી વિગતવાર અહેવાલ તૈયાર કરી આગામી જનરલ બોર્ડમાં રજુ કરવાનું ઠરાવવામાં આવ્યું.

સ.મ.મંજુર...

કા.નં. - ૮૩

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી રાજેશભાઈ મંગુભાઈ પટેલની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.
(તા.૨૦-૦૭-૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ ધરમપુરોડ ઉપર ફૂટપાથ અને સાઈકલ ટ્રેક બાબત)

દ.મુ. રાજેશભાઈ મંગુભાઈ પટેલ
ટે.આ.ઉર્વશીબેન પટેલ

ઠરાવ : વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી રાજેશભાઈ મંગુભાઈ પટેલની અરજી બાબતે ઈજનેરશ્રી પ.વ.ડી. શાખા, ઈજનેરશ્રી અમૃત યોજના અને એકાઉન્ટસ ઓફિસર ને રજુ કરેલ દરખાસ્ત અન્વયે હકીકતલક્ષી વિગતવાર અહેવાલ તૈયાર કરી આગામી જનરલ બોર્ડમાં રજુ કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર...

કા.નં. - ૯૪

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી ઉર્વશી આર. પટેલની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.

(તા.૨૦-૦૭-૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ આવાસ યોજનાના કામ બાબત.)

દ.મુ. રાજેશભાઈ મંગુભાઈ પટેલ

ટે.આ.ઉર્વશીબેન પટેલ

ઠરાવ : વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) હેઠળની દરખાસ્ત તા.૨૦-૦૭-૨૦૨૦ ના રોજ આવેલ છે. જે બાબતે સામાન્ય સભામાં ચર્ચામાં નક્કી કરવામાં આવ્યું કે ઈજનેરશ્રી આવાસ યોજનાને આ બાબતે રજુ કરેલ દરખાસ્ત અન્વયે હકીકતલક્ષી વિગતવાર અહેવાલ તૈયાર કરી આગામી જનરલ બોર્ડમાં રજુ કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર...

કા.નં. - ૯૫

વિષય :

ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) મુજબના કામ માટે સભ્યશ્રી સોનલબેન કે. પટેલની ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.

તા.૨૦-૦૭-૨૦૨૦ ની અરજીમાં જણાવ્યા મુજબ EESL કંપની લાઈટ બાબત.

દ.મુ. સોનલબેન કે.પટેલ

ટે.આ.ઉર્વશીબેન પટેલ

ઠરાવ : વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) હેઠળની દરખાસ્તની રજૂઆત બાબતે (૧) ઈજનેરશ્રી પ.વ.ડી. (લાઈટ શાખા) (૨) એકાઉન્ટસ ઓફિસર (હિસાબી શાખા) ને રજુ કરેલ દરખાસ્ત અન્વયે હકીકતલક્ષી વિગતવાર અહેવાલ તૈયાર કરી આગામી જનરલ બોર્ડમાં રજુ કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર...

કા.નં. - ૯૬

વિષય : ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૫૧(૩) હેઠળની દરખાસ્ત બાબત.

દરખાસ્ત મૂકનાર : મહેબુબ (ઝાકિર) ગુલશેરખાન પઠાણ
ટેકો આપનાર : નિતેશભાઈ એમ.વશી

ઠરાવ :

તા.૦૮-૦૮-૨૦૨૦ ની અરજી બાબત, વલસાડ નગરપાલિકા ચાર સભ્યોશ્રીઓ

(૧) રાજેશ મંગુભાઈ પટેલ,

(૨) ઉજ્જેશ આઈ. પટેલ,

(૩) યશોષ જે. માલી,

(૪) પ્રવિણ પી. ભાનુશાલી

સદર જણાવેલ સભ્યો સામે કલમ-૩૭ હેઠળની કાર્યવાહી ચાલી રહેલ છે. આ બાબતે સભ્યશ્રી મહેબુબ (ઝાકિર) ગુલશેરખાન પઠાણની ધી ગુજરાત મ્યુનિસિપલિટી એક્ટની કલમ-૫૧(૩) હેઠળની દરખાસ્ત કરતી અરજી તા.૦૮-૦૮-૨૦૨૦ ના રોજ આવેલ હતી. જે દરખાસ્તને ટેકો સભ્યશ્રી નિતેશભાઈ એમ.વશી એ આપેલ છે. કલમ-૩૭ હેઠળની કાર્યવાહી અટકાવવા બાબતે તા.૨૮-૦૧-૨૦૧૯ ની સામાન્ય સભાના દિવસે ઈલેક્ટ્રીસિટી/પાવર સપ્લાય બંધ થવાથી સભામાં પાછળ બેઠેલા સભ્યોની રજૂઆત ડાયસ્થ સુધી પહોંચી શકિત ન હતી. જેથી સભ્યોશ્રીઓએ તેઓની રજૂઆત કરવાની હોવાથી ડાયસ્થ સુધી જવાની જરૂરીયાત જણાતા ડાયસ્થ સુધી સભ્યશ્રીઓ તેઓની રજૂઆત કરવા માટે ગયેલ હતા. સભ્યોશ્રીઓ પણ પ્રજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય , પ્રજના પ્રશ્નોની રજૂઆતો કરવાની હોય છે. તે મુજબ સદર ચાર સભ્યોશ્રીઓએ તેઓની રજૂઆત કરેલ છે. તેઓનો એવો કોઈ ખરાબ બદ ઈરાદો સભામાં ખલેલ પહોંચાડવાનો ન હતો. સૌનો સાથ સૌનો વિકાસ સૌએ સાથે મળીને કરવાનો હોય છે. એવું મંતવ્ય તેઓ ધરાવતા આવેલ છે.

તા.૦૮-૧૧-૨૦૨૦ ના રોજની સમગ્રસભામાં સભ્યોશ્રીઓએ પણ આ બાબતની નોંધ લઈ કલમ-૩૭ હેઠળ ચાલતી કાર્યવાહી પડતી મુકવા સદર સભા સર્વાનુમતે વિનમ્રભાવે માનનીય કમિશ્નર સાહેબશ્રી, નગરપાલિકાઓને રજૂઆત કરવાનું ઠરાવે છે.

સ.મ.મંજુર...

વ.કા.નં. - ૦૧

વિષય :

વલસાડ નગરપાલિકા હસ્તકના ડીઝલ-ડી વોટરીંગ પંપ સેટ રીપેરીંગ માટે જરૂરી માલ-સમાન ખરીદ કરવામાં કામ બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ .ઠ.નં.૮૨ તા.૧૮-૦૭-૨૦૨૦ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકા -ડી વોટરીંગ પંપ સેટ રીપેર કરી સ્ટે ટુ પોઝીશનમાં રાખવા માટે નામદાર સરકારશ્રી તરફથી સુચના મળેલ છે. હાલે ચોમાસાની સીઝનમાં રોજ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના બનાવો બનતા હોય છે. જેનો સત્વરે નિકાલ કરવાનો થતો હોય , કામની અગત્યતાને લઈને વલસાડ સ્થાનિક ફિલ્ડ માર્શલ એજન્સી, સ્ટેડિયમ રોડ, વલસાડના ભાવપત્રક અત્રેની કચેરીએ મળેલ છે. તો તે અંગેનું ખર્ચ રૂ.૬૩,૮૭૫/- જનરલ બોર્ડની મંજૂરતની અપેક્ષાએ મંજૂર કરી ફિલ્ડમાર્શલ એજન્સી, વલસાડ પાસેથી ખરીદ કરવામાં આવેલ, જેના આવેલ બિલો મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર...

વ.કા.નં. - ૦૨

વિષય :

વલસાડ વિસ્તાર વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજનાને સરકારશ્રીની મંજૂરી અર્થે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૬(૧) હેઠળ સરકારશ્રીમાં સાદર કરવા અંગેના ટાઉન પ્લાનીંગ અને સીટી ઈમ્પ્રુવમેન્ટ કમીટી તા.૨૪-૦૯-૨૦૨૦ મીટીંગના ઠરાવ નં-૧ ને બહાલી આપવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ. સોનલબેન ટી.સોલંકી

ઠરાવ : ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૯ હેઠળ વલસાડ વિસ્તાર વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજનાની દરખાસ્તો નામદાર સરકારશ્રીમાં તા.૨૪-૧૨-૨૦૧૯ ના રોજ અધિક મુખ્ય સચિવશ્રી , શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ , ગાંધીનગરને સાદર કરવામાં આવેલ છે. તથા દરખાસ્તોની જાહેર પ્રસિધ્ધ થતાં સ્થાનિક વર્તમાન પત્ર સંદેશ , દિવ્યભાસ્કર તથા અંગ્રેજી દૈનિક વેસ્ટર્ન ટાઈમ્સમાં તા.૨૭-૧૨-૨૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ. અધિનિયમની જોગવાઈ મુજબ બે માસમાં મળેલ વાંધા અરજી નં-૧ થી ૧૪૪ અંગે તા.૨૪-૦૯-૨૦૨૦ ના રોજ મળેલ ટાઉન પ્લાનીંગ અને સીટી ઈમ્પ્રુવમેન્ટ કમીટીમાં ઠરાવેલ પત્રક (એનેક્સર-એ) મુજબ નિર્ણય કરવામાં આવેલ છે. તથા અધિનિયમની કલમ - ૧૬(૧) હેઠળ વલસાડની મુસદ્દારૂપ તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના સરકારશ્રીની મંજૂરી અર્થે સાદર કરવા ઠરાવ નં-૧ થી ઠરાવવામાં આવેલ છે. જે યોગ્ય જણાતું હોવાથી જરૂરી ચર્ચા-વિચારણા મુજબ ટાઉન પ્લાનીંગ અને સીટી ઈમ્પ્રુવમેન્ટ કમીટી ના ઠરાવ નં-૧ ને આથી સર્વાનુમતે બહાલી આપવામાં આવે છે.

વિકાસ યોજનાની દરખાસ્તોને અધિનિયમની કલમ ૧૭(૧) હેઠળ નામદાર સરકારશ્રીની મંજૂરી મેળવવા અધિનિયમની કલમ-૧૬(૧) હેઠળ નામદાર સરકારશ્રીને તા.૨૪-૦૯-૨૦૨૦ ના રોજ અત્રેથી સાદર કરેલ છે તે યોગ્ય હોય તેને બહાલી આપવામાં આવે છે.

સ.મ.મંજુર...

વ.કા.નં. - ૦૩

વિષય : રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ફેરીયાઓને સહાય ઘટક હેઠળ સીટી સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાનને સામાન્ય સભામાં મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ફેરીયાઓને સહાય ઘટક હેઠળ “ ધી સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડીંગ) એક્ટ ,૨૦૧૪ ” કલમ-૨૧ વંચાણે લેવામાં આવી.”ધી સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ ,૨૦૧૪” ની કલમ (૧) અન્વયે જી.યુ.એલ.એમ. દ્વારા નક્કી કરાયેલ એજન્સી દ્વારા તૈયાર કરાયેલ સીટી સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન જે ટાઉન વેન્ડીંગ કમિટીની ભલામણ સાથે રજૂ કરાયેલ છે. તેને આજની સામાન્ય સભામાં પુખ્ત ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે/બહુમતીથી ગ્રાહ્ય રાખવા આથી ઠરાવવામાં આવેલ છે. તથા ધી સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડીંગ) એક્ટ ,૨૦૧૪ ”ની કલમ ૨૧(૨) અન્વયે રાજ્ય સરકારશ્રીને આગળની કાર્યવાહી માટે મોકલી આપવા ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર...

વ.કા.નં. - ૦૪

વિષય : કા.સ.ઠ.નં-૫૮/૧૮-૦૭-૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ વલસાડ નગરપાલિકામાં એડલોક મદદનીશ ઈજનેર વર્ગ-૩ (ડીપ્લોમા સિવિલ) ની જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારીત જગ્યા ઉપર પુનઃ સ્થાપિત કરવા અંગેની શ્રી મયુર જી.આસ્વાનીની આવેલ અરજી અંગે જરૂરી નિર્ણય થવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ. નં. ૫૮ / ૧૮-૦૭-૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ વલસાડ નગરપાલિકામાં હાલે વોટરવર્ક્સ શાખામાં મદદનીશ ઈજનેરની જગ્યા ખાલી છે. આ જગ્યામાં એડલોક મદદનીશ ઈજનેર વર્ગ-૩ (ડીપ્લોમા સિવિલ) ની જગ્યા ફક્ત ૧૧ માસમાં કરાર આધારીત તરીકે ફરજ પર પુનઃ સ્થાપિત કરવા અંગેની શ્રી મયુર જી.આસ્વાની ની આવેલ અરજી વંચાણે લેતા સદર કામે ચર્ચા કરતાં નગરપાલિકામાં હાલે વારિગૃહ શાખા , ડ્રેનેજ શાખા , ફાયર એન્ડ લાઈટ શાખાની કામગીરી હાલે એકજ ઈજનેર કરતાં આવેલ છે. જેથી જેના કારણે તમામ કામોમાં પહોંચી વળાય એમ નથી. અને કામગીરીમાં વિલંબ થાય છે. અને સદરહુ કામગીરી આવશ્યક સેવામાં આવતી હોય , જે હકીકતને ધ્યાને લઈ નગરપાલિકામાં એડલોક મદદનીશ મ્યુનિસિપલ ઈજનેર વર્ગ-૩ (ડીપ્લોમા સિવિલ) ની જગ્યા ભરવી આવશ્યક હોય , ફક્ત ૧૧ માસના કરાર આધારીત ઈજનેરની નિમાણુક કરવા બાબતે સરકારશ્રીની આવાસ યોજનામાં ઈજનેરો લેવા માટે સરકારશ્રીમાં નિયમોનુસારની દરખાસ્ત કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર...

વ.કા.નં. - ૦૫

વિષય : હોસ્પિટલ કમિટી ઠરાવ નં. -૨૭/ તા.૩૦-૦૯-૨૦૨૦ થી ભલામણ મુજબ મ્યુનિસિપલ હોસ્પિટલ માટે જરૂરી એવો નર્સિંગ /પેરા મેડીકલ/સ્વીપર વિગેરે સ્ટાફને પુરો પાડનાર વિશ્વ એન્ટરપ્રાઈઝ મહેસાણાનો તા.૩૧-૧૦-૨૦૨૦ થી કરાર પુર્ણ થતો હોય જે વધુ એક વર્ષ માટે રિન્યુ કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ. નં. ૨૬૧ / ૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ મ્યુનિસિપલ હોસ્પિટલ માટે જરૂરી એવો નર્સિંગ /પેરા મેડીકલ/સ્વીપર તથા અન્ય સ્ટાફ માટે સરકારશ્રીની સુચના અન્વયે આઉટ સોર્સિંગથી ભરતી કરવાનો થાય છે. સદરહુ સ્ટાફ હાલે વિશ્વ એન્ટરપ્રાઈઝ-મહેસાણાનો કોન્ટ્રાક્ટ તા.૩૦-૦૯-૨૦૨૦ સુધીનો કરાર કરવામાં આવેલ છે. અને હાલની હોસ્પિટલ કમિટીમાં સદરહુ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા અંગેના રીપોર્ટ ઉપર પણ ચીફ ઓફિસરશ્રીની સહીઓ કરવામાં આવેલ છે. પરંતુ સદરહુ કોન્ટ્રાક્ટર દ્વારા હાલે ટેલીફોનીક જાણ કરી કોન્ટ્રાક્ટ ન રીન્યુ કરવા માટે આજ કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ સદરહુ કોન્ટ્રાક્ટરની જગ્યાના બદલામાં અન્ય કોઈ એજન્સીની નિમણૂક કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અંગે ચીફ ઓફિસરશ્રીને સત્તા આપવાનું ઠરાવેલ છે. તે મુજબ તા.૧૨-૧૦-૨૦૨૦ થી શક્તિ સિક્યુરિટી,તાડવાડ,રદિર,સુરત સાથે હોસ્પિટલ માટે આઉટ સોર્સિંગ સ્ટાફ પુરો પાડવા બાબતે કરાર થયેલ હોય, હો.જા.નં.- ૮૨૯/તા.૧૪-૧૦-૨૦૨૦ થી વર્કઓર્ડર આપી નીચે જણાવ્યા મુજબનો સ્ટાફ જરૂરી લાયકાત ધરાવતો ફાળવવા અંગેની કાર્યવાહી કરેલ , જેને બહાલ રખવાનું ઠરાવવામાં આવે છે

અ.નં.	જગ્યાનું નામ	સંખ્યા	મેલ/ફિમેલ	શૈક્ષણિક લાયકાત
૧	સ્ટાફ નર્સ	૦૪	ફિમેલ	જી.એન.એમ.
૨	વોર્ડ આયા	૦૨	ફિમેલ	એસ.એસ.સી. પાસ
૩	વોર્ડ બોય	૦૨	મેલ	એસ.એસ.સી. પાસ
૪	ડ્રાઈવર	૦૧	મેલ	હેવી લાયસન્સ ધરાવતા હોય
૫	લેબટેકનીશિયલ	૦૧	મેલ / ફિમેલ	ડી.એમ.એલ.ટી.

સ.મ.મંજુર...

વ.કા.નં. - ૦૬

વિષય :

વલસાડ નગરપાલિકાના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં તથા મોગરાવાડી , અબ્રામા ઝોન વિસ્તારમાં આવેલ જુદા-જુદા વોર્ડમાં સર્વે કરતાં ઘણી બધી LED સ્ટ્રીટલાઈટ બ્લાસ્ટ થઈ ગયેલ છે. LED સ્ટ્રીટ લાઈટ ખરીદ કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં.-૨૬૨/તા.૧૯-૧૦-૨૦૨૦ ની ભલામણ મુજબ વલસાડ નગરપાલિકાના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં તથા મોગરાવાડી-અબ્રામા ઝોન વિસ્તારમાં આવેલ જુદા-જુદા વોર્ડમાં સર્વે કરતાં ઘણી બધી LED સ્ટ્રીટ લાઈટ બ્લાસ્ટ પાવર ઓવર વોલ્ટેજ લોડ વધી જવાના કારણે LED સ્ટ્રીટ લાઈટ બ્લાસ્ટ થઈ ગયેલ છે. જે રીપેર કરી શકે એમ ન હોય , જેથી સભ્યશ્રીઓ તેમજ અરજદારો/નાગરીકોની સ્ટ્રીટ લાઈટ અંગેની વારંવારની ફરિયાદોનો નિકાલ થઈ શકતો ન હોવાના કારણે LED તતકાલિક બદલવાની જરૂરિયાત હોય જે અંગે એનર્જી ઈક્ષીયનન્સી સર્વિસ લીમિટેડના કોન્ટ્રાક્ટરને જાણ કરતાં તેઓ તરફથી બ્લાસ્ટ LED લાઈટ બદલી શકાય એમ નથી. એવું જણાવેલ છે. જે ઉપરોક્ત હકીકતોને ધ્યાને લઈ LED સ્ટ્રીટ લાઈટ ખરીદ કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજુર...

વ.કા.નં. - ૦૭

વિષય :

નામદાર સરકારશ્રીની ૧૪મુ નાણાંપંચની યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ ડામર રસ્તા બનાવવાના કામના આવેલ ટેન્ડરના ભાવો મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ. ભરતભાઈ સી.પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં-૧૩૯/તા.૧૯-૧૦-૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ , નામદાર સરકારશ્રીની ૧૪ માં નાણાંપંચ યોજના (૨૦૧૯-૨૦) હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ ડામર રસ્તા બનાવવાના કામ અન્વયે ઓનલાઈન ટેન્ડર કરતાં ટેન્ડરશ્રી મે.જે.એમ.શાહ,મરોલી L1 (૬.૩૦ % ઉચા ભાવ) અને ટેન્ડરશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની,વડોદરા L2 (૯.૮૫ % ઉચા ભાવ) તરીકે ઓનલાઈન ટેન્ડરમાં મંજૂર થયેલ હતા. પરંતુ સદરહુ કામ અન્વયે ટેન્ડરશ્રી મે.જે.એમ.શાહ ,મરોલી અને ટેન્ડરશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની,નવસારીને જરૂરી ટેન્ડરમાં ભરવામાં આવેલ ભાવો અન્વયે જરૂરી નેગોશીએશન કરવા માટે ટેન્ડરશ્રીઓને અત્રેની કચેરીએ રૂબરૂ મીટીંગ કરવા માટે જરૂરી તા. ૧૬/૦૩/૨૦૨૦ થી પત્રવ્યવહાર કરી ૧૯/૦૩/૨૦૨૦ ના રોજ નગરપાલિકા કચેરી એ હાજર રહેવાની જાણ કરવામાં આવેલ. જેમાં ટેન્ડરશ્રી મે. જે. એમ. શાહ, મરોલી તરફ થી કોઈ હાજર રહેલ નથી કે તેઓ તરફ થી સદર કામે કોઈ પ્રતિઉત્તર પાઠવેલ નથી. અને સદરહુ કામે મીટીંગમાં L2 એજન્સી ટેન્ડરશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની,વડોદરા હાજર રહેતા તેમની જોડે સદરહુ કામે નેગોશીએશન કરવામાં આવતા L2 એજન્સી દ્વારા તા.૧૯-૦૩-૨૦૨૦ ના પત્રમાં જાણાવ્યા મુજબ ટેન્ડરશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની , વડોદરા દ્વારા ઓનલાઈન ટેન્ડરમાં દર્શાવેલ L1 ભાવો કરતાં ૨.૫૦ % ઓછા કરી (એટલેકે ૩.૮૦% ઉચા ભાવ) ઉપરોક્ત કામગીરી કરવા માટે લેખિત સમંતિ આપી કામગીરી કરવા સમંત થયેલ છે. જેથી ઉપરોક્ત ટેન્ડરશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની ,વડોદરા દ્વારા ઉપરોક્ત કામે કરવામાં આવેલ નેગોશીએશન બાદ સદરહુ કામનું ટેન્ડરની રકમ રૂ. ૩૬ ,૨૩,૪૫૦.૪૦ /- પૂરાની રકમથી સદરહુ એજન્સી કામ કરવાની સમંતિ આપવામાં આવેલ છે. જે સંમતિ મુજબ એજન્સીશ્રી ભાવિન કન્સ્ટ્રક્શન કંપની,વડોદરા પાસેથી ઉપરોક્ત કામગીરી કરાવવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર...

વ.કા.નં. - ૦૮

વિષય :

નામદાર સરકારશ્રીની ૧૪મું નાણાંપંચની યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ ડામર રસ્તા બનાવવાના કામના આવેલ ટેન્ડરના ભાવો મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ. ભરતભાઈ સી.પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં-૨૦૨/તા.૧૯-૧૦-૨૦૨૦ થી ઠરાવ્યા મુજબ , નામદાર સરકારશ્રીની વર્ષ : ૨૦૧૯-૨૦ ના વર્ષની ૧૪માં નાણાંપંચની યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ ડામર રસ્તા બનાવવાના કામે નાયબ માહિતી ખાતા મારફતે દૈનિક પેપરમાં બહોળી પ્રસિધ્ધી કરાવી ઓનલાઈન ટેન્ડરીંગ કરવામાં આવતા મુદ્ત દરમિયાન કુલ-૩ ટેન્ડરો આવેલ છે. સદરહુ આવેલ કામના ટેન્ડર ડોક્યુમેન્ટસ અને ઓનલાઈન ટેન્ડર તા.૦૫-૦૩-૨૦૨૦ ના રોજ ખુલ્લા કરવામાં આવેલ છે. સદરહુ ખુલ્લા કરવામાં આવેલ ટેન્ડર નું તુલનાત્મક પત્રક જોતાં એકંદરે ટેન્ડરશ્રી રાજ એન્ડ કંપની , તિથલ રોડ , વલસાડનું ટેન્ડર એસ્ટીમેઈટ ની રકમ રૂ.૧,૨૭,૦૧,૫૦૦/- થી ૪.૦૩% (L1) નીચા ભાવથી આવેલ રકમ રૂ. ૧,૨૧,૮૯,૬૨૯/- નીચા ભાવથી ટેન્ડર આવેલ છે.

વિશેષમાં અગાઉ નામદાર સરકારશ્રીની વ્યવસાયવેરા (૫૦%) (૨૦૧૫-૧૬) યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ ડામર રસ્તા બનાવવાના કામે એજન્સીશ્રી રાજ એન્ડ કંપની , તિથલ રોડ , વલસાડનું કા.સ.ઠ.નં-૪૬/તા.૧૯-૦૫-૨૦૧૭ થી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ હતું. પરંતુ જા.બો.ઠ.નં-૩૪૧/તા.૨૭-૦૭-૨૦૧૭ થી ઠરાવ્યા મુજબ રાજ એન્ડ કંપની, વલસાડ દ્વારા જે કામો કરેલ તે યોગ્ય ગુણવત્તા યુક્ત ન હોય જેથી તેઓને આપવામાં આવેલ વર્કઓર્ડર પૈકીના બાકી કામો રદ કરવામાં આવેલ છે. અને સદરહુ કામો અન્ય એજન્સી પરથી કરવામાં આવેલ છે.

જેથી બાબતને ધ્યાને લેતા વર્ષ : ૨૦૧૯-૨૦ ના વર્ષની ૧૪માં નાણાંપંચની યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ ડામર રસ્તા બનાવવાના કામે એજન્સીશ્રી મે.ભાવિન કન્સ્ટ્રક્શન કંપની, વડોદરા દ્વારા ટેન્ડર એસ્ટીમેઈટ ની રકમ રૂ. ૧,૨૭,૦૧,૫૦૦/- થી ૩.૯૮% (L2) ઉચા ભાવથી આવેલ રકમ રૂ.૧,૩૨,૦૭,૦૧૯.૭૦/- ઉચા ભાવથી ટેન્ડર આવેલ છે. જેથી સદરહુ ઉચા આવેલ ભાવો અન્વયે એજન્સીશ્રી મે.ભાવિન કન્સ્ટ્રક્શન કંપની , વડોદરાને ટેન્ડરમાં આવેલ ભાવોનું જરૂરી નેગોશીએશન કરવા પત્રવ્યવહાર કરવામાં આવેલ. અને એજન્સીશ્રી મે.ભાવિન કન્સ્ટ્રક્શન કંપની, વડોદરાના તા.૧૯-૦૩-૨૦૨૦ ના પત્રમાં જણાવ્યા મુજબ એજન્સી દ્વારા નગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલ ટેન્ડર એસ્ટીમેટેડ કોસ્ટ કરતાં ૨.૦૦ % ઓછા ભાવથી એટલેકે રૂ.૧,૨૪,૪૭,૪૭૦/- પુરાથી કામગીરી કરવાની લેખિત સંમતિ આપવામાં આવેલ છે.

જેથી ઉપરોક્ત બાબતને ધ્યાને લેતા નામદાર સરકારશ્રીની વર્ષ : ૨૦૧૯-૨૦ ના વર્ષની ૧૪માં નાણાંપંચની યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ ડામર

રસ્તા બનાવવાના કામે L1 તરીકે ટેન્ડરશ્રી રાજ એન્ડ કંપની , તિથલ રોડ , વલસાડ દ્વારા ટેન્ડર એસ્ટીમેઈટ રકમથી ૪.૦૩% નીચા ભાવથી આવેલ છે. સદરહુ એજન્સીની કામગીરી ભુતકાળમાં યોગ્ય ગુણવત્તા યુક્ત ન હોવાથી સદરહુ એજન્સી પાસેથી બાકી રહેલ કામો કરાવવામાં આવેલ નથી. જેને ધ્યાને લેતા સદરહુ યોજનાના ડામર રસ્તા બનાવવાની કામગીરી L2 તરીકે ટેન્ડરશ્રી મે.ભાવિન કન્સ્ટ્રક્શન કંપની , વડોદરા પાસેથી સદરહુ કામનું (ટેન્ડર આઈ.ડી.નં-૩૮૮૮૭૭) આવેલ ટેન્ડર અન્વયે સૌથી ઓછા આવેલ એટલે કે રૂા.૧,૨૧,૮૮,૬૨૮/- પુરાથી કામગીરી કરવાનું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર..

વ.કા.નં. - ૦૯

વિષય :

વલસાડ નગરપાલિકાના ને.હા.નં.૪૮ અબ્રામા ખાતે આવેલ મલાણિયું તળાવ PPP ના ધોરણે ડેવલપ કરવાના કામ બાબતે જરૂરી નિર્ણય થવા બાબત.
(સભ્યશ્રી નિતેશભાઈ વશીની રજૂઆત અને ચેરમેનશ્રી, કારોબારી સમિતિની સુચના અનુસાર)

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ને.હા.નં.-૪૮ અબ્રામા ખાતે આવેલ મલાણિયું તળાવ PPP ના ધોરણે ડેવલપ કરવાના કામ બાબતે ચર્ચા કરતાં આ કામે ડીપીઆર તૈયાર કરી આગામી મળનાર જનરલ બોર્ડમાં રજૂ કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર...

વ.કા.નં. - ૧૦

વિષય : સભાખંડ તથા કોન્ફરન્સ રૂમમાં આવેલ એર કન્ડીશનર રીપેરીંગ કરવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. ૪૩ તા.૦૯-૦૭-૨૦૨૦ ની ભલામણ મુજબ શ્રી મોરારજી દેસાઈ ઓડીટોરીયમ તેમજ “3D” મ્યુઝીયમમાં એશી સર્વિસિંગ કરવા અંગે કા.સ.ઠ.નં. - ૨૨૭/ તા.૨૬-૦૯-૨૦૧૬ થી સાગર ડી. થોરાત , ખેરગામના ભાવો મંજૂર કરવામાં આવેલ સદરહુ એજન્સીએ ઉપરોક્ત વર્ષના મંજૂર થયેલ ભાવે કામગીરી કરવા અંગેની તેમની તા.૧૭-૦૨-૨૦૨૦ના રોજની આવેલ અરજી મુજબ લેખિત સંમતિ આપેલ છે. વલસાડ નગરપાલિકામાં સભાખંડ તથા કોન્ફરન્સ રૂમમાં આવેલ એર કન્ડીશનર રીપેરીંગ કરાવેલ, જેનું આવેલ બીલ નં-૧૪૯/તા.૧૩-૧૦-૨૦૨૦ થી રૂ.૪૮૦૦૦/- પૂરા અને બીલ નં-૧૫૦/તા.૧૩-૧૦-૨૦૨૦ થી રૂ.૧૯ ,૨૫૦/- પૂરા એમ મળી કુલ રૂ.૬૭,૨૫૦/- પુરાનું બીલનું ચૂકવણુ કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર...

વ.કા.નં. - ૧૧

વિષય : હોસ્પિટલ શાખાના ક્લાર્કશ્રી અમરીશભાઈ દેસાઈનું વાહનભથ્થું(પેટ્રોલ એલાઉન્સ) મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરણભાઈ પરભુભાઈ ભંડારી
ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : મ્યુનિસિપલ હોસ્પિટલ ઠરાવ નં.- ૨૨/તા.૩૦-૦૯-૨૦૨૦ ની ભલામણ મુજબ અને ચીફ ઓફિસરશ્રીના રીપોર્ટમાં જણાવ્યા મુજબ અને ચીફ ઓફિસરશ્રીના રીમાર્ક અન્વયે વલસાડ નગરપાલિકા કચેરીના ઓફિસર શાખામાં કાયમી ફરજના લીયન ઉપર ચાલી રહેલ છે. હાલે વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના કારણે તેમજ વહીવટી સરળતા ખાતર તેઓની લીયન હળું રાખી વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવેલ છે. સદરહુ જગ્યાએથી વલસાડ નગરપાલિકા મુખ્ય કચેરીએ બીલો , રીપોર્ટ વિગેરેની કામગીરી ઝડપી બને તેવા આશયથી તેઓ પોતાનું વાહનનો ઉપયોગ હોસ્પિટલ થી નગરપાલિકા કચેરી તેમજ જરૂરિયાતના સમયે જે-તે જગ્યાએ હોસ્પિટલના કામે મુસાફરી કરતાં આવેલ છે. જેને ધ્યાને લઈ વલસાડ નગરપાલિકાના અન્ય કર્મચારીઓને જે પ્રમાણે વાહન ભથ્થું (પેટ્રોલ એલાઉન્સ) આપવામાં આવે છે. તે મુજબ તેઓને પણ સદર એલાઉન્સ આપવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર...

વ.કા.નં. - ૧૨

વિષય : વલસાડ નગર સેવા સદનમાં ઓફિસ બિલ્ડીંગમાં બ્યુટીફિકેશન એન્ડ ગાર્ડનીંગ કુંડી વિથ પ્લાન્ટેશનરીનોવેશન પ્લાન્ટેશન, આઉટ દોર પ્લાન્ટ , વર્ટિકલ ગાર્ડન સાથે ૧૦ ફીટ પ્લમ્બીંગ વર્ક ૪૮૫ સ્કે. ફીટ સાથે કામગીરી કરાવેલ જેનું રૂા.૬ ,૭૪,૫૫૭/- પુરાની રકમનું બિલ મંજૂર કરવા બાબત.

દ.મુ. કિરાણભાઈ પરભુભાઈ ભંડારી

ટે.આ.ભરતભાઈ પટેલ

ઠરાવ : કા.સ.ઠ.નં. - ૩૫૬/ તા.૨૭-૧૨-૨૦૧૯ ની ભલામણ મુજબ નામદાર સરકારશ્રી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સીટી બ્યુટીફિકેશન કરવા માટે નવીન નગર સેવા સદન કમ્પાઉન્ડમાં વર્ટિકલ ગાર્ડન બનાવવાની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાને લઈ સદરહુ બાબતે આર્યનંદ પ્રા.લી. અમદાવાદનું કવોટેશન અત્રેની કચેરીએ મળેલ છે. જે અંગે પ્લાન્ટેશન , કુંડા , ઈરીગેશન સિસ્ટમ સાથેનું વર્ટિકલ ગાર્ડન બનાવવા અંગે વહીવટી જા. નં. - ૧૯૯૪ / તા.૦૭-૧૦-૨૦૧૯ થી આર્યનંદ પ્રા.લી. અમદાવાદને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હાલે. સદરહુ વર્ક ઓર્ડરને આધારે ઠેકેદારશ્રી દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી પૂર્ણ કરવામાં આવેલ હતી. આ અંગે કા.સ.ઠ.નં. ૩૫૬ તાર ૨૭-૧૨-૨૦૧૯ થી તેઓ દ્વારા રજુ કરવામાં આવેલ બીલો રૂા.૬ ,૭૪,૫૫૭/- પુરાની રકમના બીલોનું ચુકવણું કરવાનું ઠરાવવામાં આવે છે.

સ.મ.મંજૂર...

સભાનું કામકાજ પુર્ણ થતાં પ્રમુખશ્રીએ સૌનો આભાર વ્યક્ત કરી જાણાવ્યું કે , હવે સભાનું કામકાજ પુર્ણ થાય છે. આપણે સૌ "જન ગણ મન" રાષ્ટ્રગીત થી સભાનું કામકાજ પુર્ણ કરીએ..... "જન ગણ મન" રાષ્ટ્રગીત થી સભા પુર્ણ થઈ.....

નગરપાલિકા કચેરી

વલસાડ.

તા. / /૨૦૨૦.

(કિન્નરીબેન અમિષભાઈ પટેલ)

પ્રમુખ

વલસાડ નગરપાલિકા